

દરિયાપારના બહારવટિયા

એસ્ટન વુલ્ફના અંગ્રેજી પુસ્તક
'આઉટલોઝ ઓફ મોડર્ન ટેક્સ' પરથી

સાધુજિની

પુસ્તક 1932, ભાગ 1946, પુનર્મુદ્રા 1981

તમાર મેયારી સહિતના હેઠળ આપેલી કાળજીમાં 2014

પ્રયોજકનું નિવેદન

અશ્ટન વુલ્ફનું પુસ્તક એ આઉટલોઝ ઓફ મોડર્ન ડેઝ મારો હાથમાં મૂકનાર શામળાસ. કોણના તરુણ પ્રોફેસર ભરુચા છે. છેલ્લાં છ વર્ષોથી પ્રસંગોપાત ત્યાં મંડાતા મારો લોકસાહિત્યના દાયરાઓમાં એ ભાઈ અચ્યુક હાજર હોય છે. રસિક અને અભ્યાસી, એ બને પ્રકારની દાખિએ એમહો આ સાહિત્યનો સમાગમ કર્યો છે. મને આ પુસ્તક મોકલવામાં પણ એમની દાખિમાં રસિકતા તેમ જ તુલનાલક્ષી અભ્યાસીનો સંયોગ હતો. હું તો આ પુસ્તકના લેખન ઉપર મુંઘ બનીને, અને મારો એક સમાનધર્મી યુરોપમાં થઈ ગયો છે એટલી વાતનો સંતોષ લઈને કદાચ પતાવી લેત. પરંતુ ભાઈશ્રી ભરુચાનું નિશાન એટલું જ માત્ર નહોતું. પુસ્તક પરથી આ ચાર કથાઓ મારે દોરવી - અને મારે જ દોરવી - એ એમના આગ્રહને જ આ ચોપડીનો જન્મ આભારી છે. એટલે હું એમનો આભારી છું.

યુરોપી બહારવટિયાઓનાં આ ચરિત્રો ખૂબ ભરોસાદાર છે, કારણ કે એક તો એ તાજેતરમાં બનેલા હોઈ કલ્યાનાના કે લોકકથાના પોપડા એના પર ચડચા નથી ; બીજું, એનો લેખક એક ગુના પકડનાર ચોક્કસ બુદ્ધિનો જગ્બર અમલદાર હતો; ને ત્રીજું, એ તમામ બહારવટિયાની સાથે લેખકનો જીવતો સંપર્ક થયો હતો. એશ્ટન વુલ્ફની દાખિ આ અપરાધીઓ પ્રતિ કેવી હતી તે તો એણે એના નિવેદનમાં કહી આપ્યું છે, તે સ્ક્રિવાય એની દાખિ તો આ ચરિત્રોની લખાવતમાં જ વણાઈ ચૂકી છે. મારે બહારવટિયાના સમગ્ર વિષય પર જે કહેવાનું હતું તે મેં 'સોરઠી બહારવટિયા' (ભાગ ૩)ના લાંબા ઉપોદ્ઘાતમાં કહી દીધું છે. 'બહારવટિયા'ને એક વિદ્યાના વિષય તરીકે તપાસનારાઓ એશ્ટન વુલ્ફના આ પુસ્તકની પડખોપડખ 'સોરઠી બહારવટિયા'ના ત્રણેય ભાગ જરૂર તપાસી જાય એવો આગ્રહ કરું છું અને એવી સમીક્ષાની પરવા જેને ન હોય તેને સારુ તો ખુદ આ ચરિત્રોની જ મોહિની ક્યાં ઓછી છે!

ગુજરાતીમાં આ ચરિત્રો ઉતારવામાં હું એશ્ટન વુલ્ફની હીકિકતોને વક્ષારીશી વળગી રહ્યો છું. દાખિ પણ એની જ પકડવા પ્રયત્ન કર્યો છે. ભાષામાં ઉત્તરેલી પ્રેરકતા પણ એની જ છે. મારું કંઈ હોય તો તે છે મુંઘતા.

એશ્ટન વુલ્ફ દુંગંડના જગપ્રસિદ્ધ જામૂસીખાતા 'ધ સ્કોટલેન્ડ વાર્ડ'ના એક માતબર અધિકારી હતા. યુરોપની અનેક ભાષાઓ બોલનાર તરીકે દેશદેશની અદાલતો—કચેરીઓમાં એમનું સ્થાન એક ધૂરંધર દુભાષિયાનું હતું. એમહો લખેલા 'ધ અન્ડરવર્લ્ડ' નામે પુસ્તકમાં એની અનેક ભયંકર ગુનેગારો સાથેની આપવીતીનો, પોતાના મસ્ત સાહસ-પ્રેમનો અને અપરાધીઓ પ્રત્યેની દિવસોજ સમજબુદ્ધિનો ચિત્તાર છે. એમ પણ સાંભળ્યું છે કે એક વાર

* 'બહારવટયની મીમાંસા' એ નામે આ ઉપોદ્ઘાતને મેં 'ધરતીનું ધાવક' ('લોકસાહિત્ય' ખંડ 2)માં શામિલ કરેલ છે.

એક ખૂનના તલોમતદાર કને જુઈને આ જાપડાએ પેતાને વર્તમાનક રીતવાત કે અન્યાન્યાનું અટપણે માર્ગ ત્વજીવી પોતાના પાપનો સીધો એકચાર કરી નામનાને બોધ આપેલો, ત્વારાનું ધારાશાસ્ત્રીઓએ તુલની આવી માનવતાબરી હરિષયાનગીરી ઓર તાંત્રિક બોલની ના, પરિણામે તુલને સ્કોલેન્ડ વાડ્યાની દ્વારા થાં પડેલું.

2-5-'32

અવેરચંદ મેધાભૂ

[બીજુ આવૃત્તિ]

ચૌદ વર્ષો પરની આ ચોપડીનું, 'વર્તમાનયુગના બહારવટિયા' એવું, મૂળ અંગેઝ પણી રાખેલું નામ હતું, તેને આ રેણુ ફેરવવાનું કારણ એ છે કે, આગલું નામ વિભ્રમકારી હશે : નામ માત્ર પરથી ખરીદનારને વિભ્રમ એવો થાય કે આ તો વર્તમાન યુગના કંઈ દુશ્શી કે પરદેશી રાજહારી બળવાખોરોની વાતો હશે. બીજુ બાજુ, નામ ફેરવવાથી મારી કુનિયોનું ચાહક રહ્યે હું નુકસાન તો નથી કરતો ને? - એ પણ વિચારી જોયું છે. નુકસાન ચ્યાનો ભાગ્યે જ સંભવ છે. ચૌદ વર્ષો પર જેની ફક્ત એક જ હજાર પ્રતો કાઢી હતી તે ચોપડીની આ નવી આવૃત્તિ આજે જેમના હથમાં જનાર છે તે વાચકસમૂહ તો લગભગ નવી એઠીનો જ હશે.

અમદાવાદ : 7-2-'46

અવેરચંદ મેધાભૂ

મૂળ લેખકનું નિવેદન

દ્વારા આવેશોમાંથી ઉદ્ભવેલાં જેઓનાં ડિસ્પાક્ટ્યો હું અતે વર્ણવવાનો છું, તે લોકોને મેં 'બહારવટિયા' નામ આપેલું છે. એમાં 'ખૂની લૂંટરા' તેમ જ 'નેકીદાર બહારવટિયા' એ બને જતનો સમાવેશ થાય છે. રોમાનેતી અને મેરિયો પિયાનેતી સાચોસાચ નેક્પાક બહારવટિયા કરી ખૂનીઓ નહોતા. બહારવટિયો એ કહેવાય કે જેણે પોતાના આત્મગૌરવ અને ઈજજત પર પટેલા કલંકને દુશ્મનના શોષિત વડે ધોઈ નાખ્યું હોય; બહારવટિયો એ બને છે કે જેણે પ્રાયદાની બારીકી ને આંદીઘૂંઠી પરથી ઈતબાર ઉઠી ગયો હોય, ને જેણે લાંબા અનુભવને પરિણામે એવું સમજાયું હોય કે 'કાયદો તો રંક અને રાય સહુને માટે સરખો' એવો ન્યાયાસનની ખુરશી પર કોતરાયેલો મુદ્રાલેખ કરી નહિ તો એના પોતાના દેશ પૂરતો તો સત્ય નથી.

આ એની માન્યતા સારી છે કે ખોટી તે હું નહિ કહું; આ તો એનું એક દાખિલિન્ક છે. પરિણામે દલીલબાળ અને અદાલતી શબ્દપીંજણની ધીરજ ગુમાવીને એ તો આપા મામલાની પતાવટ કાં બંદૂકથી અથવા બંજરથી કરીને અમેદ પણડાડાડીમાં ચાલ્યો જાય છે. એ નથી ચોરતો, નથી લૂંટતો, કે નથી બાન પકડતો. એનું નામ બહારવટિયો : રોબિન હ્રૂ અને વિલિયમ ટેલ જેવો નેક્પાક બહારવટિયો.

આમાંના કેટલાકને - રોમાનેતી અને પિયાનેતીને - હું સારી એક પિછાનતો અને રેઝોના દુર્ગમ ગુપ્તાવાસમાં પહોંચીને મળ્યો હતો. શા માટે મળ્યો હતો? એટલા માટે કે સુધરેલી દુનિયાની સલામત ગોદમાં ઉછરેલા અને ખડિયામાં ખાંપણ રાખીને મર્દાઈથી જીવવાની તર્કિવિધોણા રહી ગયેલા સમાજના બંદીવાનોને આવા નિર્ભય જવાંમર્દોનો સમાગમ અહોરાત કો અજબ આકર્ષણ - અજબ વર્ણિકરણ કરી રહ્યો હોય છે.

મારા વ્યવસાયે તો મને કાયદાના રક્ષણાખરોની વર્ચ્યે મૂકેલ છે; પરંતુ તેથી કંઈ આ એકલહથ્યા મર્દી પરની મારી ફિદાગીરી તેમ જ તેઓ વિશેની મારી દિલસોજ સમજ બૂધી નથી બની ગઈ.

હું દેશદેશની ભાષાઓ જાણું છું, જિંદગીભર હું રજાળ્યો છું. ગુના પકડવાના વ્યવસાયને કારણે હું શહેર શહેર અને દેશોદેશ ભટક્યો છું. આ સુંદર અને રસભરી દુનિયામાં રજાળવાની મોહિનીને હું કઢી રૂધી શક્યો નથી. એટલે જ આ મારાં વૃત્તાંતો હું નિઝામુભવમાંથી આપું છું.

ઓશેન તુર્ફ

કુમારી

પ્રવોજકનું નિવેદન	413
મૂળ લેખકનું નિવેદન	415
 1. કુમારી કારમણ	 417
2. મેરિયો શિકારી	432
3. રોમાનેતી	448
4. કામકુનો ઘાર	464

કુમારી કારમન

પ્રાજ્ઞ નિયોવીને જેના ઉપર પ્રીતિનું પ્રત્યેક ટીપું ટપકાવી નાખ્યું હોય, હતબાર રાખીને જેના ખોળામાં મીઠું ઓશીંકું કર્યું હોય, વિચાસની ઘેરી નીદમાં જેની સાથેના ભાવિ સંસારનાં કન્કમય સ્વખ માણ્યાં હોય, જેની જીવતી પ્રતિમા કરતાં પ્રભુને પણ ઉત્તરતો ગણ્યો હોય, એ જ જીવનસર્વસ્વને, એ જ સુખસોષાલાની મૂર્તિને જ્યારે ભાંગીને ભુક્કો થઈ જતી જોઈએ, કૃત્યનાના એ જ કોટકાંગરાના ચૂરેચૂરા થઈ તેની મિઠીમાંથી વિચાસધાત અને દગ્લબાળની દુર્ગધો ઊઠી શાસોચ્છ્વાસને ગુંગળાવી નાખતી અનુભવીએ, જ્યારે કોઈ ઓચિતા રહેસ્યછેદનની એક જ પલમાં આપણા પગ નીચેની પ્રશાન્ત ધરતીને ભૂક્મણા કડાકા સાથે સહભધા ચિરાઈ જતી ભાળીએ, ને એ ધરતીના પેટાળમાં એકલવાયા, નિરાધાર અને નજી શરીરે આપણો ઊભા હોઈએ તેવું લાગે - ત્યારે, તે ઘડીએ કં તો માનવી વિધાતાના એ વજ્ઝપ્રહારની નીચે ચમકી, હેબતાઈ, વાંકા વળી, એ ફાટેલી પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે - ઘણાખરાની તો એ જ ગતિ થાય છે - અથવા તો માનવીના આત્માની અંદરથી વિરાટ જાગી ઊકે છે, એનું મસ્તક ટઢાર બને છે, એના હાથ ઊંચકાય છે, એ સામો ઘા જીકે છે, ને એ એક જ ઘાની અંદર માનવી પોતાના જીવનનો, વિચારનો, વિવેકનો અને જન્મ-સુખનો સરવાળો થતો અનુભવે છે, એ એક જ આધાતમાં માનવી સો વર્ષનું આયુષ્ય જીવી કાઢે છે - ભલે પછી એ ઘા કેવળ વૈરની વસૂલાતનો હોય.

આવાં જ કો અગ્નિમય રજકણોની ઘડેલી હતી કુમારી કારમન : સાધી-મઠનાં નારંજી ફળોની ફોરમો વાતી ફૂલવાડીઓમાં ઊછરેલી એ મધુર મૂર્તિ, એ વિચાસુ અને ભોળી કુમારિકા હતી. પ્રભુ પર અને પ્રભુપ્રતિમા સમા માનવીઓ પર એ બાલિકાનો વિચાસ પરિપૂર્ણ અને નિરંજન હતો. અને એના અંતઃકરણો પાપનો સૂર સરખોયે કદી સાંભળ્યો નહોતો. મઠની શ્યામવસ્ત્રી અને શાંતિપ્રેમી સાધીઓએ એને શીખવ્યું હતું કે જગત તેમ જ જગતને વિશે રહેલી કિરતારની સરજેલી તમામ કૃતિઓ સંપૂર્ણ છે, એ જ દાસ્તિએ તું એને જોતી રહેજે, બેટા ! મઠની ચાર દીવાલો વચ્ચે, એ ધર્મશીલ અને પ્રભુમય જીવનપ્રવાહની ઉજમાળી નાની દુનિયા વચ્ચે, દુર્જનતાનો ઓછાયોય કુમારી કારમને કદી દીકો નહોતો.

બાપુ મરી ગયા તે વેળા આ કન્યાએ આવું મહેકતું અંતઃકરણ લઈને એક દિવસે દુનિયામાં પ્રવેશ કર્યો, અને પાટનગરમાં પોતાના મોટેરા ભાઈની જોડે સંસારયાત્રા શરૂ કરી દીધી. બાપુના જગ્બર વગવસીલાવાળી ત્યાંની બેન્કમાં મોટા ભાઈ ડિરેક્ટર છે. પિતાની પ્રતિષ્ઠા અને મોહબ્બતોની માતબર લાગવગનો લાભ મોટા ભાઈને સાંપદેલો છે. મરતાં મરતાં પિતાની આખરી ઠંક્યા એ જ હતી કે ભાઈ, બહેનને હવે આશ્રમમાંથી તેડાવી લઈને

તારી રક્ષામાં રાખજે, માતા તો ધરાં વાંચી મરી નહીં હતી. બાધુનો કેવું પડ્યા પછી જે
ભાઈબહેન ઉપરાંત વીજું ગોઈ એ ધરમાં નથી રહ્યું.
‘ભાઈ! ભાઈ! કર્તૃ કુમારી કારમન જ્યારે રેવગારીના રૂઘાની જીવિ પરિણ
ભાઈને કૃત્ય ભુજાઓ કરી વળી, ત્યારે ભાઈ ધરાં વાંચી નાખું પછી દીકરી બહેનનું
એ ખીલતું જોબન હેઠાને ચક્કિત બની ગયો.

‘અરે કારમન, તું આવડી મોરી થઈ ગઈ! એમ કહી એ બહેનને નાખગામ નિયમાન
લાગ્યો. છેલ્લી દીકી હતી : નાની, ચાઢેલ મૃગલી જેવી બીકાસ અને શરમાણ. આજે આટલાં
જ થોડાં વધોમાં - અનબાર જ વર્ષની ઉમરું - એણે એ કળીની શી ફૂલબિલાવટ દેખી!
કાળા ઓઢણામાંથી અને સાદા સાધુ-પોશાકની અંદરથી જોણે કે હાથીદાંતની કડારેલી હોય
તેવી એની ડોકની લાલ લાલ ઝાંય અને મોરી બે નિર્મલ આંખોની જલક અનેના આસમાનની
અતિલસ-શા કેશ વચ્ચે જળહળી ઊઠી. ભાઈના પ્રેમમાં મગરુરીની ભલક ભળી ગઈ. ભાઈની
બાજુએ હસતી, ખેલતી, ગેલતી, વાતો કરતાં ન ધરાતી, કોઈ બોલકી મેના સમી એ બહેને
ધેર પહોંચતાં સુધીમાં તો ભાઈની છાતીને બે તસુ વધુ પહોળી કરી નાખી, અને પિતાના
સૂના ધરનો વહીવટ એણે જોતજોતામાં તો હાથ કરી લીધો.

ધરના કામકાજથી પરવારીને રોજ સાંજે કારમન પોતાના ભાઈની ઓફિસે જતી અને
ત્યાંથી સાંજરે બન્ને જ્ઞાં આંકડા ભીડેલા હાથ હીડેળતાં ધર તરફ પાછાં વળતાં ત્યારે
અનેક જુવાનો એ તરુણીની સામે તારી રહેતા. ભાઈ હૈયામાં છૂપો ગર્વ અનુભવતો કે કેવી
સુંદર બહેનનો હું ભાઈ છું! અનેક વાર એ બહેનને રમૂજ કરીને કહેતો કે, “હવે તો તારે
સારુ આપણો વર ગોતવો પડશે હો! કેમ કે હું પણ હવે થોડા વખતમાં પરણવાનો, એટલે
પછી તારી રક્ષા કરનારો કોઈક જોઈશો ને!”

એ સાંભળીને કારમનના ગાલ ઉપર ઉધાની લાલી-શી સ્વાભાવિક શરમના ગલ
પડતા. અનેક યુવાનો આ સુંદરીના હાથની માગણીને લોભે લોભાઈને એમને ધેર જમવાનું
હજન સ્વીકારતા. હુનિયા એ કન્યાને બસ સુખભરપૂર, દૂધ-શી ઊજળી અને પ્રેમની નદીના
શીતળ પર સમી સરલ દેખાતી. તમામ આંખોમાંથી એને પ્રેમની ધીરાઓ જ વરસતી જણાતી.

[2]

ધેર આવનારાઓની અંદર એક ફાંકડો, કદાવર બાંધાનો રૂપાળો આદમી હતો. એનું
નામ મેન્યુઅલ હતું. ચાપલા સરોવરની નજીકમાં એક મહામોલી રૂપા-ખાણ જડી હતી તેના
સંબંધમાં કારમનના ભાઈ પર મોટા ભલામજાપત્રો લઈને આ યુવાન નગરમાં આવ્યો હતો.
ખાણના ઉદ્યોગની જિલાવટ સારુ એક જંગી રકમનો ઉપાડ બેંકમાંથી કરવાની તેની નેમ
હતી. રૂપા-ખાણના ઉદ્યોગને લગતું એણે તૈયાર કરેલું આખું યોજનાપત્ર એટલું તો ગુલાબી
હતું, એટલી અદ્ભુત સંપત્તિનો ખ્યાલ આપતું હતું કે લોરેન્જોએ એ કાગળિયાં
તપાસી ગયા પછી પોતાની બેંકને ધીરધારના જોખમમાં નાખવાનો મનસૂબો કરી મૂક્યો
હતો. લખલૂટ રૂપું પેદા થવાની મોહિની એ યોજનામાં ભરેલી હતી.

દહારે-દહારે આ કુટુંબની સાથે ઘાટા સંબંધમાં આવી રહેલા એ પુરુષની પ્રવાહી મોરી
આંખોએ, એના મધુ-જરતા હાસ્ય, અને એના કંઠમાંથી ઊઠતા મર્દાઈભર્યા અવાજે ધીરેધીરે
કુમારી કારમનનાં નયનોમાં અંજન આખ્યું. હૈયું દ્રવીને પાણીપાણી થઈ જાય એવું

હાસ્ય વેરતા એ બે હોઠના ખૂશાઓમાં, કોઈ શાંત વહેતા નદી-પ્રવાહની અંદર છુપાયેલા વમળની જેવી એક ગુંથ પડી રહેતી, તે ગુંથ, તે ભમરી, તે વમળ ભોળી કારમનની નિર્દોપ નજરમાં ક્યાંથી આવી શકે?

એક દિવસ આવીને એ આશકે લોરેન્જોની કને એની બહેન સાથેના મિલનની મંજૂરી માગી. ભાઈએ બહેનને એના આ આશક તરફના મનોભાવની પૂછપરછ કરી, બહેનના લેવડ ગાલો ઉપર સ્નેહનાં ગુલાબો સમી ચૂમકીઓ ઉપડી આવી; ને પછી ભાઈએ બન્નેને પરસ્પર મળવાની છૂટ આપી, તે દિવસથી મેન્યુઅલ એ ઘરનો નિત્યનો વાતાળું બન્યો. સ્પેઇન દેશની લગ્નરીતિ અનુસાર જોકે વેવિશાળ થયા પહેલાં કોઈ આશક પોતાની માશૂક સાથે એકાંતે ન જ મળી શકે, છતાં આંહીં તો ભાઈની દિવસભરની ગેરહાજરીમાં ડોન મેન્યુઅલ વારંવાર મુલાકાતો કરતો થઈ ગયો, કેમ કે કારમના મનની ગતિ આ પુરુષ સાથે જળ-મીન જેવી થઈ ગઈ હતી. પ્રેમાંધ બાળા પોતાના આ ભાવિ પતિ વિના જીવી શકતી નહોંતી.

હવે તો ડોન મેન્યુઅલ ટૂંકમાં પોતાનો કુંભીજન બનવાનો છે; અને તે ઉપરાંત બીજી બાજુથી બહેન પોતાના પિયુની ખાતર ભાઈના પગ માથાના વાળે લૂછવા માંડયા છે : એટલે લોરેન્જોએ કબૂલ કર્યું કે ભલે નાણાં ધીરીએ : પણ તે પહેલાં એક વાર એ રૂપા-ખાણ આપણો નજરે જોઈ આવીએ.

ભાઈ, બહેન અને ભવિષ્યનો ભરથાર : ત્રણ જુણાં ઘોડે ચડીને ચાલ્યાં. આશક-માશૂક બન્ને અચ્છાં ઘોડેસવાર હતાં અને ભાઈ તો રહ્યો ઓફિસનો કીડો, ખેલાડી તરીકે શરીરે કસેલું નહિ : પરિણામે બન્ને ઘોડેસવારો ઘોડલાંને થનગનાવતાં રમાડતાં આગળ નીકળી જતાં ને વગડાની નિર્જન એકાંતે પ્રેમની વેલછા માણસ્તાં હતાં. ઉધાડા આકાશની નીચે રાત્રિના પડાવ થતા ત્યારે મુંગા તારલાઓએ અને ચંદ્રઘેલી રાત્રિએ પણ આ બન્નેને કો અપૂર્વ ઘેલછાની મદ્દકટોરીએ પાયા કરી હતી.

પછાડોની મેખલામાં ખાણ દીઠી. એ કોઈ જૂની ખાણ હતી. ડોન મેન્યુઅલે સમજાયું કે આ પુરાતન ખાણને મેં નવેસર શોધી કાઢી છે.

મારી તપાસી, ધરતીના થરોમાં ધાતુના સળ જોવામાં આવ્યા. બહેનના ભાઈને ઠતબાર બેઠો કે ચાર-છ મહિનામાં તો અહીંથી રૂપાની રેલગાડીઓ ભરાઈને દોડશે. નગરમાં પહોંચીને લોરેન્જોએ બેન્કમાંથી રકમ ધીરવાનો નિરધાર કર્યો.

પણ દસ્તાવેજ કરવા, સહીસિક્કા કરવવા, અદાલતની વિધિઓ પતાવવી એ બધામાં તો કેટલો વિલંબ થઈ જશે! ને ખાણ પર સંચા મગાવીને મુકાવવા, કારીગરો રાખવા, મારી ખોદાવીને ભઝીઓ પર ઓગાળવા માંડયું - એ બધામાં પણ કેટલો કાળ વીતશે ! બહેન પોતાના ભાઈને વીનવવા લાગી. બહેનને જલદી-જલદી પરણીને લક્ષ્મીથી છલકતા ઘરની ધજિયાણી થવું હતું. ભાઈએ બહેનની વિનવળીને વશ થઈ પોતાની અંગત જવાબદારી પર નાણાં ધિરાવી નાખ્યાં.

આજે આ સંચાલી જરૂર, આજે આટલા કારીગરો વધુ બોલાવવા છે; આજે તો અમુક કામમાં આટલી વિશેષ રકમની જરૂર પડી છે : એ રીતે પિયુછાએ આ પ્રેમઘેલુડી બહેનની મારફત ભોળા ભાઈને ઊંડા ને ઊંડા કૂવામાં ઉતારવા માંડયો. બહેનનો ભાઈ મોમાગી રકમો ધીરતો જ ગયો.

કંઈક મહિના ચાલ્યા ગવા. પણ હજુ ક્યાંય રૂપાનાં દરેન થતાં નથી. કરે કે તે વંત્રો ચાલુ થયાં છે. રોજના મજૂરોની રોજી ચુકવાવા લાગી છે, જીનાં ક્યાંય ફરી પૂર્ણાંય પત્તો નથી. શું કરીએ? આજે તો આ વંત ખોટકો ગયું. આજે ગેલું ચક્કર તૂરી પણું. આજે ખાડામાં પાણી ભરાઈ ગયું. લાંબો વધારે રૂમ! લાંબો, લાંબો! ડેવાફૂટો બાઈ ગણાયું; ઉનાં ગયો.

“બહેન!” એક દિવસ લોરેન્ઝોએ આવીને અચકાતાં અચકાતાં પૂછ્યું : “માનું ખાતામાંથી થોડી રકમ મને ઉપાડવા દઈશ? ડોન મેન્યુઅલને ધીરેલી રકમની માંગાપણ
મારે આજે જ બેંકને કરવી પડશે.”

“મારી રકમ!” બહેનનો ચહેરો રૂની પૂણી જવા સફટ જાણું હતું અને એમને ખાંડ પર પેલા સંચાની જરૂર બધું જ ઉપાડીને ક્યારનુંય એમને દઈ દીધું છે - એમને ખાંડ પર પેલા સંચાની જરૂર હતી તે હિવસે.”

થર થતે શરીરે એ ચાલ્યો ગયો.

થર થતે શરીર અ ચાલ્યા જાયા. બહેનના અંતરમાં પણ ઓળા છવાઈ રહ્યા. ઓચિંતો એને જાણો કાઈ આંચકો લાગ્યો હોય તેમ એ ઊભી થઈ. શરીર પર લાંબો સાયો અને મોંમાથા પર શ્યામ ઘુંઘટપટ નાખીને પિયુઝને ઘેર પહોંચી. બારણા પર ટકોરા દીધા. એક ઓરતે આવીને બારણું ઉધાડ્યું. પોતાના ચહેરાને જેમ બને તેમ અંધારે લપાવીને એણો કહ્યું : “મારે ડોન મેન્યુઅલને મળવું છે.”

મળવું છે.” “મારે પણ પીટવાને એને જ મળવું છે, બાઈ!” ઓરતે ઉત્તર વાય્યો; “હું પણ કેઠ દુરાન્ગો શહેરથી ટલ્લા ખાતી ચાલી આવું છું અને મને તો ખબર પડી છે કે મારો પીટ્યો એ જુગાટ્યો, જે એક દી રાતે હાથમાં હાથકડી પડવાની બિકે મારા ઘરમાંથી નાસી છૂટ્યો છે, તે તો આજે મોટો શેઠિયો બની બેકો છે - એહે! અને પોતાને ડોન મેન્યુઅલ નામે ઓળખાવે છે. ઓધ મારા રોયા, તારાં છાજિયાં લઉ! મોટો શેઠિયો ન જોયો હોય તો! અરે પણ બેન! તું - તું કોણ છે, બાપુ? તેં ભલે તારો ચહેરો છુપાવી રાય્યો, પણ આંહીં તો એને એકોએક ઓરડામાં તારી તસવીર ટીંગાય છે, બેન! તું કોણ છે?”

“हुं सिनोरीटा कारमन - एनी भविष्यनी अर्धांगना.” पोतानी छातीमां खंजर चाली
रहां हंतु छतां पूछा कारमने गर्वभेर घूँघट उठावीने पीठ पर नाखी दीधो.

“આ - હા - હા - હા!” વિકરણ અહૃતાસ્ય કરતી એ ઓરત કારમનને કંદું જાહીને અંદર લઈ ગઈ.

“તું એની ભવિષ્યની અર્ધાગના! ઓ જગજજનની! પણ યાદ કરજે મને, એક વાર જો તું એની અર્ધાગના બનીશ તો તને શી-શી વીતશે તે હું જાણું છું. દસ વરસ સુધી હુંથી એની અર્ધાગના હતી. આમ જો, બેન! આ સામે સૂતું છે તેની સામે જો! એ દીકરો છે - મારો અને એનો. પણ, ઓ બેન! એ તો રાક્ષસ છે રાક્ષસ. મને એ આંહી ભાળશે કે તુરત જ ગોળીએ દેશે. આજ બે વરસથી હું એને શોધતી ફરું છું. એનો એક આદમી આંહી હતો. પણ હું આવી છું ત્યારથી આંહીંથી દોડતો-દોડતો ક્યાંક રવાના થઈ ગયો છે.”

સાંભળી લાધુ. કારમને ઘરનું સાંભળી લાધુ, એ બોગતના હથમાંથી પોતાનું કાંઈ જટકીને કારમન નીકળી ગઈ. એના કાનમાં લોહીની ઘરાધરના ચસ પડતા હતા. એની આંખે ઘોળાપીણા દેખતાં હતાં. એક વાર તો એ ટોકર ખાઈને પડી ગઈ. પણ પડ્યાની કશી જ પીડા પામ્યા વગર એ ઉઠીને દોડી.

[3]

ઘરમાં એ વધારે ન રોકાઈ. ફક્ત કપડાં બદલાવી ઘોડેસવારીનો લેબાસ પહેરી લાધુ), ને કમ્મરે પિસ્તોલ કસ્કરી લીધી. થોડી જીસાખરચી લઈ લીધી. પછી એ નીકળી પડી. રેલગાડીમાં ચડી. જાણતી હતી કે એ ધૂતારો ક્યાં મળજો. પણ એને હાર કર્યા પહેલાં એક વાર તો જરૂર હતી એ દગ્ગલબાજની ધાતુનો જથ્યો હાથ કરવાની. ભાઈની હજુજત બગ્ગવવા સારુ બેન્કમાં એ ધાતુ સુપરદ કરવી હતી. એને ખાતરી હતી કે રૂપાનો જથ્યો નક્કી ક્યાંક એણે સંઘર્થી હોવો જોઈએ. આહા! એક રંગિબાજ જુગાટિયો - એને મેં મારું કુમારિકાનું હદ્ય અર્પજા કર્યું! રેલગાડીની ગતિના થડકારા સાચે તાલ લેતો એ વિચાર-ધબકારો એના માથામાં ચાલી રહ્યો હતો.

એ સ્ટેશને ઉત્તરી. ત્યાંથી ખાણ પર પહોંચવાનો પગરસ્તો હતો, પણ ઘોડે ચડીને મુસાફરી કરવા જેટલી ધીરજ એનામાં નહોતી રહી. એક મોટર ભાડે કરીને એ ઉપડી. બીજે દિવસે બાપોરે એ સ્થળ આવી પહોંચ્યું, કે જ્યાંથી મોટર આગળ વધી શકતી નથી. મોટરને રોકી, એક ભોમિયો મેળવી, બે ઘોડાં લઈ એણે ખાણ તરફની મજૂલ જેડવા માંડી. આ એ જ ભોમિયો હતો, જેણે અગાઉ પણ કેટલીક વાર કારમનને પિયુજીની ખાણના પંથે દોરેલી. પરંતુ આજે એ ભોમિયાની જીણી આંખોએ આ કુમારિકાની ઉજાગરે સોજ ગયેલી લાલધૂમ આંખો દીકી, કોઈને વાંધી રહ્યા રહ્યા હોય તેવા ડેળા દીકા. એ હેરત પામ્યો. પિયુની પાસે જનારનું મોં આવું શા માટે? એના ચહેરા ઉપરથી નીચે આખા દેહના દીદાર કરતી એની દષ્ટ કુમારિકાની કમ્મરે બાંધીલા હથિયાર પર ઠેરી ગઈ. એક પલમાં જ એ પામી ગયો. ધેર ગયો. સજ્જ થઈને આવ્યો ત્યારે એની છાતીએ પણ કારતૂસનો પડ્યો હતો અને હથમાં બંદૂક હતી.

ઝંગથો રડી તે વેળાએ બન્ને ખાણ ઉપર પહોંચ્યાં. તમામ સૂનકાર હતું. એક પણ યંત્ર નહોતું, ન કોઈ મજૂર હતો. તમામ ક્યાંક ચાલ્યું ગયેલું.

ભોમિયાએ પૂછ્યું : “તમારે તો બાઈ, ડોન મેન્યુઅલ જ્યાં ખોદાવે છે તે ખાણ પર જવું છે ન? તો એ ખાણ આ નહિ હો! આ તો એક ખાડો છે. અસલમાં આ ખાણ હતી પણ હવે આમાં કટકીય રૂપું જરૂર તેમ નથી.”

“પણ મેં આંહીં માટીના થરોમાં રૂપાનાં વળાં દીઠેલાં ને?” કારમને ચોકીને પૂછ્યું.

ભોમિયો પેટકાટ હસી પડ્યો : “હું અં! - બંદૂકે કરીને માટીમાં ધરબી દીધેલું રૂપું! અરે બાઈસાહેબ, એ રીતે તો તમારા ખાવંદે આ ખાણને દસ વાર વેચી છે, બાકી એની સાચી ખાણ તો આંહીંથી દસ ગાઉ દૂર રહી.”

“બાઈ જુઆન! તું જાણો છે, એ જગ્યા ક્યાં છે તે?”

“હોવે.” ભોમિયાએ દાંત ભીસ્યા. “પણ તમે રાતની રાત આંહીં આરામ લ્યો. આપણે સવારે ઉપડીએ.”

“ના, ના, મારે આરામ નથી લેવો. મને યાક નથી લાગ્યો. આપણો તે રૂએ અંદરું પંથ કરી શકશું?”

જવાબમાં જુઆને ઘોડાના પાગડામાં પગ પરોણી છુતંગ મારી, ઘોડે ચલાવ્યો. અને હોક પીસ્યા. એનેથે કંઈક લિસાબ ચોળણો કરવો હતો.

જ્યારે તેઓ એક નાની કુગરગાળીમાં પહોંચ્યાં ત્યારે ભજકડાની વેળા હતું ગરું હતું. ગાળીને બીજે છુદી, દૂર દૂર ગોળકુડાણે કોઈક મોટા પડાવના તાપણાં જખુકણાં હતાં. અન્યાં સુધી જીન ઉપર ટકો રહેલી કારમનને આંખે અંધારાં આવ્યાં. એક ટકા પાણીની પાણીને અને લગાર સુરાએ એને પાછી ખબરદાર કરી દીધી. ઘોડાં જાડાના થડ સાથે અંધી દીધ્યા. જુઆને બંદૂકને કોથળીમાંથી બહાર કાઢીને એના ચક્કરમાં કારતૂસો ઠાંસી લીધા. કારમનને ચુપકીદીથી ઠેરવવાનું કહી પોતે અંધારામાં આગળ વધ્યો. ઘોડી વારે પાછો આવ્યો.

“કશો જ અવાજ કરશો નહિ.” એટલું કહી એ કારમનને એક એવી જીવાએ લઈ ગયો, કે જ્યાંથી આખો પડાવ નજરે પડતો હતો. લપાઈને તેઓ વાટ જોઈ રહ્યાં.

ખો ફાટતી હતી. પડાવ ઉદ્ઘાટના લાગવા સળવળતો હતો. કારમને એ ઊડા ઊડા ચાલ્યા જતા ભોંયરાના મોં પાસે જબ્બર વસવાટ દીઠો. મજૂરો દિવસનું બોજન રાંધી રહ્યા હતા.

એ સમજી ગઈ : આ જ એ સાચી ખાણા - કે જેનું રૂપું અત્યાર સુધીમાં બેન્કની અંદર જમા થવું જોઈતું હતું. આ રૂપા-ખાણની રૂપાપાટો વડે મારું અને મારા ભાઈનું સત્યાનાશ અટકાવી શકાયું હોત. તેને બદલે હું આ શું જોઉ છું! આ રાક્ષસ અમને નિયોવી, છેતરી, લુંટી, અમારી છિજ્જતનો વધ કરીને જ અટક્યો નથી. એની દુષ્ટતાની શરીર તો એ ચડી છે, દાગવા પર ડામ તો એણો એ દીધો છે, કે મીઠા મીઠા પ્રેમબોલો બોલીને મને એ હજુય એના પ્યારના ફાંસલામાં ફસાવી રહ્યો છે - ક્યાં છે એ કાળશર્ટું!

જેમ જેમ અજવાનું ઊઘડતું ગયું, લોકોના આકારો દાઢિએ પડવા, તેમ તેમ એની આંખો ફાટતી ગઈ. જાણો-અજાણો એનો હથ કમ્મર પરની પિસ્તોલના બંધ ફીલા કરી રહ્યો હતો.

“જો જો હોં બાઈસાહેબ!” જુઆને એને ચેતાવી; “રજે ભૂલ કરી બેસતાં. આંહી ને આંહી આપણાને ભંડારી દેશો. માટે જો આપણે ગોળી છોડવી હોય તો ઘોડાં હાથવેંતમાં રાખવાં જોઈએ. ઉપરાંત, આપણો પીછો લેવા જેવું કંઈ વાહન-ઘોડું એની કને તો નથી ને, તે પણ આપણો તપાસી લેવું જોઈએ. બાઈસાહેબ, તમે ઘોડોક વિસામો લઈ લ્યો. હું ચોકી રાખીને બેસીશ.”

ઉગ્ર રોષ અને ઉશ્કેરાટના નશાને અંતે કારમનની નસો તૂટતી હતી. એનું શરીર વિસામો માગતું હતું. જાડાની ઓથે જીનની ધાબળીઓનું પાથરણું કરીને એ ભરનીદરમાં પડી. પછી જ્યારે કોઈના હથે ઢંગોળાઈને એ જાગી ઊઠી, ત્યારે એને લાગ્યું કે જાણો પોતે ફક્ત એક જ પળ જોલું લઈ ગઈ હતી. કાંડાની ઘડિયાળ પર જોયું તો બપોરની વેળા થઈ ગઈ હતી. એને આટલા કલાકની નિદ્રા પછી જગત કરનાર જુઆન જ હતો.

“બાઈસાહેબ!” જુઆન બોલ્યો : “મેં ખાવાનું રાંધ્યું છે. હવે તમે તાબડતોબ જમી લ્યો. પડાવમાં કંઈક ભારી વાત બની રહી છે. ગધાડાં ઉપર કશુંક લાદે છે.”

કુમારિકા જબકારો કરતી ખડી થઈ ગઈ. ઠડા જણથી મોં ધોયું. નાસ્તો ઝડ ઝડ

ગજા નીચે ઉતાર્યો. પછી પોતાના સાથીની સાચે, ભાજોડિયાંભર ચાલીને એ ઊરી ટેકરીની આડશ પાછળ ચડી. ત્યાંથી ખાણ દેખાતી હતી. મારી પીસવાના, ધાતુ ઓગાળવાના વગેરે અનેક બુલંદ સંચાઓ - પોતાનાં અને ભાઈનાં જ નાણાં વડે ખરીદેલી આખી. યંત્રમાળા - તમામ આંહીં છુપાવી રાખેલાં : અને સો-બસો ગધેડાં ઉપર વજનદાર છાલકાં લદાઈ રહેલાં છે.

એકાએક એ ચમકી ઊરી. જીવનનો સાથી ઠરાવીને જેને ખોળે પોતે માથું મૂક્યું હતું તેને એહો નજરોનજર ત્યાં હુકમો દેતો જોયો. એ એક જ ક્ષણમાં એનો ક્રૈમારોએમ પલટીને જીણગતો વિકાર બની બેઠો. ને એ વિકારના અભિનુકૃતમાંથી એક ચંડિકા પ્રગટ થઈ. પણ ના, આમ છેટેથી હું એને પડકાર્યા વગર નહીં મારું : પહેલાં પ્રથમ તો એ વિશ્વાસધાતીને શિક્ષસ્ત આપી, એની પાસેથી રૂપું સેરવી લેવું છે, અને પછી સામી છાતીએ ખડા રહીને એની જિંદગી લેવી છે.

ભોમિયાને ઠશારત કરીને એ ભાજોડિયાંભર પાછી વળી ગઈ. સમજાવું : “ભાઈ, આપણો ગધેડાંનો પીછો લઈએ. તું મને મદદ કરીશ તો હું તને બદલો આપીશ.”

“હું બરાબર મદદ કરીશ તમને, ભાઈસાહેબ! મારે પણ એક દાગ ધોઈ નાખવાનો છે.”

એને ધોવાનો દાગ શો હશે! કારમન એ વાત પૂછવા ન થોભી. એહો ગધેડાંની કતાર ઉપડતી દીઠી. સાચે પાંચ જ ચોકિયાત હતા. પછિવાડે દૂર દૂર ઘોડાં ચલાવતાં એ બને પણ ગધેડાંની હારને મુકામે જવા ચાલ્યાં આવે છે. આખરે ગધેડાં એક ઊંડી ખીણમાં ઉત્તરે છે. કારમન અને ભોમિયો ઘોડાં બાંધી દઈને લપાતાં લપાતાં એક ઊંચી આડશે ચડે છે. ત્યાંથી અનેક ભૌયરાંવાળી ગાળી નજરે પડે છે. ગધેડાં પરનાં છાલકાં ત્યાં ઠલવાય છે. ઠલવાતા માલનો ઠણકાર થાય છે. રૂપાની પાટો આંહીં ભરાય છે!

અને કદાચ રેલની માલગાડી ભરવા જેટલો માલ જમા થઈ જશે એટલે પિયુણ્ણ એને ઉઠાવી જશે શહેરમાં! આ તો લાગે છે હંગામી સંગ્રહસ્થાન.

હિકુર નહિ. તાબડતોબ હું ભાઈની પાસે પહોંચ્યું, અને પિયુણ્ણ મારાને પેલી ઓરતની મારી સાથેની વાતની જબર પડે તે પહેલાં જ હું આ સાચી ખાણ ઉપર અને પાટોના પર જતી બેસડાવું.

કમનસીબીની કથા, કે કારમનને સત્તાવાળાઓ પાસે જઈ આ બાતમી દેવાનું ન સૂઝાયું. નહિ તો આખું ભાવિ પલટાઈ ગયું હોત. પણ પોતાના ખ્યારના વિશ્વાસધાતી ઉપર એના હૈયાનો હુતાશન એવો ઉગ્ર ભડકે સણગી ઊઠ્યો હતો, પોતાની નિર્દોષતાને રોળનાર સામે એના હદય - રાફડાનો ભુજંગ એવા તો કાળથી ફેણ પછાડી રહ્યો હતો કે કુમારિકા કારમને બીજું કશું જ ન સૂઝાયું. એને તો ખુદ પોતાના જ હાથ ઠારવાહતા. જે ઘડીએ એહો પોતાની સામે પેલી ફસાયેલી ઓરતને દીઠી હતી, તે ઘડીથી જ કારમનના કલેવરમાં એક નવીન ભૂતૂપવળે વાસ લીધો હતો; જાણે કોઈ શતધારે વહેતો જળપ્રવાહ એકાએક હિમ પડતાં થીજુને કોઈ પાખાણી પ્રતિમા બની ગયેલો છે, ને એ પ્રતિમાના હોઠ પર વિકાર અને વેદનાનું બનેલું કરદું હસ્ય કોતરાઈ ગયું છે. ઓસરી ગઈ, એના અંતરમાં દરરોજ જાગતી હિશ્રપ્રાર્થના ઓસરી ગઈ, આશ્રમની મીઠાબોલી સાધીઓએ ભજાવેલાં સૂત્રો પરથી એની આસ્થા પણ ઊડી ગઈ. કોઈ ભુલાઈબુંસાઈ ગયેલા પ્રાચીન પૂર્વજનો હિસામય પ્રાણ કે

અતિલ ઉડી આરામગાહુમાં પડેલી એકાદ મુડદાની કટરીના અંદરથી જાગત થઈને આ કોમલાંગીના કલેજામાં ઘર કરી બેઠો.

આવી વિફરેલી કારમન માયદાના અટપારા પંથ પર ચાલવાની ધીરજ હારી બેઠો. નહિ તો એને ખબર પડી જત કે પિયુજ્ઞના માયા પર તો શરાગૃહના અને મોતના એળું ક્યારના ભમી રહેલા હતા. પેરિસની ને કુમારિકાઓની સાથે છાનાં લગ્ન કરી, એ બનોની લક્ષ્મી નિયોવી લીધા પદ્ધી એની હત્યા. કરીને નારી જનારો રાખ્યા પોતે જ આ. ડેન મેન્પુરલ, પોલીસ - જાસૂસો એનો કબજો લેવા સારુ ચાલ્યા જ આવતા હતા. પણ એમને જરૂર જ મોડું થયું. કુમારી કારમન એમની આગળ નીકળી ગઈ હતી. એણે હિસાબ પતાવી નાખ્યો હતો.

પોતાના ભાઈને બદનામીના જીવતા મોતથી તો ઉગારી શકાશે, એવી આશાએ તલાવી. રહેલી કારમન દોટમદોટ દેરે આવી. ત્યાં તો ઉંબરમાં જ કાળાંધબ મોં લઈને ઘરના નોકનો ઊભા હતા, શું થયું હતું? ભાઈએ આપદ્યાત કરી નાખ્યો હતો.

[4]

ભાઈના શબદની સામે કારમન ઉભી થઈ રહી. જ્ઞાનો કોઈ મંત્ર છંટાવાથી એનો આખો દેહ પાખાણની પૂતળી બની ગયો.

એ થીજી ગયેલા હાથે કારમને ભાઈના મુડદાની પાસે એક કાગળ પડ્યો હતો તે ઉપાડ્યો. 'બહેન કારમન'ના સરનામાનો જ કાગળ હતો. ફોડ્યો, વાંચ્યો, ભાઈએ આત્મહત્યા શા સારુ કરી તેનું સાચું કારણ સમજાયું. બેન્કનાં નાણાંના ગેરઉપયોગની નામોશીથી ભાઈ નહોતો અકળાયો, એની ધીરજ નિતારી લેનારો તો બહેનનો કાગળ હતો. 'પિયુજ્ઞ'નો પીછો લેવા જતી રેળાએ કારમન જે ઉતાવળી ચિહ્ની લખતી ગઈ હતી તેણે ભાઈના અંતઃકરણ પર એવું હસાયું હતું કે બહેન તો લગ્નની વિધિ પતી ગયાની પણ વાટ જોયા વગર એ ધૂર્ત ધણીની સાથે સંસારના લહાવા શરૂ કરી દેવા રવાના થઈ ગઈ! એ બદનામીએ અને બહેનનું સત્યાનાશ વળવાની બીકે લોરેન્જોને આત્મહત્યાના પંથ પર મોકલ્યો હતો.

ધીર ધીરે - યંત્રની માફક ધીર ધીરે - બહેન ભાઈનો કાગળ વાંચ્યો, બીજી વાર ઉખેળીને વાંચ્યો, છતાંયે એની આંખોમાં આંસુ નથી આવતાં. 'વહાતી બહેન, મને ક્ષમા કરજે!' એ વાક્યે પણ એની પાંપણોને ન પલાળી. એની આંખો મટકાં મારતી પણ થંભી ગઈ. લાગણીનો ધગધગાટ અંદર ઉતરી ગયો. ઉપરનું કલેવર ટાંકું - ટાંકુંબોળ બનતું ગયું. લોહી વિનાની હોય તેવી ઠંડીગાર દસ આંગળીઓ એના મોંને જકડી પડી. એનું મોં સંકોડાયું. બે હોઠ વર્ષે એક સાંકું તીનું રચાયું. રેમાંથી સિસોટીના સૂર નીકળ્યા - નાનપણમાં જે નાદાન અર્થહીન સૂર પોતે મોંમાંથી વગાડતી હતી તે જ એ સૂર : અને માથાની અંદર જ્ઞાનો કે કોઈ મહા જળપ્રલયનાં પાછી એની ચોગમ વીંટળાઈ વળી એને દુબાડતાં હોય તેવો ભાસ થવા લાગ્યો. પછી એ ઉભી થઈ, અને મોં વકાસીને બાધોલા જેવા ઉભેલા ચાકરોને શબ્દ પણ કહ્યા વિના, પોતાના સાથીને હાથને ઈશારે બોલાવી લઈ, એ ઘરની બહાર ચાલી નીકળી. એને માટે હવે એક જ પંથ રહ્યો - પિયુજ્ઞના ઘરનો પંથ. જુઆનને લઈને એ ચાલી.

ટકોરીની ચાંપ દાબતાં ઘરનું દ્વાર ઉઘડ્યું. ઉઘડવા આવનાર વૃદ્ધ ચાકરને એક

જાજુ ઘડેલીને, અંદર ખબર કહાવવાની વાट જોયા વિના સાથીની સાથે એ ઘરમાં ચાલી આવી. અંદરના એક શયનખંડમાંથી તીણી ચીરો અને કોપાયમાન અવાજો નંભળાયા. કારમન ત્યાં જઈ ઉભી રહી, જુઓ છે તો કોઈ લાંબા લાંબા પંથની ઘોડેસવારી પરથી. હજુ હમણાં જ આવી પહોંચેલો ડોન મેન્યુઅલ પગમાં બૂટ અને બૂટ પરની એરી પગ ઉતાર્યા વિનાનો રજેબધ્યો ઉભો છે : ખથમાં એક કોરડો છે : સામે ઘરતી પર પટકાવેલો એક ઓરત પડી છે : ઓરતના ચહેરા ઉપર અને હાથ ઉપર લાલ લોહીના ટરિયા આવેલા છે. એ જ પેલી ઓરત.

“જુઆન, તું બહાર ઉભો રહેજે !” એવો હુકમ દઈને પોતાના સાથીને દૂર ચામત્રી કારમન નજીક આવી. પિયુલુએ અચાનક પોતાની માશ્કને જોતાં જ તેના તરફ વળી, છેદ પર એક કુટિલ હાસ્ય નચાવતાં નચાવતાં, અરધા ઝંખવાળા પડી જઈને કહ્યું : “ઓહો ! તું આવી પહોંચી ને ક્રેરીડા ! બહુ સારું થયું. નહિતર મારે તને તેડવા આવવું પડત, હમણાં જ આવતો હતો. જો ખાર ! આ ઓરત મને કહે છે કે એણો તારી પાસે પોતાને મારી પરણોતર તરીકેની ઓળખાણ દીધી છે. નરાતાળ જૂઠાણું !”

“મને પણ એ જુણાણું જ લાગેલું હતું, વહાલા !” કારમન સુંવાળા મધુઝરતા અવાજે બોલી : “કારણ, હું તો જાણું જ છું કે ઠગાઈ રમવાનું તો તમારું ગરું જ નથી. ખરું કે નહિ ?”

તાજુબ બનીને મેન્યુઅલ એ કુમારિકાની સામે તાડી રહ્યો. ચાબુકને એણો પડતો મેલ્યો. એના દેહમાં જાણો નવું દિવેલ પુરાયું. એણો તો ધારણા રાખેલી કે વિક્કાર અને શાપોની અંગાર-જડી વરસવાની, તેને બદલે, ઓહો ! આવા વિચાસના શબ્દો : ત્યારે તો એ ભોળુંડી છોકરી હજુય મને ચાહી રહી છે. ત્યારે તો ફિકર નહિ. ફૂલ સમું મોં મલકાવીને એણો પોતાની મૂછોને જરીક વળ ચડાવ્યો. કહ્યું : “સાચેસાચ પ્રિય ! હું તને કદાપિ ન છેતં. તારી સાથે વિચાસઘાત રમતાં પહેલાં તો ઈશર આ પ્રાણ-દોરી ખેંચી લે એ જ માગું છું હું તો. પરંતુ તે આજે ઘોડેસવારીનો પોશાક કાં પહેર્યો, કારમન ? અને તું કેમ આજે આટલી બધી ઝંખી છે ? તારા મોં પર નૂરનો છાંટો કાં ન મળો ?”

“ના, ના, એ તો હું આજે જરા થાડેલી છું. હું તમને શોધવા ખાણ પર ગયેલી. ત્યાં પણ મને એ જ જોઈને આનંદ ઉપજ્યો કે તમે જે બધું કહેતા હતા તે જરીકે જૂદું નહોતું. ગજબ સરસ છે હો એ રૂપા-ખાણ - કલા ‘વેબ્રાન્ટાદા’વાળી ખાણ.”

મેન્યુઅલ પામી ગયો. નવી ખાણ જોઈ આવી આ તો ! એનો દેહ ટણાર બન્યો. એનો પંજો આપોઆપ કમરબંધ પર ગયો. એની આંખો ચમકવા લાગી. પછી એ હસી પડ્યો : “હા - હા - હા - હા ! એ તો એવું બન્યું કે પેલી તમને દેખાયેલી તે ખાણ તો ખોરી નીકળી પડી, અને પછી આ કલા ‘વેબ્રાન્ટા’ની ખાણ અમે શોધી કાઢી. મારે તો તને એક ઓચિંતાની વધામણી આપવી હતી. માટે મેં છુપું રાખેલું. હવે તો મને આશા છે કે દૂક વખતમાં જ અમે ધાતુ ગાળવા માંડશું.”

“ઓહો, દૂક વખતમાં જ !” કારમને અચંબો પ્રગટ કર્યો : “ઓહ ! પણ જુઓને વહાલા, તમે તો ક્યારનુંયે ઘણુંઘણું રૂપું સંઘરાવેલું છે, ખરું ને ? ને હું આજે જ એનો કબજો લેવા માણસો મોકલું છું. બેશક, તમે તો એ વાતને પણ ઓચિંતી વધામણી માટે જ છુપાવી રાખી હરો, કેમ કે બેન્કનાં જે નાણાં આપણે ઉપાડ્યાં છે તે ભરી દેવામાં અમને સહય

કરવાની તમારી આતુરતા તો હું સમજું જ હું ને ! બંદું કહું છું ને, પ્રિય !

“રાંડ બિલ્લી !” કહેતો મેન્યુઅલ સાપની માફક ફૂઝાડી ઉઠ્યો : “એ...મ ! ત નારુ પર જાસૂસી કરી છે એ...મ ? વારુ ! હવે આ ખબર તું તારુ ભાઈની પાસે નો નહિં જ પહોંચાડી શકે, સમજુ ?”

એટલું કહીને એણો કારમન તરફ કદમ ભવ્યા. એનો પંજો કમર પરના હથિયારની મૂઠ પર જ હતો.

વીજળીનો સબકારો ચાય તેટલી ઝડપથી કારમને પોતાની પિસ્તોલને ખેંચી અને ‘પિયુઝા’ની સામે નિશાન લઈ લીધું. બોલી : “નહિં જ” – ને એટલું કહેતાં તો એકાએક એની ખામોશી ભુક્કો થઈ ગઈ. એની નસોમાં ધગધગતી આગ ધસવા લાગી, અને એના હૈપામાં ઊપડેલા ધબકારાએ એનો ચાસ જાણે રૂંધી દીધો. “નહિં જ, મારા ગરીબ બિચારા ભાઈની પાસે તો હવે હું આ ખબર નહિં જ પહોંચાડી શકું, કેમ કે એ તો ક્યારનો બીજુ દુનિયાને પંથે નીકળી પડ્યો છે ! ને તું પણ એને નહિં પહોંચાડી શકે, કેમ કે તારા હેઠ ઊપર પણ નરક-જ્વાળાની રાખ છંટાઈ જશો ! ઓહ ! ઓહ ! એક જ વારને બદલે એક હજાર વાર હું તારો જાન હમણાં જ લઈ શકી હોત !”

એ શબ્દો અને એ રૈદ્ર મૂર્તિ મેન્યુઅલને શરીર સ્વેચ્છ વળી ગયો. એનું હૈયું ભાંગી ગયું. હથિયારની મૂઠ પરથી એનો પંજો ઊંચો થયો, એણો ચીસો પાડી પોતાના નોકરોને : “ઓ હોલ, ગોમેજ, દોડજો, દોડજો !”

“આવ્યો, જનાબ !” કહેતો એક આદમી હાથમાં પિસ્તોલ લેતો ધસી આવ્યો. તત્કાળ કારમનના સાથી જુઆને રાઈફલ તોળી. ધોડો ચાંપતાં જ એ ગોમેજ નામનો નોકર પડ્યો. થોડી વાર તરફડ્યો, પછી એનું શબ શાંતિમાં સૂતું.

મેન્યુઅલે એ તાકી રહેલી પિસ્તોલની સામે એક આખરી ડિમત કરી. હથિયાર ખેંચવા ગયો તે જ પણે કારમનની પિસ્તોલની પહેલી ગોળીએ એનો જમણો હથ ચુંથી નાખ્યો. પછી તો જખમી પિયુઝાએ પ્રિયતમાની આંખોમાં પોતાનું તકદીર વાંચી કાઢ્યું. એ દીવાનો બન્યો. વેદનાની ચીસો પાડતો એ કારમનની પાસે પહોંચવા મથતો હતો. ફરી વાર એક હુડાટ ગાજ્યો, ઘરની દીવાલોએ એને દસ ગણો વધારે ગુંજાવ્યો, અને પિયુઝાની એક જાંઘ વીંધાઈ ગઈ. એ પૃથ્વી પર પટકાઈ પડ્યો. પછી એ નરાંધમના કલેવર પર ઊભીને એના તરફડતા દેહ ઊપર ધડ, ધડ, ધડ એક પછી એક ગોળી ચોંટાડી – એની કારતૂસોની દાબડી ખલ્લાસ થઈ ગઈ ત્યાં સુધી.

અત્યાર સુધી શાંતિથી આ ઘટના જોઈ રહેલો જુઆન આગળ આવ્યો, એ ચુંથા થયેલા શબ સામે થોડી વાર જોઈ રહ્યો, પછી એણો કહ્યું, “વાહવાહ ! ડિસાબ પતી ગયો.”

એટલું કહીને એ કારમન તરફ વળ્યો. કાર્યની સમાપ્તિ થયા પછી એ કુમારિકા ડિંમૂઢ બનેલી ઊભી હતી. પિસ્તોલ હજુ ધુમાડો કાઢી રહી હતી. જુઆને માથા પરથી ટોપી ઊઢાવીને એ બાળા સામે મસ્તક નમાયું, “ઓ સિનોરીટા ! મહાપુષ્પનું કાર્ય કર્યું; એ કુતાને ઉચિત મોંત મળ્યું. કંઈક વર્ષો પહેલાં એણો મારી બહેનને ઊઢાવી જઈને એની હત્યા કરી હતી. ખરેખર આજ એ બહેન જ્યાં હશે ત્યાંથી તને દુવા દેતી હશે – હું દઈ રહ્યો છું તે રીતે. પણ હવે ચાલો, આપણો ભાગી છૂટીએ. મારી જિંદગી તો હવે તારાં ચરણોમાં જ સમજજે.”

એટલું કહી, કારમનનું કાંકું જાલી એ કારમનને બહાર ખેંચી ગયો. બહાર પેલો વૃદ્ધ

દ્વારપણ બેઠોબેઠો મો મલકાવતો હતો, શેરી સૂનકાર હતી. કોઈએ ગોળીબાર સાંભાગા જીવાતા નહોતા.

થેર પહોંચીને કારમને ભાઈના શરીરની સામે એકાંતે થોડી ઘડીઓ ગાળી, એની નસો ઉપર અત્યાર સુધી કસ્કસાવીને કાબૂ રાખી રહેલી એ ઉન્નાની લાગણી હવે વૈર ભરપાઈ થઈ ગયાથી ઢીલી પડી ગઈ, એનું કૃદ્ય પાછું પોચું પડીને વહાલા વીરના શોકે ચિરાવા લાગ્યું. કેટલીયે વાર સુધી એ ભાઈના શરીર પર માથું ફળીને ધૂસકે-ધૂસકે રડી. પણ પછવાડે મોતની પડધીઓ ગાજી રહી છે. હજુ તો પોતાની બદનામી થતી અટકાવવી બાકી છે. આંસુ સારવા બેસતાં કર્તવ્ય હારી બેસાશે.

ખળખળેલી ઊર્મિઓને કેમ જાણો ગાંસડીમાં બાંધતી હોય તે રીતે બહેન ખડી થઈ ગઈ. આંખો લૂછી નાખી, ભાઈની દફનકિયાની સૂચના દીધી, બીજી બધી ભરમળામણ કરી. ઘરમાં રોકડ પૈસા પડયા હતા તે લીધા અને જુઆનની સાથે એ સાંટીઆગોની કુગરગાળીમાં ઊતરી પડી.

[5]

“ભાઈ જુઆન !” એણે સાથીને કહ્યું : “પહાડમાંથી પચાસ જણને લેગા કરી લઈએ. રૂપા-ખાડા ઉપર આપણો હલ્લો લઈ જવો છે. આપણને સાથ આપનારને એ રૂપામાંથી ભાગ દેશું.”

પહાડી જવાંમદો જોતજોતામાં તો આ સુંદરીના નેજા નીચે ખડા થઈ ગયા.

“જુઓ ભાઈઓ !” તમામને એણે કહી દીધું : “જો, આમાંથી રાજ આપણો પીછો લેશે, તો આપણો ક્યાં જવું છે, જાણો છો ? મોઝિસ્કોના રાજની સામે દંગો ઉઠાવનાર બળવાખોર વીર જનરલ જીમેનેજને આશરે. એની ફોજમાં આપણો ભજી જશું. માટે સહુએ ખડિયામાં ખાંપડા લઈને નીકળવાનું છે, સમજ્યા ?”

“ખુશીની સાથે.” એમ કબૂલ કરીને સૌ પહાડી લડવૈયા આ જવાંમદ્દ સુંદરીના ઘોડાની પાછળ ચાલી નીકળ્યા. એ હગલબાજની રૂપા-ખાડા ઉપર અચ્યાનક તૂટી પડયા. ખાડાની નાકાંધી કરીને કબજો લીધો. ખાણિયાઓને કહ્યું કે “મારી માલિકી નીચે તમારે સૌને કામ કરવું હોય તો તમને ચાલુ રોજ ચૂકવવામાં આવશે.”

. ઘણાખરાએ તો આ નવા માલિકને રાજુખુશીથી સ્વીકારી લીધી. કારમને પોતાના કોલ પ્રમાણે સૌથી પ્રથમ તો પોતાના સાથીઓની વરચે થોડુંક રૂપું વહેંચી આય્યું અને પછી બાકીની પાટોનો જથ્થો રેલવે સ્ટેશન પર ઊપડાવી જઈ બેન્ક ઉપર રવાના કરાવ્યો.

બેન્ક ઉપર એણે કાગળ લખ્યો તેમાં જમજ પાડી કે આ રૂપું ભરીને હું મારા ભાઈએ વિશ્વાસધાતીને વિરાવેલાં નાણાં ચૂકવી આપું છું. ભાઈની કારકિર્દી પરનું એ કાળું કલંક આ રીતે ઉખેડી નાખવા સારુ જ મેં આ દારુણ પંથ સ્વીકાર્યો છે.

પહેલો જથ્થો જ એ આખી રકમની ભરપાઈ માટે પૂરતો થઈ પડ્યો. ત્યાં તો રાજને આ જાડા થઈ. પોલીસને દર્શાવે તો કારમન બહારવટિયણ જાહેર થઈ ચૂકી. મરનાર વિશ્વાસધાતીના મસ્તક પર ભલે અનેક ભયાનક તહોમતો તોળાઈ રહ્યાં હતાં, તે છતાં કાયદો હથમાં લેવાની સત્તા કોઈ પ્રજાજનને નથી. કાયદાની દસ્તિમાં કારમન ખૂનની તહોમતદાર હતી. એને પકડવાના આદેશો છૂટ્યા. એને જાલનાર માટે મોટું છનામ જાહેર થયું.

રૂપા-આણને જીન કરવા જ્યારે પહેલી કોજ પોતાના દાડુનાણા વર્કને આવી પણ કૃત્તિમાન એણે દીકું કે આ કંઈ આકું મધ્ય નથી. કારમન બહારવટિયણના કર્કની કુંગરામાં બંદૂકોએ ગોળીઓની ઠારમઠોર બોલાવી. પહેલી જિસન હાર ખાઈને પાછો રહ્યા.

બીજુ વાર એકસો સોલ્જરોની પલટન ચડી. જુબે તો કારમને આણ ઉાર (કલ્લેબંધી) કરી કાઢી ઊચાણ ઉપર ચોયફરતા નાનાનાના કોઠા અડા કરીને એણી એથે બહારવટિયણનું સૈન્ય લપાઈ ગયું હતું. મેક્સિકો રાજની કોજ અને એના દાડુગોળા લાઈલાજ થઈ ગયા. બહારવટિયણની બંદૂકોએ કંઈકને ફૂકી માર્પા. કેટલાય કલાકોની ટ્પાટ્પી પછી કોજ ઉઠીને પાછી વળી.

પણ કારમનને પોતાના ખરા બળની ખબર હતી. જાજો વખત મિલિટરીની કોડ જીવી શકાય તેવું નહોતું. એણે ખાણની કલ્લેબંધી તજી દઈને નજીકના કુંગરામાં નિવાસ લીધો.

સરકારે કલા 'વેબાન્સદા'ની રૂપા-આણ જર્ઝીમાં લઈ લીધી. ખાણિયાઓને વીજા માલિકોના હાથ તળે મુકાવું પડ્યું. પરંતુ એમ કારમન કેમ પોતાની માલિકી સોંપી દઈ શકે? વહાલા ભાઈનું શોણિત ત્યાં સીંચાવું હતું. બહારવટિયણે મનથી નિરધાર કર્યો કે રાજ ભલેને મારી વતી વહીવટ કરતું. બાકી ભોગવટો તો મારો જ છે, તે મારો જ રહેવાનો. રૂપાની પાટ રાજને ઘેરે નહિ જઈ જઈ શકે.

એક મહિનો વીતી ગયો છે. રૂપાના લાટાનો ગંજાવર જથ્થો તૈયાર થઈ ગયો છે. રાજના વહીવટદારોએ ખચ્ચર-ગધીડાંની પીઠ ઉપર લાટા લદાવ્યા છે અને બસો-ત્રણસો ખચ્ચર - ગધીડાંનું એ લંગર, કસકસ થતી પીઠને લીધી ધીરાં ડગલાં માંડતું, મજબૂત ચોકીપહેરા નીચે રેલગાડીના મથક તરફ ચાલી નીકળ્યું છે. સત્તાવાળાઓ બેધડક છે, કેમ કે એક મહિનાથી બહારવટિયણનો જરી સળવળાટ પણ સાંભળ્યો નથી. સૌએ માનેલું કે કારમન ક્યાંક છેટે નીકળી ગઈ હશે. પણ બહારવટિયણ તો પોતાની વાટ ઉપર ખબરદાર ઊભી હતી. એની ગરુડ-શી ટાંપ ગાફેલ નહોતી. ખાણમાં શું-શું ચાલી રહેલું છે તેની રજેરજ બાતમી એના પહાડી જાસૂસો એને પહોંચાડી જતા. એટલે આજ કારમન રાજવાળાઓને બતાવી દેવા ખડી હતી, કે કોણીનો ગોળ ચાટવો કેવોક કઠણ છે. ધરતીનાં પોડાં ફાટીને નીકળે તેવી અણધારી ફક્ત એકસો આદમીઓની કોજ વાટમાં ખડી થઈ ગઈ. મોખરે ઊભી રહી હતી જોગમાયા કારમન. પિસ્તોલની નળી નોંધીને એણે પલટનને પડકારી : “આ બાપડાં ખચ્ચરોએ તમારું શું બગાડ્યું છે? એની તો દયા રાખો! હટી જાઓ એક બાજુ, જરા વિસામો ખાઈ લો તમે બધા. ત્યાં અમે આ પશુડાંનો ભાર હળવો કરી નાખીએ.”

પોતે મિલિટરીની ટુકડી ઉપર પહેરો ભરતી ઊભી રહી. એના સાથીઓએ ખચ્ચરોને રૂપા સહિત પહાડોમાં તગડવા માંડચાં. મિલિટરીના માણસો મોં વકાસીને ઊભા હતા તેની સામે કારમને ટોપી ઉતારી હસતે મોંએ વિદાયની સલામ કરી. જોતજોતામાં તો એનો રેવત પૂછનો જંડો ફરકાવતો અદશ્ય બન્યો.

સ્વખનું આવીને ઊડી ગયું હોય તેવું બની ગયું. ઘડી-બે ઘડીમાં જ મિલિટરીએ આખું જુંગલ સૂનકાર બનેલું દીકું. આંખો ચોળીને ટુકડી પાછી પાટનગરમાં ચાલી ગઈ.

લોકલાગણી કોણ જાણો શા કારણથી હંમેશાં બહારવટિયાને માથે જ ફળી પડે છે. એમાંથી એક છોકરીની આ જવામદીએ તો લોકોને ઘેલા કરી મૂક્યા. હરએક જબાનના ટેરવા ઉપર ‘બહાદરિયાં બેટી કારમન’નું નામ રમે છે. ને આ છેલ્લી બહાદુરી સાંભળીને

તો લોકો હસવા લાગ્યા, ચોરે-ચૌટે, પીડામાં ને હોટેલોમાં બસ કેદી ભગાઈને જાગાયાર
દાંત કાઢવા લાગ્યા કે, “આ દાઢીમૂછના બસો-ચારસો ઘણી કારનૂસના પણ ખાલે નાખીને
દિવસ-રાત પાટકી રહ્યા છે, એ સૌને પેલી ગોડણ જેટલી શોકરી ભારે પડી ગઈ, બંગડી
પહેરી લ્યો હવે ભાઈ, બંગડી! બંદુકું જાલનારા લાથ તો બીજા.”

આ કેકડી અને આ કટાક્ષોથી તપ્પી જઈને રાજના સત્તાવાળાઓએ બેવડી દાંતે પલટનો
ઉપર પલટનો દોડાવવા માંડી. દુંગરેદુંગરા બુંદાવી મૂક્યા, પણ કારમન ક્યાંથી જ્યાંતે આવે?
કારમન તો સંતાકુકડી રમતી હતી.

એનું એ રૂપાપાટોથી લાદેલું લંગર તગડીને કારમન ઉડી ગીરમાં ગાયબ બની ગઈ.
પહોંચી છેક રાજદારી વિન્દૂર-સરદાર જીમેનેજની પાસે, ત્યાં જઈને સરદારની સેવામાં એણે
એ રૂપું અને પોતાની ફોજ અર્પણ કરી દીધાં.

“મારો બહારદરિયો બચ્યો કારમન આજ મારા બેળો ભળે છે એ તો મારે મન મોદી
વધાઈની વાત,” એમ કહીને સરદારે એની ટુકડીને પોતાના સૈન્યમાં અપનાવી લીધી. એ
પછી તો બહારવટિયણે રાજની જિસ્તો સામે કંઈ કંઈ વિંગાળાં જેલ્યાં. એની સરદારીવાળી
ટુકડી જ્યાં જ્યાં તૂટી પડી ત્યાં ત્યાં નેજાની ફિલે વર્તાવી, શત્રુઓ પણ આ ઓરતનાં ઊજળાં
વીરત્વ નિહાળીને હેરત પામી ગયા. એક વાર જેવી મસ્તીથી એ ઘારને રંગે ચડી હતી
તેવી જ મસ્તી એણે આ મયદાને જંગોમાં જમાવી દીધી. જાણે કે જીવતરમાં એ લહેરથી
રમતી હતી - નાનપણમાં સાંદ્રીઓને ખોળે ક્રોમારની રમતો રમી, જોબનની કણી જેઠી
ત્યારે વિશ્વાસે પાંખડીઓ ઉધાડીને હૈયાની વચ્ચ્યોવચ્ચ પિયુપ્રેમના ભમરાને લોટવા, ગુંજવા
અને મધુ ચાખવા દીધો. આજ એ કણી કરમાઈ ગઈ છે, પાંખડીઓ ખરી પડી છે, અને
ઘારને કંઠે બાથ લેનાર ભુજાઓએ મર્દીનાં માથાં સાથે શોણિતના ફૂલદા મેલવા માંડેલ
છે.

[6]

લોકોએ તો કંઈ કંઈ વીરકથાઓ આ ઘારી બહારવટિયણના નામે સંઘરવા માંડી.
સૌના મનમાં એક જ વાત હતી કે એક પુરુષની બેઈમાનીના ઘાંબે એના કલેજાના છુંદા
કરી નાખેલા છે. એ કલેજામાંથી મર્દ જાત પ્રત્યે વિકાર અને વૈર જ પુકારી રહેલાં છે.
કારમનનો પંજો જ્યાં પડે છે ત્યાં આવો કારમો પડે છે તેનું ખરું કારણ પણ એ જ છે
કે એણે પુરુષની બેવજાઈનો વૈર-કટોરો પીધો છે. એટલે જ આવું માની બેઠેલાં લોકો એક
દિવસ અજાયબીમાં ગરક બની ગયાં. પીડાં અને મયખાનાં એક ન મનાય તેવી વાતનો
ગુંજારવ કરી ઊઠ્યાં : ‘બેટી કારમન તો ઘારના પિંજરમાં પુરાઈ છે, પહાડોમાં એને દિલોજાન
સાંપડવો છે.’

કોણ હતો એ કાળકાનું દિલ જીતનારો?

એ હતો એક સાહસદેલડો મરણિયો અંગ્રેજ બચ્યો : નામે જોક હાલી, આઠેપ પહોર
જેણાં ઘડ ઉપર માથાં ડગમગી રહ્યાં હોય, જેને પથારીમાં પડીને મરવાનું કડવું તેર થઈ
પડવું હોય, જિંદગીને બસ એક જુગારીના તોરથી સાહસો ઉપર જ નિસાર કરી દેવાના
જેને મનોરથ હોય, એવાં માનવીઓ માંહેલો આ એક મસ્ત અને ડેલરિયો માનવી બીજા
કર્શાને ખાતર નહિ પણ કેવળ મૃત્યુની મોજ લુંટવાને ખાતર આરીઝોના પ્રાંતની સરહદ

ઓળગીને બાજા ડેટલાડ દોસ્તોના સંગાથે આવી સરદાર જીમને જન્મ કિનું રેન્ચના હતો, ચાકડીએ નોંધાવો હતો.

એવા એ નિષ્ઠપણી, જંગબલાદુર અને ડોલરિયા જુવાનના હસતી આનન્દના આંખડીઓએ અને ભોળા શિશુ જેવી પસ્ત નાદાનીને કારમનનું કરાલ હેણું જની તીફું આ સાચુકલા પિયુને એણો કોઈ શીતળ છાંયડાના છાકમણોળ શહેરી અમન-ચયમનમાં નહિં, પણ મોંતની મહેદ્દિલોમાં, ઘોર ધિંગાઝાંમાં પારખ્યો હતો. બડાખડાટ હસતો એ જુવાન શત્રુઓની ગોળીઓના મેહુલામાં સ્નાન કરવા ખાબડી પડતો અને રણકલ્લોલ મચાવતો. કટોકટીની ઘડીમાં પણ એની આસમાની આંખોના મલકાટ અને તોફાની બડાખડ અદ્ભુત કરમાયાં નહોતાં. એવા રંગીલા વીરની મોહિનીએ કારમનના લોખંડી શૌયકવચની નીચેથી પોઢી ગયેલા પ્રેમને ફરી જાગ્રત કર્યો. બેઉ જણાં આંકડા ભીડીને મૃત્યુની રક્તલીલા માણવા નીકળતાં. રાજ-ફોજોના ગોળી-ટકારનું સંગીત બેઉ સંગાથે સાંભળતાં. 'મરીએ તો બસ આ રીતે આંકડા ભીડીને જ મરીએ!' એવા એ બન્નેના અભિલાષ હતા. સમરાંગણને માંડવડે અને તલવાર-બંદૂકને તોરણો આ જોડલું પરણી ચૂક્યું હતું.

- ને કારમનના અંતરને છૂપે ખૂંઝો એક આશા ધબકતી હતી : કે વહેલુંમોટું એક દિવસ મારા સરદારનું રાજદ્વારી બહારવટું પાર પડશે, રાજ એની સાથે સુલેહ કરીને સર્વને માઝી આપશે, તે સૌની સાથે મારો પણ છુટકારો થઈ જશે. પછી હું આ ડોલરિયા વીરનરની સાથે ઘર માંડીને મારી આવરદા શાંતિથી પૂરી કરીશ. હું ફરી વાર સમાજનું માનવી બની જઈને મારા આજ સુધીના સંહારનું પ્રાયશ્ચિત્ત કરીશ. પણ એ આશા અસાર નીવડી. રાજસ્તાએ બંડખોરોનાં દળબળને સાફ કરી નાખ્યું. દુનિયાની ગોદમાં પાછા જવાની તમામ આશાને વિસર્જન કરી દઈ કારમને પોતાના પિયુની સહાયથી પોતાનું બહારવટું ચાલુ રાખ્યું. એ બહારવટામાં કદાપિ એણો કોઈ પણ લોકને લુંટેલા નથી. એણો તો જ્યારે જ્યારે બની શક્યું ત્યારે ત્યારે રાજની જ માલિકીની માલમિલકતો ઉપર ધાડ પાડયા કરી. રાજનાં થાણાં અને કોઈારોને આગ લગાવી. રાજનાં લશકરો માટે લઈ જવામાં આવતાં ઘોડાં તગડચાં. લોકોએ ભાખ્યું કે કારમન એટલે 'અભય'નો અવતાર. કારમનનું નામ તો કાયરને પણ શૂરાતનનાં પાછી ચડાવતું થઈ ગયું. 'રણચંડી કારમન! રણચંડી કારમન!' એ નામનું રટણ ચાલ્યું.

એનું મોત પણ એવું જ ભવ્ય, એવું જ કરુણા બની ગયું. એક દિવસ એનો ડોલરિયો પિયુ કોઈ બીજે ધિંગાઝો નીકળી ગયો છે. અને કારમને પોતાના કટકને લઈ એક રાતે રાજની એક અસ્વશ્રાણાના મકાનને ઘેરી લીધું. હિમારતને આગ લગાવી.

પોતે પોતાનો ઘોડો લઈને થોડે છેટે બંદોબસ્ત રાખતી ખડી છે. વિશ્વાસઘાતની ચિત્તા સળગતી હોય તેવા ભડકા છલંગો મારતા મારતા એ મેડીબંધ ઊંચા મકાનની ચોમેર વીંટળાઈ વળેલા છે. અને બીજી તરફથી બહારવટિયણાના સાથીએ સરકારી ઘોડાંને, ખર્ચરોને, દુધાળાં જાનવરોને, ઘેટાંબકરાં તમામને તગડી બહાર કાઢી રહેલા છે. એવામાં ઓચિતી કિકિયારીએ સંભળાઈ અને બે અનુચરોએ 'બચાવો! બચાવો!' ના આર્તનાદ કરતી એક ઓરતને બહારવટિયણાની સન્મુખ રજૂ કરી.

“કેમ, શું છે, બાઈ!” કારમને સવાલ કર્યો.

“ઓ કારમન! ઓ બહાદુર કારમન!” ઓરતે એ બળી રહેલી હિમારતની મેડીમાં

ન ભડકા વરચે દેખાતાં બે કાળાં બાકોરાં સામે આંગળી બતાવીને કહ્યું : “ત્યા -
મેડી ઉપર મારાં બે નાનાં બચ્ચાં રહી ગયાં છે. ઓ કારમન ! ઓ બહેન ! મારાં બે
સુતે - મારાં રંકનાં બે રલોને બચાવો ! બચાવો !”

કશું જ પૃથ્વિએ કે વિચારવા રોકાયા વિના કારમન દોડી, ધોડી પલાણીને દોયાદોર
જે સળગતા મકાન પર પહોંચી ગઈ. છલાંગ મારીને હેઠી ઉત્તરી, ધોડાના પલાણ પરથી
એક કુમળી જોઈ લઈને શરીર પર ઓડી લીધી. ને પછી એ બડકે વીટાયેલા, ગોટેગોટ
પુમાડી ગુંગળાઈ ગયેલા મકાનના બારણાની અંદર એ દોડી ગઈ. કોઈ એને રોકી શક્કાં
નહિ. બે નિર્દોષ બાળકોની હાય એને કાને પુકારી રહી હતી. હજારો ભુજંગો છલાંગો મારીને
કૂશડતા હોય એવી આજિનજાળો એ ઠમારતનાં લાકડાને સર્ડડ સ્વરે સળગાવતી હતી,
એને કાટવળો પંડુ પંડુ થઈને કડકા કરતો હતો. એવા એ રૈરવના ડાચામાં કારમને જ્યારે
દોડ દીધી. ત્યારે ત્યાં ન-હતું કો વિશ્વાસધાતની વેર-વસૂલાતનું ધગધગતું જનૂન, ન હતી.
કોઈ આશકના આલિગનમાં ભીસાઈ જવાની પ્રણાય-વેદના, ન હતી બીજી કોઈ ઉતેજના;
એ હતી નિજ હાથે થયેલા અન્યાયની નિવારણ-બુદ્ધિ. કદાચ એ જનેતા-પદની તાલાવેદી
હશે, મરતાં મરતાં કદાચ માતૃત્વ પણ માફી દેવું હશે. કોણ જાણો !

દાખલ થઈ તે થઈ - પાછી કદી કારમન બહાર નીકળી નહિ. ક્યાં સુધી ગઈ, મેડીએ
ચડી શકી કે નહિ, બે સુકુમાર બચ્ચાંને આગના પંજામાંથી ઝૂંટવીને પોતાની છાતીએ લીધાં
કે નહિ, ચૂમીએ ચોડી શકી કે નહિ, તેની ખબર કોઈને નથી પડી. એના સાથીઓએ એ
બારી ઉપર નિસરણી પણ માંડી હતી. હમણાં બચ્ચાંને બહાર ફેંકીને આપણા હાથમાં જિવાવી
દેશે : હમણાં એ દયાની દેવી સમી જનનીમૂર્તિ નિસરણીએ પણ દઈને બહાર નીકળી જશે :
એવી વાટ જોતા સાથીઓ ઊભા છે. ત્યાં તો -

કડુડડ ! ધૂબ ! એવો એક અવાજ - ને આખી ઠમારત તૂટી પડી. એ સળગતું ખંડેર
કારમનની પાક આરામગાહ બની ગયું. એના શરીરનો અથવા તો એ જેને ઉગારવા ગઈ
હતી તે બે નિર્દોષ બાળકોનો - કોઈને પત્તો જ મળ્યો નહિ.

મરિયો શિકારી

પહાડની ટેકરી પરથી પાવો અને ઢોલ વગડ્યા. એ ઢોલ અને એ પાવો પોતાની મહીએ ઉભો ઉભો મરિયો પિયાનેતી બજાવતો હતો. ગામલોકો સમજી ગયા કે આજ મેરિયો આપણને ગોઈ ખાવા બોલાવે છે. લેરખડા અને ગુલાબી જિગરના એ જુવાન શિકારીની ઉઝાણી જમવા જુવાન, વૃદ્ધ તેમ જ પરંપરાઓ અને કુમારિકાઓ દોટમદોટ નાચતાં-કૂદાં ઉઝાણી જમવા જુવાન, વૃદ્ધ તેમ જ પરંપરાઓ અને કુમારિકાઓ દોટમદોટ નાચતાં-કૂદાં ઉઝાણી જમવા જુવાન. શેકીબાફીને મસાલેદાર બનાવેલો શિકાર પોતાના ભાંગલા મેજ ઉપર ટેકરીએ પહોંચ્યો જતાં. શેકીબાફીને મસાલેદાર બનાવેલો શિકાર પોતાના ભાંગલા મેજ ઉપર ટેકરીએ પહોંચ્યો જતાં. શેકીબાફીને મસાલેદાર બનાવેલો શિકાર પોતાના ભાંગલા મેજ ઉપર ટેકરીએ પહોંચ્યો જતાં. શેકીબાફીને મસાલેદાર બનાવેલો શિકાર પોતાના ભાંગલા મેજ ઉપર ટેકરીએ પહોંચ્યો જતાં. શેકીબાફીને મસાલેદાર બનાવેલો શિકાર પોતાના ભાંગલા મેજ ઉપર ટેકરીએ પહોંચ્યો જતાં. શેકીબાફીને મસાલેદાર બનાવેલો શિકાર પોતાના ભાંગલા મેજ ઉપર ટેકરીએ પહોંચ્યો જતાં.

વીસ જ વર્ષનો એ ફાંકડો જુવાન હતો. ઠટલી અને સ્વિલ્જર્લેન્ડ નામના બે દેશોને સીમાડે પડેલા આલ્સ પર્વતની અભેદ્ય કરાડો ઉપર બંબે બે-જોટાળી બંદૂક નાખીને કોઈ કાળિયારની માફક મેરિયો હડીઓ કાઢતો, અને એની ગરુડ જેવી તીણી આંખો ભૂખરા રંગનાં પહાડી સાબરોને હુંઠતી. ભલભલા શિકારીઓ આખો દિવસ ભટકતા તોપણ આ પવનવેળી જાનવરો ઝપટમાં આવતાં નહોતાં, પણ મેરિયોની દોટ અને નિશાનબાજી કોઈ અજ્ઞબ ભાતની હતી. ખરી વાત છે કે કુંગરમાળ ઉપર દોડતાં સાબરડાંની લગોલગ પહોંચીને ઝપટભેર ભડકો કર્યા વિના જાનવર પડે તેમ નહોતું, ને એક વારનો ગોળીબાર ખાલી જાનવરનું અંતર માપવામાં નજર સહેજે છેતરાઈ જતી અને પછી તો એક ભડકાના સોગણા પડછંદા ખીંચોખીણને તેમ જ ટૂકેટૂકને એટલા તો ગુંજાવી મેલતા કે આસપાસ વીસ-વીસ ગાઉની સીમમાંથી તમામ પશુઓ પોબારા ગણી જતાં.

છતાં મેરિયોનો ભડકો તો સદાનો અફર. એની ગલોલી તો બંદૂકની નાળીમાંથી છૂટી કે એકાદને ચોંટી જ સમજવી. બિલ્લીપગાં પેતરાં ભરીને દોટ કાઢતો એ છેક પશુની લગોલગ જઈને નિશાન લેતો, અને સાંજ પડે ત્યારે એકદા જાનવરને કાંધ પર નાખીને જ નીરે ઉત્તરતો. પણ પોતાનો શિકાર એ કદાપિ વેચતો નહિ. પૈસાની એને લાલસા નહોતી. ગરીબ ગામડિયાં ભાંડુઓને તેડાવી મહેફિલ ઉડાવવામાં જ એને મોજ હતી. અનંત લાંબી ઝડીઓ અને કુંગરાઓમાં દિવસ - રાત એકલવાયા ઘૂમાઘૂમ કરીને એ નાણાં નહોતો રળી શક્યો, પણ લહુ, પેશીદાર હાથપગની ગુલાબી તંહુરસ્તીરૂપી અમૂલખ કમાણી એણે કામી હતી. આ એકલવાયા રજણપાટની અંદર પહાડની અબોલ ગાંડી કુદરતે આ જુવાનની પ્રકૃતિમાં એક રમ્ય અને ઘોર તત્ત્વજ્ઞાન પણ વહી દીધું હતું.

મેરિયોના જીવનમાં પહેલો પલટો એના બાપુના અવસાન ટાળે આવ્યો. ઘરબાર અને માલમિલકત પોતાના નાનેરા ભાઈને ભજાવીને મેરિયો જીનોવા નગર ચાલ્યો ગયો. અને ત્યાંથી, પોતાના અનેક દેશભાઈઓની માફક એ પણ તકદીર અજમાવવા સારુ અમેરિકાનો દેશાવર ખેડવા ઉત્તરી પડ્યો. કેટલાંક વધો સુધી એણે સખત મહેનલમજૂરી કરીને તેમ જ પેટે પાઠ બાંધીને આખરે થોડીક મૂડી બચાવી, ને પછી પરાધીનતા છોડીને સ્વતંત્ર રોજગાર માંડવાની મનની મુરાદ બર આણી. એન્ટોની ફેરારી નામના એક મિલાનવાસીની સાથે ભાગમાં એણે પોતાના રસાળ વતનમાંથી આસવોની અને મેવાની આયાતનો ધંધો ઉપાડ્યો.

આલ્સ પહાડનો લોરખડો શિકારી માધું ઊંઘું ઘાલીને, એક ઘડી જ જંયા વગર તવંગર થવા સારુ તનતોડ ધંધો ચલાવી રહ્યો હતો એનું એક ઓર મીઠું કારણ હતું : મેરિયોની આંખ પોતાના ભાગીદાર ભાઈ ફેરારીની જીવાન દીકરી બેટીનાના ઉપર નિશાનબાળ તાકી રહેલી છે. બેટીનાના ગુંચળાંદાર કાળા કેશો અને સ્વખભરી, વૈનથેરી ને મોટીમોટી આંખોએ મેરિયોના મોજશોખ અને એશારામને ઉરાડી મૂક્યો છે. બેટીના એના બાપને બહુ વહાલી છે, કેમ કે એનો જન્મ થતાં થતાં જ માતાનું મૃત્યુ નીપજેલું અને બાપે બીજું ઘર કરવાને બદલે બેટીને જ લાડકોડથી ઉછેરી આવડી મોટી કરેલી. એવી દીકરીને બાપ કોઈ રજણતી દશામાં ફંકવા નહોતો માગતો. મેરિયો એટલા સારુ થઈને દોટમદોટ પોતાનો ગૃહ-માળો બાંધી રહ્યો હતો.

પણ આ જીવાન ઠિયાલિયનની દિન-દિન ચડતી કળા ઉપર ઈર્ધાના, ખૂની, લૂટાડું દાનતના કાળા ઓળા પડી રહ્યા હતા. અમેરિકામાં ‘મેનો નીરા’ (કાળો પંજો) નામની એક છૂપી ઠિયાલિયન ખૂની મંડળી પથરાઈ ગઈ હતી. એનો કાળો પંજો પૈસા માટે જાસ્તાચિહ્નીઓ લખતો, હત્યાની ધમકીઓ મોકલતો.

એક દિવસ સવારે વૃદ્ધ ફેરારી મેરિયોની ઓફિસમાં દોડતો આવ્યો, ખુરશી પર ઢગલો થઈ પડ્યો. એના મોં પરથી લોહી ઉડી ગયું હતું. એના હાથમાં એક ગંદા કાગળનો કટકો હતો.

“શું છે?” મેરિયોએ પૂછ્યું.

“મેનો નીરા ! બંધુ, મેનો નીરા !” એમ બોલતાં, એણે કાગળિયો મેરિયોના હાથમાં મૂક્યો : “એ કાળા પંજાએ મને આ ત્રીજી વાર જાસો મોકલ્યો છે, આમ જો! ઓ મૈયા મેડોના ! હું હવે શું કરું?”

મેરિયોએ ઘૃણાપૂર્વક એ કાગળિયો ઉધાડ્યો અને એમાનું લખાણ વાંચ્યું - કેટલું ટૂંકું અને ભયાનક ! : “પાંચ હજાર ડોલર રોકડા, શ્રીમાન ફેરારી, આવતી કાલે દસ વાગ્યે : તેનીની દુકાન પર : નોટોનું પડીકું તારા ડાબા હાથમાં ઢીલું ઢીલું જાલી રાખજે અને એને ખેંચી જનાર આદમી સામે નજર સરખી પણ કરતો નહિ. નહિતર મોત.”

આની નીરો એક પંજો અને એક છૂરી કોઈ અણાધડ રીતે ચીતરાયેલાં હતાં.

મેરિયોએ પોતાના ભાગીદારની સામે નજર ચોડી.

“તેં મને અગાઉ કં આ નહોતું કહ્યું? આમ કેટલુંક થયાં એ લોકો તારી પાછળ પડ્યા છે?”

ફેરારી શરીર નાખી દઈને બેઠો. પસીને રેબજેબ હાથરુમાલ વતી લૂછ્યા.

“એકો જાસો એક મહિના પર આવેલો. તેમાં પણ હજાર હેડર ટાપાલથી મોકલવાનું જાણેલું નહિ તો બેઠીનાનો જાન વેવાની ધમકી દીવિલી. એટલે મેં મોકલ્યા.” ફેરારીનો જાસ બોલતાં બોલતાં ગુગળાયો.

“હું - “ ઘોઘરે અવાજે કુદાર કરતો મેરિયો ઉભો રાઈ જાયો, એનો ચઢેરો લાલગોળ બની જાયો. જાસ વાર તો એનાથી કશું બોલાયું નહિ. પછી ફેરારીના જાસ લલલલાલીને બની જાયો. જાસ વાર તો એનાથી કશું બોલાયું નહિ. પછી ફેરારીના જાસ લલલલાલીને બની જાયો : “હું - તે મોકલ્યા ? એ રે બેનુદું ! - હું એ કુટ્ટાઓને બરાબર પણ એસે જ્ઞાન નાખી : “હું - તે મોકલ્યા ? એ રે બેનુદું ! - હું એ કુટ્ટાઓને બરાબર પણ એસે જ્ઞાન નાખીશ ! બેઠીનાનો જાન વેવાની ધમકી ? આહ, પણ એનું સાધરણની રેણુ એ એસોએકને બસાવીશ ! બેઠીનાનો જાન વેવાની ધમકી ? આહ, પણ એનું સાધરણની રેણુ એ એસોએકને બસાવીશ ! બેઠીનાનો જાન !”

હું કાર મારીશ. આહ ! બેઠીનાનો જાન !”
શ્વરી વારે કઢા પડીને એસે ટેલિફોન પડુકારો; છૂપી પોલીસના જાસ ટ્રેકિંગ નાંથી વાત કરી.

અમેરિકામાં વસતા ધનવાન ઈટાલિયનોને સત્તાવીને નાણાં પડાવી રહેતી જે અધિક છૂપી મંડળીનું મુખ્ય ધામ નેપલસમાં હતું. પણ એનો પત્તો પોલીસખાતું મેળવી શક્કાં નહોંનું. એ મંડળીની શાખાઓ દુનિયાભરમાં પથરાયેલી હતી અને પારોસમાં પણ અનેક જાણાનો એ મંડળીની શાખાઓ દુનિયાભરમાં પથરાયેલી હતી અને પારોસમાં પણ અનેક જાણાનો તેમ જ ખૂનો તેમનાં જ કરતૂકો હોવાનું મનાયેલું. અનેક ઈટાલિયનો આ કાળા પંજાના છૂપા તેમ જ ખૂનો તેમનાં જ કરતૂકો હોવાનું મનાયેલું. અનેક ઈટાલિયનો આ કાળા પંજાના છૂપા ત્રાણી ગ્રાહિ પોકારીને પોતાના વેપાર-રોજગાર સંકેતી વતન તરફ ચાલી નીકળેલા. પણ જાસથી ત્રાણી પોકારીને પોતાના વેપાર-રોજગાર સંકેતી વતન તરફ ચાલી નીકળેલા. પણ વધાસમાં ચડતાં પહેલાં જ તેઓની હત્યા થયેલી. કમભાગ્યે પોલીસના હાથ ડેઢ પડ્યા. કેમ કે આ નનામા જાસા તથા હત્યાઓથી પ્રજમાં એટલી ધાક બેસી ગયેલી કે કોઈ હતા. કેમ કે આ નનામા જાસા તથા હત્યાઓથી પ્રજમાં એટલી ધાક બેસી ગયેલી કે કોઈ હતા. પણ આદમી છૂપી પોલીસ સાથે સહકાર કરવા છાતી કાઢતો નહોતો.

એક દિવસ પોલીસ અને મેરિયો વરચે એવું હ્યું કે જાસાચિહીમાં જણાવ્યા મુજબ ભાઈ ફેરારીએ એ દુકાન પર બનાવટી પરબીડિયું લઈને મુકરર સમયે ઉભા રહેવું, ને પોલીસે સાદા પોશાકમાં થોડે દૂર હાજર રહેવું. પરિણામે પેલો પરબીડિયું ખેંચવા આવનાર આદમી પકડાયો જરો, પણ તપાસ કરતાં એ તો કોઈ રોજું ખીસાકાતરું નીકળ્યો અને એને પૂછતાં એઝો જણાયું કે મને તો એક કોઈ અજાણ્યા આદમીએ પેસા આપવાનું કરી આ કામ કરવા રોકેલો છે. મને કહેવામાં આવ્યું છે કે તારે આ કામ પતાવીને ચાલી નીકળવું, પછી રસ્તામાં ચાહે ત્યાં એ લુંટનો માલ કબજે કરીને અમે તને તારું મહેનતાણું ચૂકવી આપશું.

આમ આ આદમીના પકડાઈ ગયા પછી મૂળ ટોળીને હાથ કરવી અશક્ય હતું.

ફેરારીની સાથે તે દિવસથી છૂપા પહેરેગીરો મૂકવામાં આવ્યા. એના પેટમાં ઊંડી ઝણ પેસી ગઈ હતી. પરંતુ મેરિયોએ તો નિર્ભય દિલે આ છૂપી મંડળીની શોધમાં પોલીસની સંગાથે જુકાવી દીધું. એક અઠવાડિયામાં એઝો કેટલાકને પકડાવી આપ્યા. દરમિયાન એક પ્રભાતે મેરિયો પોલીસની ઓફિસમાં કોઈ ત્રાણ પામેલા પશુની માફક દોડચો આવ્યો; અને ખબર દીધા કે છાતીમાં છૂરીના જખમો કરી કોઈએ મારી નાખેલો ફેરારી એના ઘરમાં પડ્યો છે અને એને ત્યાં દસ વર્ષથી નોકરી કરનાર નોકરનો પત્તો નથી. મારા પર પણ જાસાચિહી મોકલી છે. લખ્યું છે કે, “હવે વધારે દખલગીરી કરતો નહિ. નીકર તારા પ્રાણ કરતાં પણ જે તને પ્રિય છે તને તું હારી બેસીશ.” નીચે પેલું, પંજાનું અને છૂરીનું ખૂની ચિત્ર હતું.

મેરિયો નિર્ભય હતો. રોષે ભલ્લૂકી રહ્યો હતો.

પોલીસ અમલદારે પૂછ્યું : “આનો શો અર્થ ?”

“સાહેબ, એનો અર્થ એ કે આ લોકો મારી ઘારી બેઠીનાને - કેગરીની પુરીને - ઉઠાવવા માગે છે. ઓહ, કુતાઓ ! એ લોકો જાણે છે કે આ તો મારું કલેજના મર્મ પરનો કારી ધા છે. મને ખરેખર એની જ બીક છે. બેઠીનાને હું આઈ એના પિતાના મોતની હૃકીકત કહેવા લઈ આવ્યો છું. આપ એની જુબાની લઈ લ્યો એટલે પહેલું જ કામ હું એની સાથે પરણવાનું ઉકેલવાનો છું, જેથી હું એની રક્ષા કરી શકું. કેમ કે હવે એ એકલી થઈ પડી છે. મૈયા મેડોનાના નામે એહો મને કસમ લેવરાવેલા છે કે એના પિતાનું વેર મારે જ વાળું, ને - કસમ છે દેવી ! હું વેર વસૂલ કર્યે જ રહીશ.”

વીસ વર્ષની કુમારિકા બેઠીના ત્યાં પોલીસ-ઓફિસમાં દૂસડાં ખાતી બેઠી હતી. ધરથરતી હતી. પોતાના પિયુનો અવાજ સાંભળતાં જ એહો ઊંચું જોયું અને મમતા તથા અહેસ્પાન-જરતી મીટ એહો મેરિયોના મોં તરફ માંડી.

“હાં હાં, ચોક્કસ સમજજે, ઘાર !” મેરિયોએ એને કહ્યું, “હું આ કામના કરવાવાળા નેપલ્સવાસીઓને પાતાળમાંથી પણ પકડી પાડીશ.”

ઇન્સ્પેક્ટર ખભા ઉલાણતા સાથી અમલદાર તરફ ફર્યા ને ધીરે અવાજે એહો કહ્યું : “બિચારો આ બહાદુરિયો પણ એ જ માર્ગ ચાલી નીકળશે : હું માનતો હતો કે ઇયાલિયનોમાં કલ્યાનશક્તિ અતિ ઉગ્ર હોવાથી હિમત કરતી હોય છે, પણ આ જુવાન તો ડર શું છે તે જ જાણતો નથી. નિશાનબાળમાં એક્કો છે. વરસોવરસ પહાડોમાં શિકારે જાય છે. જો એક પલક પણ એના મિત્રના ખૂનીઓ એની બંદૂકની નળી સામે દેખાશે તો તો બચ્યાઓને ખબર જ નહિ રહે કે શું બની ગયું.”

વળતે જ દિવસે એ બન્નેનાં લગ્ન થયાં. પોલીસ-અમલદારો લગ્નમાં હાજર હતાં દેવાલયથી પાછા વળતાં એ વરવહુની મોટરગાડી પોલીસની ગાડીથી થોડે દૂર આગળ હતી. એકાએક તેમણે જોયું કે બે મોટર-ખટારા એ વરવહુની મોટરની બન્ને બાજુઓ ચડીને પૈડાંમાં ભરાઈ ઉભા રહી ગયા. દ્રાઈવરો નાસી ગયા. હોકારા-પડકારા અને બોકાસાં બોલ્યાં. પોલીસવાળા ત્યાં પહોંચીને જુબે તો દૂર દૂર એક નાની મોટરને ઢોડી જતી દીકી. અંદરથી બેઠીનાનો સ્કેટ બુરખો ફરફરતો જતો હતો. ટોપી વિનાનો ને લોહીલોહાણ મેરિયો સડક પર ઉભો હતો. એના કપાળમાં ઊંડો ચીરો પડ્યો હતો. ઢોટ કાઢીને એ પોલીસ-ગાડીના શોફરની બાજુની બેઠકમાં ચડી બેઠો અને ચીસ પાડી કે, “ઓ ભાઈ, જલદી ચલાવ, પેલી ગાડીને પકડી પાડ. એ લોકો મારી ઓરતને ઉઠાવી જાય છે.”

શું બની ગયું હતું ! એક જ પલકનો મામલો : ઓચિતાની એની ગાડી સાથે બે ખટારાની અથડાઅથડી થાય છે. એ અધો બેહોશ બનીને મોખરે ફેકાઈ જાય છે : ખટારામાંથી રોળું કૂદી પડે છે : બેઠીનાને ઉઠાવી, પાસે ઉભેલી નાની મોટરમાં નાખી, એનો પત્તિ હથિયાર કાઢે તે પહેલાં તો પલાયન કરી જાય છે.

અમલદારોને ખાતરી હતી કે હવે એ શરતદોડની ગાડી હાથ આવે જ નહિ. તેમણે ચોમેર રસ્તા રૂંધવા માટે ટેલિઝેનો છોડ્યા. પણ મરણિયો મેરિયો બેસી ન શક્યો. પોતાને ઘરથી પોતાની જ મોટરગાડી મગાવીને થોડી ભિનિયોમાં તો અંદર ચડી બેસતો, હાથમાં ‘ચક’ પકડતો અને વાજોવાજ ધૂળની ડમરીમાં અદશ્ય થતો એને જોઈ રહ્યા.

મોડી રાત્રિએ મેરિયોના શોફર તરફથી પોલીસને સંદેશો મળ્યો : “મારા માલિકે

બિજ્યોરી રોડના રસ્તા પરના એક અદૂલા વાડી-બંગલા સુધી ડાકુઓની ગામનો જેણું
લીધો છે."

"શાબારા ! શિકારીની પગેરુ લેવાની શક્કિના એને આમાં ખડુ કામ આપ્યુ વાંચે
છે." અમલદારોએ એ વાડી-બંગલા પર પહોંચીને અંદર દાખલ થતાં જ દીકુ કે પાંચેય
બદમારો હજુ સુધી શરણાગતિની નિશાની તરીકે માયા ઉપર હાથ રાખીને એક પૂણીયમાં
લપાઈ થરથર કંપતા બેઠા છે. એમાંના એકનો હાથ ગોળીથી ચુંઘાઈ ગયો છે ને એ ભૌય
પર ટળી પડ્યો છે. સામે બેઠેલો છે એકાડી મદ્દ મેરિયો. ડાકુઓની સામે બંદૂક તાડીને
શાંતિથી બેઠો છે. બેઠા બેઠા પોતાની પરષેતરને આચાસન આપી રહેલો છે. વાડી વચ્ચે
અદૂલા ઊભેલા એ અંધારિયા મકાનમાં, પાંચ શત્રુઓને શરણાગતિના હાથ ઊચા કરાત્થી
એક જ બંદૂક સાથે બેઠેલો મેરિયો કાળદૂત દેખાતો હતો. પાંચેયને એજો ઠાર નહોતા કૃપા,
કારણ કે પ્યારીની નજર સામે હત્યાકાંડનું ભીષણ દર્શય ખડુ કરવું એ પ્રેમની પવિત્ર સૃષ્ટિમાં
મંજૂર નહોતું.

[2]

"મેરિયો પિયાનેતી!" અમેરિકાની પોલીસે એને સલાહ આપી : "તું હવે અહીં
સલામત નથી. તું તારે દેશ ચાલ્યો જી."

ઘડી જિકરને અંતે એ વતનમાં જવા કબૂલ થયો. પત્નીને લઈને એ એક પછી એક
શહેરમાં રાજ્યથો, નામ-ડામ બદલાવતો ગયો, પોતાની હિલચાલના તમામ સગડ ભૂસતો
ગયો, છતાં એજો જોયું કે 'કાળો પંજો' એનો પીછો છોડતો જ નથી. દિવસ-રાતના આવા
ફુફાટથી થાડીને એક દિવસ ઓળિંતો એ અદરથ્ય બની ગયો અને છૂપી છૂપી અનેક
ભુલભુલામણી રમીને આત્મસ પહાડની અંદરના પોતાના ગામડામાં પત્નીની સાથે પહોંચી
ગયો. એને લાગ્યું કે અહીં હવે આપણને કોઈ નહિ સત્તાવે.

"બેટીના!" એજો આટલે વર્ષે પોતાનું ગામડુ તપાસીને પત્નીને કહ્યું : "આપણું ગામ
તો રાન રાન ને પાન પાન થઈ ગયું છે. ગામભાઈઓની આ દશા દેખીને માદું અંતર
બણે છે. આપણો મૈયા મેડોનાની કૃપાથી થોડું રળી લાભાં છીએ, તેમાંથી કંઈક ગામની
સુધારણા માટે ખરચશું? તારો શો મત છે?"

"જરૂર, જરૂર. આપણે રહીએ એ ગામને કંઈ આવું ભૂખલ્યું રહેવા દેવાય?" માયાળું
દિલની બેટીના ખોળામાં એક કૂલ જેવી દીકરીને ધ્વરાવતી બોલી.

"મેરિયો આખ્યો. આપણો લેરખડો મેરિયો દેશાવરથી માયા રળીને આખ્યો, રૂપરૂપની
અવતાર અમેરિકા પરણી લાખ્યો" : એવી વાત ગામડામાં ધેરધેર પ્રસરી ગઈ. ગરીબ
ગામડિયાં રાજી થયાં. દુંગરામાં ઘેરાં ચચાવીને મુશ્કેલીથી ગુજારો કરનારાં લોકો આશા સેવવા
લાગ્યાં કે મેરિયોના વસવાટથી ગામમાં દિવેલ પુરાશે, ગામનાં નૂરતેજ વધશે.

લીલુડા પહાડોની સાંકડી ગાળીમાં સૂતેલું આ ગામ, અને ગામલોકોની મમતાભરી
ગોદમાં પોતાનું નાનું આ રહેઠાણ : પહાડોમાંથી ગળાઈ ગળાઈને લવંડર, લીલુ, યુકેલિપ્સ
ઠિલ્યાટ સુગંધી જાડવાંની સોડમોને લઈ આવતા મહેક-મહેક વાયરાની સામે બાથ પહોળી
કરીને મેરિયો ઊભો રહેતો. એનું મગજ તર બની જતું. જિંદગીમાં બસ તાજી તાજી ખુશબો

જ છવાઈ ગઈ. આ મારુ જીવનસ્થાન : આ મારી અમરાપૂરી : અહીં મને કોઈ નહિ સંતપ્તાએ. અદાવતના, કિનાઓરીના, ઈધિના તેરી વાપરા અહીં સુધી નહિ જ પહોંચી ગકે.

"પહાડોમાં હવે સાબરડાં રહ્યા છે કે, ભાઈ?" પહેલો જ સવાલ મેરિયોએ પોતાના જૂના ભાઈબંધોને પૂછ્યાં.

"હોવે, હોવે ભાયા!" કુગરાઉ ગોવાળિયાઓએ જવાબ દીધો, "તું વગર તો ઊભાનાં ઘણોધશ ઊભરાઈ પડ્યાં છુ."

"વાહવાહ દોસ્ત, મોજ જામવાની ત્યારે તો," એમ કહેતો ખુશખુસાલ મેરિયો આપલે વર્ષે ફરી પાછો જેવો હતો તેવો જ મોજલો શિકારી બની ગયો.

બંદૂકડી ઉઠાવીને પાછો પહાડોને ખૂદવા લાગ્યો.

પણ ગામને સુધારવાનો નાદ એની રગેરગમાં લાગ્યો હતો. પહેલાં પ્રથમ તો ગામમાં પાછીની તંગી માલૂમ પડી એટલે મેરિયોએ પોતાને જ ખર્ચે એક મોટી ટાંકી બંધાવી, એક કુડ ગળાવ્યો ને એક જાહેર ફુવારો કરાવ્યો. આનો લાભ લેવા આવનારાઓની કનેથી એણે ફક્ત નજીવી ફી ઠરાવી.

પછી એણે એક મકાન ખરીદું, એને સમરાયું, એમાં સરાઈ ઉધાડીને વચ્ચેનો વિશ્વાસ ઓરડો રાસરાસડા અને નાચ-ગરબા સારુ ફાજલ પાડી આપ્યો. સાંજરે સાંજરે ત્યાં મિજલસો ભરાય, ગામડિયાં જોડલાં, આવીને છૂટથી ગાય-નાચે એવી એક યોજના ઘરી. ગામના કેટલાક મોટેરાઓ સતાર, તંબૂરા, સારંગી અને રાવણાહથ્યા લઈ બજાવવા પણ આવતા થયા. ગામભાઈઓને મોટી મુશ્કેલી નિમક અને તમાકુની હતી. ઠટ્ઠાની સરકારમાં એ બેઉ ચીજોના ઠજારા હતા. તેથી સાત-આઈ ગાઉ ઉપરના એક કસબાતી ગામમાં નિમક-તમાકુ સારુ લોકોને જવું પડતું. મેરિયોએ સરકારમાંથી પરવાનો મેળવીને પોતે જ ત્યાં દુકાન નાખી દીધી.

થોડા દિવસમાં તો ગામડાની આખી સૂરત બદલાઈ ગઈ. શિયાળાની લાંબી રાતો રાસ-ગાનો વડે રેલી ઊઠી. પાણીનો ફુવારો અહોરાતું ગુંજવા લાગ્યો. અને નિમક-તમાકુ માટે ગામ લોકોને આઈ આઈ ગાઉના આંટા મરી ગયા. પરંતુ આ સુખસ્વભાગમાં મહાલતા નિર્દોષ મેરિયોને ક્યાં ખબર હતી. કે એણે એક ભોરિંગને છંછેડચો હતો!

એ ભોરિંગ બીજો કોઈ નહિ પણ ગામનો કાળી કફનીવાળો સાંઈ ફેબ્રિસ હતો. આજ સુધી ગામ ઉપર એ ધર્મગુરુની જ આજા ફરતી. બે પ્રેમીઓનું જોડું પોતાનું વેવિશ્વાસ પણ એની રજા વિના નહોંતું કરી શકતું. એની મુન્સફી એ જ કાયદો. એનો ખોઝ વહેરનાર પાયમાલ થઈ જાય. એની ભૂકુટિ સામે લોકો થરથરતા, એના શાપથી ધનોતપનોત નીકળી જાય એવું આ વહેમીલાં ગામડિયાનું માનવું હતું. મરી જનાર માણસ જો પોતાની જમીનનો ટુકડો 'જગ્યા'ને સુપરદ ન કરી જતો તો આ સાંઈ એના વારસ પાસેથી જોરાવરીએ મેળવતો.

આજ એ ધર્મગુરુએ પોતાની હાકેમી તૂટી પડેલી દીઠી. પોતાને પટકનાર મેરિયો એની આંખોમાં દિવસ-રાત ખટકવા લાગ્યો. વળી બળતામાં ધી હોમાયું. મેરિયોને માલૂમ પડ્યું કે નાના ભાઈએ એના ભાગની જમીનમાંથી એક જેતર 'જગ્યા'ને ખેરાત કરી દીધેલું ને. મેરિયો પહોંચ્યો સરકારી કચેરીમાં. એણે કહું કે 'મારી મંજૂરી વગર ધર્મદામાં જમીન આપી દેવાનો મારા ભાઈને હક્ક જ નથી'. પણ ગામના ઘુનિસિપલ સેકેટરીએ એને કોઈ જ ન

આખ્ય. સાંઈબાપુની સામે ઊઠનારો મેરિયો સેકેટરીની કચેરીએથી અપમાન પામીને પાકું વણ્ણો. સાંઈ સાથે પણ એને ટપાટપી બોલી ગઈ.

બીજે દિવસે ગામ સમસ્ત જોઈ રહ્યું : સાંઈએ પચાવી પાડેલા એ તકરારી બેનરની અંદર જ મેરિયોના અને એના નાના ભાઈનાં ઘેટાં ચરી રહેલાં છે અને એની ચોકી કરતો મેરિયો ખબે બંધુક નાખીને ઊભો છે. એની કરડી આંખોની સામે ઊભવા કોઈ ન ડોકાયું.

થોડા દિવસ તો વાત ત્યાં અટકી ગઈ. પણ મેરિયોના સંસાર ઉપર વિકાર, અદ્યવત અને ધાકની કાળી વાદળીઓ ઘેરાવા માંડી. એક પછી એક ગામલોક એની સરાઈએ આવતું બંધ થયું. પનિયારીના ઘેરા ઊમટતા તેને બદલે કુવારાની ટંકી પર કાળા કાગડા જ કણેણવા લાગ્યા. અહોરાત કલકલ નાદ કરતું એ જળજરણું હવે તો ફોગટના જ સાદ પાડી રહ્યું હતું. નિમકન્તમાંકું લેવા પણ લોકો પરગામનો પંથ કરતા થયા. મેરિયોની રોજિંદી મિજલસો ઉજ્જડ બની, ગાણાંબજાવળાં બંધ પડ્યાં. ગામનાં પ્રેમીઓની જુગલ જોડીઓ નાચ રમવા આવતી અટકી ગઈ. લોકો એનાથી તરીને ચાલવા લાગ્યાં, એમ કરતાં તો ગામે બહિઝારની એવી તો ભૌંસ આ વરવહુને દીધી, કે જીવતર કડવું જેર થઈ પડ્યું.

"આ એકાએક શું બની ગયું?" બાધોલા જેવો બની મેરિયો બેટીનાને પૂછવા લાગ્યો.

ઓરતે ફષ્ટતે કલેજે ફોડ પાડ્યો : "લા જેતાતુરા ! વહાલા મેરિયો ! સાંઈનાં જ એ કામાં છે. એણો લોકોને કહ્યું છે કે તમારી કાયામાં શયતાનનો વાસો થયો છે. લોકો તમને અસુર સમજુને છેટા નાસે છે."

"લા જેતાતુરા ! - શયતાનનો વળગાડ !" - ફક્ત ઠટલીનો વતની જ આ શબ્દોની ભયાનકતા સમજ શકે છે. સાંભળીને મેરિયોનો શાસ ઊંડો ઊતરી ગયો.

ફરી વાર એણો પોતાની જૂની મહેદિલો યાદ કરી. ગામલોકો મારી ગોઠ ખાવા ટેણે વળતાં, તો હું ફરીને ગોઠનાં નોતરાં આપું, એમ વિચારીને એણો પહાડના શિકારની મિજબાની પાથરી. ઢોલ-પાવાનાં હજન-નાદ બજાવ્યા. પણ મહેદિલ માણવા કોઈ ન આવ્યું. જમણાનું મેજ સૂનું પડ્યું.

કોઈ અસ્પૃષ્ય રક્તપિત્તિયા જેવો, લોકોને મન કોઈ ઓછાયો પણ ન લેવા સમાન ભયાનક પ્રેત જેવો, સહુને તજેલો મેરિયો એક દિવસના અસ્તકાળે ગામની નિર્જન બજારમાં નિષ્ફળ આંદો મારીને ઘેર આવ્યો છે. બહિઝારના વેરાન જીવનમાં કોઈ એકાદ ગામજનની મીઠી મીટ સુધ્યાં એણો દીઠી નથી. લમણો હાથ ટેકવી, માથું જુકાવી મૂંગાતો-ગુંગળાતો એ ચોગામાં બેઠી છે, ખારાં ગામવાસીઓએ વિનાઅપરાધી જીવતું મોંત નિપણાવ્યું છે. રાતીચોળ સંધ્યાની અંદરથી જાણો કે અપકાર, ફુંટાતા અને દુર્જનની નિષ્કારણ દુર્ભનાવટની રક્તધારાઓ જરી રહી છે : ત્યારે બેટીનાએ એના માથાના વાળ પર મીઠી પંજો પસારીને કહ્યું, "ખારા મેરિયો, બેમાંથી એક રસ્તો નક્કી કરી લ્યો : કાં તો જઈને સાંઈબાપુનાં કદમ ચૂંભી લો, નહિ તો પછી ફરી વાર ગામ છોડીને આપણે ભટકવા નીકળી જઈએ. ભટકી-ભટકી આવરદા પૂરી કરશું."

"સાંઈનાં કદમ ચૂંભું ? - હું એ શયતાનનાં કદમ ચૂંભું ?" બેઠક ઉપર મુક્કો લગાવીને લાલઘૂમ મેરિયો પુકારી ઊઠ્યો : "ના, ના, હું મારું ખારું ગામ પણ નથી છોડવાનો. હું એની છાતી પર બેસીને જીવીશ એ મને શું કરવાનો હતો? અહીં કયાં હવે મારે કકાળા પંજાથી ડરવાનું હતું કે હું ગામ છોડું?"

“મેરિયો! તમે એમ માનો છો કે આની પાછળ કાળો પંજો નથી?...” બેટીનાએ કહી રહે અવાજે પૂછ્યું.

“કાળો પંજો? આ કાવતનું કાળા પંજાનું?” મેરિયો બેટીનાની સામે તાકી રહ્યો.

“ઘરમાં ચાલો. પવનને પણ કાન છે, ઘારા!”

બન્ને અંદર ગયાં. બેટીનાએ ભેદ પ્રગટ કર્યો : “આપણો પડોશી, મિસ્ટ્રી પાઓલો નેચી - એના પર કાગળો આવે છે - નેપલ્સથી, મેં પોતે જ એના ઘરમાં નેપલ્સની છાપવાળો કાગળ જોયો છે.”

“ઓ રે ઘેલી! એ તો એના ભાઈનો લજેલો હશે.”

‘ના, એનો ભાઈ તો ગુજરી ગયો છે. એનું શાબ તો દટાયું છે અહીંના કબ્જસ્તાનમાં. ઓ મેરિયો! આ કબ્જસ્તાનની અંદર એ જ ‘કાળો પંજો’ ડેક્ઝિયાં કરે છે.”

રાતના અંધકારના ઓળા ઉત્તરતા હતા તેને મેરિયો બારીમાંથી જોઈ રહ્યો. એ ઓળાયા કોના હતા! - પોતાની જીવનસર્વસ્વ બેટીનાને ઉઠાવી જતા અનેક પંજાઓ જાણે કે અંધકારમાં આંગળાં પસારી રહેલા છે.

નિઃશાસ મૂકીને એ ઊભો થયો. સામેના ખૂણામાં પડેલી પોતાની ‘દ્રીલિંગ’ - બે-જોટાળી બંદૂક - ઉઠાવી. માથા પર ટોપી નાખી. દ્રીલિંગાને ખંબે ચડાવી.

“કયાં ચાલ્યા - અત્યારે?” બેટીના ચમકી ઊઠી.

“ગભરાઈશ નહિ, હું તોષન કરવા નથી જતો. પાઓલો નેચીને જરા દબડાવી આવું. એ મને ઓળાએ છે. સાચી વાત હું એની કનેથી કઢાવી લઈશ.”

“જોજો હોં! જામોશ!” બેટીનાએ એને કંઠે હાથ વીંટાળી દીધા : “આપણાં બચ્ચાનો વિચાર કરજે, ઓ મેરિયો!”

ઓણે બેટીનાના ગાલ પર મીઠી ટપલી મારી. ખાતરી આપતો હોય તેમ માણું ધુણાયું, ને પછી કમાડને લાત મારી ઉઘાડી એ બહાર નીકળી ગયો.

પડોશી પાઓલો નેચીને ઘેર પહોંચે છે ત્યાં જ ઓણે શું દીઠું! કાળા બુરખાવાળી એક પડછંદ-ઓરતને દોટમદોટ એ ઘરમાં પેસ્ટાફીદીની એને પ્રવેશ કરાવીને બારણું બિડાઈ ગયું. મેરિયોએ એ અજાણી ઓરતના લેબાસ અને ચહેરાની જરીક જાંખી કરી લીધી.

આ પરદેશાણ કોણ ! મેરિયોનું કલેજું કોઈ મોટ સંચા સમું ધબકી ઊઠ્યું. બિલ્લીપગલે એ બારણા પાસે પહોંચ્યો. લપાઈને ઊભો રહ્યો. કાન માંડ્યા.

અંદર કોઈ એક મંડળી બેસીને વાતો કરી રહી છે. કશીક ખાનગી મસલત ચાલે છે.

ઓચિતા એ ગણગણાટની અંદર, જાણે કે અર્ધશૂન્ય અવાજને ચીરીને એક અદ્ભુત ઊઠ્યું, ને આટલા બોલ સંભળાયા : “પછી જે થવાનું હોય તે ભલે થાય. મને પરવા નથી. પણ એક વાર એને ગામ બહાર નિકાલો. એનો ટાંટિયો અંહીંથી કાઢો.”

શબ્દેશબદ્દ કિલાયો. અવાજ પરખાયો - સાંઈ ડોન ફેલિસનો જ એ કંઠસ્વર. મેરિયો ચોકીને ટકાર બન્યો. એના કલેજામાં સૂતેલો લડાયક પ્રાણ જાગી ઊઠીને નસેનસમાં પુકારી ઊઠ્યો. બંદૂકનો કુદો કમાડ પર પછાડીને ઓણે અવાજ દીધો : “ખોલ જલદી, નહિ તો

તાજું ઉડાવી હતું છું. રિશ્યાને છે મને! કું મેરિયો ગામોન પિલાનેતાં પ્રભુ કું જાપણન
બેમાના એકેયનો મને ડર નથી તો તું બાપડો સાંચો કું ડરવાના હતો! ખોટી નાન
ખિડકો!"

એક ઘડી પણ રાહ જોવા વિના એ ધર્યો. ખબા નમાવીને હડરોલો દીધો. કું જાપણ
કરતું એ લાકડાનું કમાડ જુદું પડી ગયું. ઓરડાની વગ્યોવચ્ચ એક મેજ કરતાં પણ પણનો
હેબતાઈને ઊભાં થઈ ગયાં : એક પાઓલો નેગ્રી. બોજો સાંઈમીલા અને ગીજું એ અજાપું
ઓરત.

સાક્ષાત કાળમૂર્તિશો મેરિયો ઘોડી પણ સુધી એ દ્વારમાં ઊભો ઊભો આ નશેય
સામે કરડી નજર કેરવી રહ્યો. નશેયની આંખો બાજુમાં ફરી ગઈ. મેરિયોના પંજામાં પકડેલી
શ્રીલિંગા બંદૂકથી ત્રણોય ધરથરી ઊઠ્યાં.

"ઓ...મ!" મેરિયોએ હળવે રહીને ઉચ્ચારું : "આહીં પણ આવી પણોચ્ચા છો કે
તમે? હિકર નહિ, માદ્ધિયા, કેમેરા, કે મેનો નીરા - તમો ત્રણોય શક્તિઓ ભલે એકસામયી
આવી જુઝો. આંહીં - આ મારા પિતાની ગોદ જેવા આલસ પહાડની અંદર તો હું તમને
ત્રણોયને પૂરો પડીશ. હિકર નહિ."

"અને તું, બચ્ચા નેગ્રી!" કહીને એજો પડોશી તરફ બંદૂક તાકી : "તારો જાન
તને વધાલો હોય તો મને છંછેડવો રહેવા દેજે, મને પડવો રહેવા દેજે. અને તું ઓ પરદેશથી
ઓરત! તું જો ફરીને આંહીં નજરે પડીશ, તો તનેય હું હૂકી દઈશ - તમારી તમામની
સામે વેર વસૂલ કરવાના કસમ લઈશ હું. અને તું કાળમુખા - ' મેરિયો ગૌરવણી ધર્મગુરુ
તરફ ફર્યો : "તને તો હું સૌથી પહેલો ઉપાડી લઈશ. હું તો આમાંના તમામ કરતાં ઊતરેલ
છે. તારી શયતાનિયતનો જોટો નથી. તું બાપવા! જાતે જોખમ ઊઠાવી શકતો નથી, ને
બીજાઓને તારી નાપાક બાજુનાં સોગડાં બનાવી રહેલ છો. આમ જો! દેવીના કસમ -
હું તારી બાજુ રમી કાઢીશ, પણ હું ખાનદાનીની રીતે ખેલું છું - તને હું ચેતાવી દઉં હું
- ને એ ચેતવણી ઉપર કુટિલ ખૂની કાળા પંજાથી નહિ પણ મર્દની બે-જોટાળી બંદૂક વતી
મારા સહીસિક્કા મૂકું છું!" એમ કહીને એજો શ્રીલિંગાનો ઘોડો દબાવ્યો. તેઓના તરફ
બીજી નિગાહ પણ નાખ્યા વગર મેરિયો વળી નીકળ્યો. લેરખડો, દિલાવર અને દોસ્તો માટે
મરી પડતો મહોબ્બત-ભૂખ્યો મેરિયો તે દિવસથી ઓછાબોલો અને ઉદાસ બની ગયો.
પોતાની ઓરત સાથે પણ એ જાંયું બોલતો નથી. એની પાસે પણ કોઈ ઢૂકતું નથી. એના
દિવસો સદાના દોસ્તો સમાં હુંગરાઓમાં ગુજરવા લાગ્યા. પહાડોની ભવ્ય ચુપકીદીમાં એને
પોતાનો આખરી વિશ્રાંમ અને છેલ્લી ઘડીનો આશરો ભાસી રહ્યો છે.

એ મૌનની સમાપ્તિ પણ ઓચિંતી આવી. વંકડિયા વાળવાળી એની સીમોનેટા, એની
વહાલી બાલપુત્રી એકાએક બીમાર પડી. રઘવાયો મેરિયો ગામના એક સ્થાનિક ડોક્ટરની
પાસે દોડવો. "દાક્તર, મારી દીકરી મરી રહેલ છે, ચાલો." દાક્તરે ઘરની અંદરથી જવાબ
કહાવ્યો કે "નહિ આવી શકું." સાંઈએ ફરમાવેલો બહિઝાર!

મેરિયો વેર દોડવો, બીમાર પુત્રીને શાલમાં લપેટી, હથમાં ઉપાડી એ પહાડી કેડીએ
ચતોરાત આઈ ગાઉ પરના કસબા તરફ ચાલી નીકળ્યો. એની પછિવાડે ઓરત અને દીકરો
ચાલ્યાં. ત્યાંની હસ્પિતાલમાં મોડી રાતે બાળકને દાખલ કરવામાં આવ્યું. ઓરતને અને
પુત્રને પડજેની હોટેલમાં ઓરડી લઈ રાખ્યાં.

રાતોરાત મેરિયો પોતાને ગામ પાછો આવે છે. સુરે છે. ઓચિંતા કોઈ મેધગજના-ગામાજથી એ જાગે છે, લાગ્યું કે કોઈ પણ ટૂકુ ઉપર તોફાનની જરી થઈ હતો. પ્રભાતે જીવી જુબે તો પોતાના જળકુડની અને કુવારાની જગ્યાએ એણે ઘૂંઠઘૂંદા બની ગયેલો પણ્યરાતનાનો ને નળનો મોટો ઢગલો પડ્યો છે. એ ખંડિયેરની પાસે અને ઊભેલો દેખીને ગામલોકો લેણ્યો જ પાછા ફરી જતા હતા. જતાં જતાં તેઓ આ અસુરની મેલી નજરથી ઉગરવા જરૂર કંઈક રક્ષામંત્રો રટતા હતા. અને છાતી ઉપર કોસ આપારે હાથ જોડતા હતા. આપો દિવસ મેરિયો આ કૃત્ય કરનારાની બાતમી લેતો આધયક્ષો. અને જાણ થઈ કે કોઈ બે અજાણ્યા નગરજનોનું આ કૃત્ય છે. ને હજુ બેઉ ગામમાં જ છે.

હૈયાના ઉકળપટને દ્વારા રાખીને મેરિયો પાછો પોતાનાં બચ્ચાં પાસે ગયો. પોલીસથાણે જઈ દાદ માગ્યો. પોલીસ અમલદારે તલ્કાળ એ દાક્તરને બરતરફ કરવાની મેરિયો પાછો પોતાને ગામ જવા ચાલ્યો. સત્તાવાળાએ એની દાદ સાંભળી એ વાતથી એનો ઉરદાહ ઓછો થયો. પણ મોડી રાતે જ્યાં એ છેણ્યો પોતાના મકાનના રસ્તા પર ચાલ્યો આવે છે, ત્યાં એણે શેરીમાં લોકોની ઠઠ મળી દીકી. નજીક ગયો ત્યાં તો એનાથી ફિક્કી ઉઠીને લોકો પંખીની પેઠે વીજરાઈ અદશ્ય બની ગયા.

આપટલા લોકો શો તમાશો જોવા અત્યારે ટોળે વળ્યા હતો?

કૌતુકથી મેરિયો નીરખવા લાગ્યો. પણ કૌતુક ભાંગી ગયું. આંખો ઝાંચી રહી. એણે લાડથી ચણાવેલી પેલી સરાઈ, પેલું નૃત્યાલય અને પ્રેમી જોડલાંને એકાન્તે મળવાનો બગ્ગીયો, તમામ કોઈ અકળ આગમાં સળગીને ખાક થઈ ગયાં હતાં. એકલું અટૂલું ફક્ત અનું રહેણાંકનું મકાન જ ઉભું હતું.

કટેરો છલકાઈ ગયો. બાડીની રાત એણે પોતાની શ્રીલિંગા બંદૂકને સાફ કરવામાં ચુંચારી. ખો જાટાં જ એ લડથડિયાં લેતો ઉઠ્યો. દીવાલ પર મૈયા મેડોનાની તસવીર બટકતી હતી તેની સામે જઈ હૈયા ઉપર બન્ને બાહુઓનો ચોગઠકાર રચ્યો, બોલ્યો : “કસમ વળું છું, એ મા, કે મારી આવી કરપીણ રિબામક્કી કરનારાઓને કબરમાં ન પોઢાડું ત્યાં સુધી હું નહિ જંયું.”

“લા વેન્દેતા, એ સત્તા મેડોના ! લા વેન્દેતા !” મેરિયો નાના બાળકની માફક ચોધાર અંસુડાં વહ્યવતો પોકારી ઉઠ્યો : ‘એ શયતાનોને મારી ખારી બેટીનાની હત્યા કરવી હતી. ને દેવેયોગે એ મારાં પ્રિયજનો આજે અહીં નથી, નહિતર તો તેઓ તમામ અત્યારે જતમ જ થઈ ગયાં હોત ને !’

આવી યાતનાઓની વચ્ચે વહાલી બંદૂકના સ્પર્શો એને શાતા આપી. કારતૂસોની ભરેલી દાબડી એણે શ્રીલિંગાના કલેજમાં પહેરાવી દીધી. હિસાનો ચિત્કાર કરતું ખટક દેતું એ બંદૂકનું હૈયું બંધ થયું. એને હાથમાં હિલોળીને મેરિયો ઘર બહાર નીકળ્યો.

સૌથી પહેલો સાંઈને આંટવો હતો. દેવજનાં દ્વારાની બહાર એ ધર્મગુરુ ઉભો હતો. મેરિયો એની સંનુખ ખડો થયો. ટોપી ઉતારીને મસ્તક ઝુકાવ્યું, પછી કહ્યું : “બંદો આપ ખાવિદને કુનિશ કરે છે, મૌલા ! તે દિવસનો મારો કોલ પાદ છે ને ? તો હવે સિધાવો વહેલા એ દ્વારા કે જેને વિશે આપ બહુ બહુ મોટી વાતો કરતા હતા !”

છેલ્લા બોલની સાથોસાથ જ બંદૂકનો ઘોડો દ્વારાયો. ગોળી છૂટી. ધર્મગુરુનું મસ્ત

શરીર કંગળો થઈ ગયું. ધીરે ધીરે એ હેવળના પગણિયા લોડીઓ જીજાના વાગ્યા.

શબની સામે નિગાહ પણ કર્યા વગર મેરિયો નેત્રોને ઘરે પડ્યોએ. એક શાખ, પણ બગાડચા વગર એને ઠાર કર્યો.

ત્રીજુ મુલાકાત ભ્યુનિસિપાલિટીની કચેરીની કરી. લોડોની જગ્યાનો પગણુંની પેગાલમાં જોરાવરીથી ભેળવી હેનાર એ સેકેટરી કંઈક કાગળિયા પર ઝડપા બેઠા છે ત્યાં કાળજીની દાખલ થયો. શબ્દ પણ ઉચ્ચાર્યા વિના મેરિયોએ એની સામે એક મહુમ નિગાહ માંડી. ‘ઓ બાપ રે !’ પુકારતો સેકેટરી હાથ ઉંચા કરતો રહ્યો. એક વિષુ કડકો. બીજો બલી હોમાઈ ચૂક્યો. દરવાજામાંથી નીકળે છે ત્યાં સામે પેલી કાવાવર કાળા ભૂરગાવાળી ગેબી પરદેશજાને હાથમાં પિસ્તોલ લઈ ઘસી આવતી દીકી. મેરિયોને સારુ બાજો માર્ગ જ ન રહ્યો. ઓરતને પણ ઉડાડવી પડી. આખી કાવતરા-ટોળીમાં હવે નશ જણા બાકી રહ્યા : એક દક્ષતર, અને બે પેલા આગ લગાવનારા ગુપ્ત પરદેશીઓ. મેરિયોને ખાતરી થઈ ચૂકી હતી કે આ સત્તામણીની ગુપ્ત બાળ્યમાં એ ત્રણ શામિલ હતા.

આ દારુણ વૈર-વસૂલાતના સમાચારથી કંપી ઊઠીને તમામ ગામલોકો બારીબારણાં ભીડી ઘરની અંદર લયાઈ ગયા છે. ઉજ્જવલ બજાર સોંસરવો એકડી મેરિયો. સીધો ચાલ્યો જાય છે. આંદું-અવળું કે ઊચેનીએ એ જોતો નથી. એની ખોપરીમાં બસ એક જ વાત ગુજે છે – લીધેલા શાપથનું પરિપૂર્ણ પાલન. ગામ બહાર નીકળીને પહાડી કેડી જે ઠેકાણે ઝડિમાં ચાલી જાય છે, તે ઠેકાણે આવતાં જ એણે બે આકારોને ભૂખરા ઝુંગરા તરફ દોડયા જતા દીકી.

શિકારની સહેલગાહમાં પોતાનું નિત્યનું સંગાથી જે દૂરબીન હતું, તે અંખો પર માંડીને મેરિયોએ એ બે નાસી જતા ઓળા ઉપર નજર માંડી. બીજે ક્યાંય નહિ પણ બૂટ - જોડા પર દસ્તિ ઠેરવી. પારખી લીધા. પોતાનું નંદનવન સમું ઘર સણગી ગયું એની આસપાસ એ જ જોડાના સગડ એંણે પારખ્યા હતા.

ઇતાંયે પૂરેપૂરી ખાતરી થયા વગર મેરિયો પિયાનેતી માનવી જેવા માનવીને કેમ મારે ?

એણે શ્રીલિંગાની તાક લીધી. પણ ક્યાં ? એ મનુષ્યો પર નહિ, તેઓ જ્યાં દોડતા હતા તે ટેકરા ઉપર. હ મ મ મ ગોળી છૂટી - ધૂળના ધંશમાંથી ડમરી ચડી. બને આસામીએ ચમક્યા. મેરિયોએ ત્રાડ દીધી : “અડે રહો ! નહિ તો ઝૂકી દઉં છું.”

બને જણા થંબી ગયા. પાછળ ફરીને ઊભા. શરણાગતિની અંધાળી તરીકે માથા પર હાથ ઊંચક્યા. નજીક જઈને મેરિયો તાડુક્યો : “તમે જ મારા કુવારાનો નશ કરીને મારી ઈમારતને આગ લગાવી, ખરું ?”

“ના મહેરબાન ! અમે ? અમે નહિ. કસમ ખાઈએ..”

“વારુ ! તો કોણ છો તમે ? આંહીં શું કરો છો ? કેમ નાસી રહ્યા છો ?”

બેમાંથી એક જીણાએ ઉત્તર ન દીધો.

“બહુ સારુ. ચાલો મારી સાથે મારે હેર, મારે તમારી ઝડતી લેવી છે.”

એણે બંદૂક નીચે નમાવી અને જાણે પાછો ફરતો હોય તેવો દેખાવ કર્યો. પલકમાં જ એ બનેએ મેરિયો પર છલાંગ મારી. પણ મેરિયો તો ખબરદાર હતો. એને તો સાચનું પારખું જ કરવું હતું. એક જ મુક્કો - અને એક આદમી બીજાના ઉપર પટકાયો. બીજી કર્શી જ પંચાતમાં ઊતર્યા વગર મેરિયોએ ખારી શ્રીલિંગાની બને નળીએ નોંધી. ઘોડો

પડતો જ બને હર ઘણા. તેઓના જજવાંમાંથી તેઓના હાં કુલ્યોના પુરણ કુગણ હાં
હાં.

છેલ્લી મુખાકાત એલે દાક્ષતરના ઘરની કરી. દાક્ષતરને દીકી નેરો જ કુરી દીકો.
પછી મેરિયો પણડોમાં ઉત્તરી ગયો. એ મુંગા તીરીશુંગોને મેરિયો જાંસે કે પૂરી રંગો હાં
કે 'હવે આત્મધર્મયા કરીને જ આ બધાની સમાચિન લાયું? કે શું આજરની પરી ન આવે
ત્યા સુધી ટક્કર લાઉ?'.

"ના, ના, નામહંની રીતે આપણાત તો નથી કરવો. હવે તો રમત રમી કાઢવી છે."
"પણ એક વાર ઘારી બેટીનાને અને બચ્ચાને ચૂમી લેવાની આકાંક્ષા જાગી ઉત્ત.
શી રીતે મળવું? ક્યાં મળવું?"

"કાં ભાઈ!" એક ભરવાડ બેરુંંધ મળ્યો તેને પોતે બેપરવાઈથી જણાયું : "આજ
તો આપણા રામે દુનિયા પરથી બેતણ પાપને સાફ કરી નાખ્યાં, હો વાર!"

"એમ!" ભરવાડ અંધો પર છાજલી કરી પૂર્ણાયું : "અરો જવાંમરદ તું દોષે!"
"એક કામ પડયું છે તાંનું, ભાઈ! આ એક કાગળ તું બ્યાન્કા ગામે જઈને હસ્પિતાલમાં
મારી વહુને હાથોખાથ દઈ આવીશ?"

"અરે બે વાર, મેરિયોનું કામ કોણ ન કરે?"

કાગળમાં બેટીનાને લખ્યું હતું કે વળતી રાતે કુંગરામાં અમુક ભરવાડને ઘેર આવી
મણી જતું. કાગળ રવાના કરીને મેરિયોએ એ આથમતા સૂરજનાં રાતાં અજવાળાંમાં
જબકોળપતી પોતાની ઘારી કુંગર-ગાળીમાં છેલ્લી વારની નજર ઠેરવી. એની અંધો જાંસે
કે એ વહાલા વતનને જાડવે જાડવે, પાંદડે પાંદડે, તરણે તરણે, ને જુંપડે જુંપડે ચૂમીઓ
લેતી બોલતી હતી કે 'ઓ જન્મભોમ! તારે છાંયે મારે શાંતિ મેળવવી હતી. મને મારાં
બાળબચ્ચાં વહાલાં હતાં. પણ હવે તો સલામ છે છેલ્લા.'

છેલ્લા સલામ કરીને મેરિયો સીમોન પિયાનેતી - હાય, હવે તો બહારવટિયો પિયાનેતી
- ચાલી નીકળ્યો. પહાડ પછી પહાડના ભયંકર ચડાવ આદરી દીધા, એને પહોંચયું હતું
લા વેછિયા નામની ટૂકે. સરકારની ઝોઝો સામે થોડોક ટકાવ થઈ શકે તેવી વંકી એ જગ્યા
હતી. પોતે જાણતો હતો કે સરકારી ચિસ્તો હમજું જ એનાં પગલાં દબાવતી આવી પહોંચશે.

[4]

"બહેન, તું ગભરા નહિ. અમે તને જે જે બન્યું છે તે બધા જ સમાચાર લાવી આપશું."

ઠેંગલનુંની છૂપી પોલીસનો અફસર ઓશટન વુલ્ફ લખે છે કે "આ હિલાસો અમે
બહારવટિયાની ઓરત બેટીનાને બ્યાન્કો ગામની હસ્પિતાલની બીમાર-પથારી પર આપી
રહ્યા હતા. ધંધીના કેરની અનેક મીઠું-મરચું ભલ્લાવેલી વાતો સાંભળીને એ સુકુમાર
ઓરતનું શરીર ભાંગી ગયું હતું. એને અમેરિકામાંથી જ ઓળખતો હતો ખરો ને. એટલે
મારા પ્રવાસેથી પાછા વળતાં છાપાંમાં મેરિયોના વિફરાટની વાત વાંચીને હું આ નિરાધાર
અમેરિકાને સહાય કરવા ગયો હતો. એક વખતની સુંદર, સુકુમાર, હસ્તીરમતી
પૂતળી-શી તરુણીનું કેવું કલેજું ચીરનારું રૂપાન્તર મેં જોયું! બાપના મોતની ઘડીથી, પોતાના
વિવાહની પળથી એના ઉપર કેટલા દુઃખના ઓળા ઉત્તરી રહ્યા હતા! સંના. માં પગ મૂક્તાં
જ એની દુર્દશા શરૂ થઈ હતી."

“હું તો આંદો પડી પડી માતા મેળેનાને બંદગી કર્યું છું કે મારો ધરી ભગી નથી.
પણ — “બિધાને પડી પડી એ બોલી ઉઠી, ‘પણ એને જો તમે મળો તો મારો આગવો
સંદેશો આપજો, કે આ જે આંદે એને — એ મારા રાવજને — મારે પકડાયેલો, જાંખું
પકડાયેલો અને ગામની બજારમાં બૂરે હાલે એક ગુનેગારની માફક ડસરડાતો જોવો પડે
તે કરતાં તે — ઓહ ! ઓ મા ! કહેતાં મારી જીબ કપાય છે — પણ તે કરતાં તો એને...”

“હું સમજ્યો, બરાબર સમજ્યો, બેટીના !” મારો મિત્ર બોલી ઉઠ્યો, “અસલી રોમન
બચ્યો. છેલ્લી ઘડીએ શરૂને હાથ સૌંપાવા કરતાં પોતાની સમશોર પર સૂઈ જતો, એ જ
તાં કહેવું છે ને ?”

બેટીનાએ માથું હલાવ્યું, એ બોલી : “આજ સુધી એક વીરની રીતે એ જીવ્યો છે;
અને એ મરે પણ વીરની રીતે, એવી મારી મનોવાંછના છે. પણ કહેજો એને, કે ભલો
થઈને સિપાહીઓને ન મારે, એ બાપડા તો પોતાની ફરજ બજાવી રહ્યા છે.”

મર્દની ઓરતના મુખનો આવો પાક સંદેશો લઈને અમે ચાલી નીકળ્યા. ગામમાં
અનેકના છાકા છૂટી ગયા હતા. અનેક પાપાત્માઓ અંતરમાં સમજતા હતા કે બહારવટિયાએ
કોને કોને હાર કરવા તેની એક ટીપ કરી છે. અનેક પોતાના અપરાધી અંતઃકરણમાં પામી
ગયા હતા કે વહેલો મોડો પોતાનો વારો આવવાનો છે. કેડા ઉજ્જડ થયા હતા, લશકરી
થાણાં ઠેરઠેર બેસી ગયાં હતાં. બહારવટિયાની શોધ ગાળેગાને અને ટૂંકોટૂંકો ચાલુ થઈ હતી.

[5]

પોલીસ અફસર આગળ કહે છે :

બ્યાન્ડો ગામથી અમે પહાડ તરફ ચડવા લાગ્યા. રસ્તે મેરિયોનું ગામનું આવ્યું, ત્યાં
એક બાંદિયા દાઢીવાળા ભરવાડને વીટળાઈને પોલીસની ટુકડી ઉભી હતી. ભરવાડ તેની
અણાઘડ બોલીમાં વારેવારે બબડતો હતો કે, ‘હા, હું કહું છું ભાઈસા’બ, કે મેં મેરિયોને
જોયો છે. કાલ સાંજે ઝુંઝું વેળાએ મારે કૂબે એ આવેલો. મારી પાસે દૂધ અને રોટલો
માગેલો. મારે આપવાં પડવાં, શું કરું, બાપા? એના હાથમાં કણા કોપની બંદૂક હતી —
એ કંઈ મારી કાકી થોડી થતી તી? હા, ખાઈ કરીને એણો મને કલ્યું — અરે કલ્યું શું, હાકેમની
રીતે હુકમ જ કર્યો — કે મારી બાયડીને આ સંદેશો પોગાડ, એને જઈને કહે કે હું મેરિયો
આ સંસારમાં સૌથી વધુ દુઃખિયારો થઈ ગયો. કારણ કે, અરે અસ્ત્રી ! મેં તુંને દુઃખી કરી,
પણ હું લાચાર. મને સૌઅે મળીને ગાંડો કરી મૂક્યો. પણ તું હવે મને માફ કરજે. મારા
અપરાધ સામું જોઈશ મા. આવું આવું કહી આવવાનું મને મેરિયોએ કીધુંતું.’

“ને તારે પાછો જવાબ પણ લાવવાનો હતો ને ?” પોલીસ અમલદારે પૂછ્યું : “તારા
કૂભામાં જ એ રાત રહેલો, ખરું કે ?”

“ના બાપા. મને તો સંદેશો ભળાવીને એ હાલ્યો ગયો. સાચી વાત કે કાલે રાતે
મને જવાબ લઈને આવવાની બોલી છે.”

“ક્યાં આવવાની ?”

“મારે કૂબે, રાતે દસને ડંકે. અને મારે એની હકીકિતવાળાં છાપાં પણ આણવાનાં
છે.”

“આ ભરવાડને અહીંથી જવા દેવાનો નથી.” એવો હુકમ આપીને વળતે દિવસે

બહારવટિયાને ફાંસલામાં લેવા સારુ પોલીસ-અમલદાર ચાલ્યો ગયો. રસ્તાને બને છે પહેરો બેસી ગયો.

પોલીસવાળા ગયા પછી અમે એ ભરવાડની પછવાડે ચાલ્યા. એક ધર્મશાળામાં અમે સહુ ભેણ થયા. મેં એને મારા મેજ પર બોલાવી, દારુની કટોરી પાઈ પછી પૂછ્યું : "ભાઈ, તારા ભેરુંબંધને ફસાવતાં તને શરમ ન આવી? આવી ખૂટલાઈ!"

અમારી સામે એ નીરળી રહ્યો. પછી એહો કટોરો પૂરો કર્યો.

મેં કહ્યું : "લાવ એ સંદેશો હું બેટીનાની પાસે ઠસ્પિતાલમાં લઈ જાઉ. ત્યાંથી હું છાપાં પણ લેતો આવીશ આપણા ભાઈબંધ વાસ્તે."

"હંમ! ભાઈબંધ!" ભરવાડ મારી સામે ડાઢીને બોલ્યો. ચોમેર નજર કરીને એશે કહ્યું : "તમે મને ફસાવવા માગો છો ખરું ને?"

"અમે ઠયાલિયન નથી, અમેરિકન છીએ, ભાઈ!" મેં ફોડ પાડ્યો.

"અમેરિકા!" એ જાહુઈ શબ્દે ભરવાડનો ચહેરો જલકી ઉઠ્યો. "હાં, તો તો હું તમારો ઠિતબાર કરું, લ્યો, આ બેટીનાને દેજો - એના ઘણીનો કાગળ."

એમ કહી એહો મને એક પરબીડિયું દીધું. કહ્યું : "જવાબ પણ તમે જ ભાઈબંધને પહોંચાડજો. આજ અધરાતે : જ્યુસેપીને નેસડે : આંહીંથી પાંચ કલાકનો વસમો પહ્યાડી પંથ છે - બોસ્કોવર્ટની ઝડીને ઓલ્યે છેડ, આસીનીનાના ગાળામાં. ભેણા તમારા મોટા ડગલા લેજો, નીકર ત્યાં ઊંચે ઠરીને ઠીકરું થઈ જાશો. ને કોને ખબર છે, કોકને એ ડગલાની તમારા કરતાં વધુ જરૂર પણ હશે. લ્યો રામરામ, ભાઈ! અમે પહાડના લોકો ઉતાવળી પ્રકૃતિના ખરા. પણ દગ્યો ન કરીએ હો! સાચું વેર લેનાર મર્દને અમે ફસાવીએ નહિ કદી, હો ભાઈ! લ્યો, રામરામ!"

એ ચાલ્યો ગયો. હું વહેલી પરોઢે બેટીનાની પાસે કાગળ પહોંચાડી, એના વેરાન બનેલા વદન પર પલભર આનંદનાં કિરણો રમતાં નિહાળી કુશળભબર આપી વળી નીકળ્યો.

અમે પંથે પડ્યા. પહાડ પર પહાડ, ચડાવ પર ચડાવ! પાંચ કલાકે અમારો આરો ક્યાંથી આવે? ઊંચાણે જેમજેમ ગયા તેમતેમ તો બરછી જેવો પવન ફૂકાતો આવ્યો. જાપટાં અમને ભીજવવા લાગ્યાં, અને એ પહાડની ધુમ્મસમાં પંથ શોધવો દોષ્યલો બની ગયો. પણ અંતરથી હું રાજી થતો હતો, કે આ પહાડની વંકાઈ, આ વાવાડી ને આ ધુમ્મસ આપણા ભાઈબંધની ભારી રક્ષા કરનારાં થઈ પડશે. કેમ કે પોલીસનું કામ કપણું બની જવાનું, જ્યારે મેરિયોને તો એ રાતાદિવસના સાથી સમાન હતાં.

[6]

આખરે અમે એ નેસડે પહોંચા. જૂંપડાના દ્વાર પર અમે ટકોરા માર્યા.

બરાબર એ જ પળે, મારી પછવાડે મારા બરડામાં કંઈક કઠણ અને લીસું મને ચંપાતું લાગ્યું. અને એક ધીરો પણ કરડો અવાજ મારે કાને પડ્યો કે, "હાથ ઊંચા - જલદી હાથ ઊંચા કરો, ને જો જરીક હલ્યા છો ને, તો હમણાં વીંધાયા જાણજો. હું અંધારે ભાણું છું."

કશી જ દલીલ કર્યા વગર અમે આશાંકિત બન્યા. પછી મેં શાંતિથી અંગેજમાં કહ્યું : "ભાઈ મેરિયો, આ મારી પીઠ પર તું જે દાબી રહ્યો છે તે જો તારી બે-જોયળીની નણી

જ હોય, તો ભલો થઈને જેસવી લે. ક્યાંક વણૂરી જરો. ન્યૂપોર્કમાં તારા વિવાહમાં હું છાજું હતો એ યાદ કરો."

મારા બોલના જવાબમાં એના મોંમાંથી એક હાહકાર નીકળી પડ્યો. એ નિસાસામાં જાણો કે સિસોટી વાગતી હતી. પછી વેદના અને આશા વડે ધૂજતા ઘોર અવાજે એને મને પૂછ્યું : "માથે ખુદાને રાખીને બોલો, કોણ છો તમે?"

મેં ઓળખાજી આપી : "જ્યારે તારો સસરો ફેરારી માર્યો ગયો ત્યારે હું ઠન્સેક્ટર શરીની સાથે હતો ને, ભાઈ!" એમ કહી મેં મારું નામઠામ દીધું, એની પાસે આવવાનું કારણ જણાવ્યું.

તત્કાળ મેં એ બંદૂક નીચે પડ્યાને ઘબકારો સાંભળ્યો અને મારું શરીર બે પડછંદ ભુજાઓની પ્રીતિભરી બાથમાં ભીસાઈ ગયું. કેટલીય વાર સુધી મેરિયોનું માથું મારા હૈયા ઉપર ફેલું રહ્યું. એના રુદનનાં ધૂસકાં એના આખા કલેવરને હલમલાવી રહ્યાં હતાં. એ ધૂસકાં નહોતાં, પણ બહાદુર આદમીના બુક્કો બની ગયેલા આત્માનાં સૂકાં આંસુડાં હતાં.

"ઓ, ભાઈ! ઓ દોસ્ત!" મેરિયોના હૈયાને ચીરીને આર્તનાદ નીકળ્યો. એ આર્તસ્વરે મારી આંખોને ભીની કરી : "આટલાં દારુણ દુઃખનાં વરસો પછી તમારી સાથેનો આ મેળાપ મારા હૈયામાં શું શું મચાવી મૂકે છે તે તમે કહી નહિ સમજો. ઓ મારી અંધારી રેળાના સાચા દોસ્ત! શું કહું? આવો અંદર. સગડી કરીને તાપીએ."

કોઈ પક્ષીના કંઠસ્વર જેવી સીટી એણે મારી જાડની ઘટામાંથી એક કાળો આકાર સામે આવ્યો. એને બાજુમાં લઈ જઈને બહારવટિયાએ કંઈક સૂચના આપી, પછી એ અમારી સાથે આવી બેઠો. ઘડીકમાં તો કોલસાની તાપકી તપી ઊઠી. એ તાપના અજવાળામાં મેરિયોના દીદાર દીઠા. એનો બંકો, સુડોલ, ખડતલ ચહેરો ફિક્કો ને કદરૂપ બની ગયેલો : એના ગાલ પર કાળું દાહું છિવાઈ ગયેલું : અને ઘટાદાર ભવાંની નીચેની મારી સામે આતુર મીટ માંડતી એ બે આંખોમાં વલોવાઈ રહેલી વેદનાને તો હું કહી નહિ ભૂલું. એનાં કપડાં લીરેલીરા થઈ ગયેલાં હતાં, ને પગના જોડાના તો ચુંથા જ નીકળી ગયેલા. એ બોલ્યો : "આજ ત્રણ દિવસ અને ત્રણ રાતથી મારી પાંપણો ભેગી નથી થઈ, ભાઈ! મારે તો, બસ, પહાડ પછી પહાડ ખૂંદવાનું જ હતું."

એક ખરબચડા પાટિયા પર એ ઢળી પડ્યો. એણે ખાદ્યું ને બીડી પીધી તેટલી વાર મેં એને બધું વૃત્તાંત કહ્યું.

"હું ગાંડો થઈ ગયો તે પછી આજ આ પહેલી બીડી છે, હો ભાઈ!" બાપડો ધુમાડા કાઢતાં કાઢતાં રાકસી હાસ્ય કરતો બોલ્યો : "હું મારી બજર લેવી જ ભૂલી ગયો છું."

મેં એને બેટીનાનો સંદેશો કહ્યો, ને એની હકીકતવાળાં છાપાં આપ્યાં. અંગારાને અજવાળે એણે છાપાં પર નજર ફેરવી. પોતાને વિશે મોટાં મથાળાં વાંચીને એ બોલ્યો : "એ...મ! હું જલ્લાદ છું એમ કે? ફિકર નહિ હું જલ્લાદ - સાત વાર જલ્લાદ! પણ મારા જેવા બે-પાંચ જ જલ્લાદો જો હોત ને, તો બચ્ચા 'કાળા પંજા'ને એક વરસની અંદર જગત પરથી સાફ કરી નાખત. હું જલ્લાદ - એમ?"

મેં એને એની ભવિષ્યની પેરવીના પ્રશ્નો પૂછ્યા. એણે એક પણ ઉત્તર ન વાળ્યો. ફક્ત એક ઓવરકોટ અને તમાકુ સિવાય બીજું કશું જ એણે ન સ્વીકાર્યું. એ બોલ્યો : "તમે સમજુ શકો છો કે તમારી પાસેથી થોડાં નાણાં મેળવવા હું કેટલો આતુર છું. પણ

એમ કરું તો તમે મારો ભેળા ઠરો. તમારી ફરજ પોલીસને ખબર દેવાની યક્કી પડી. જો તમે ન ખબર આપો, તો મારો ગુનો એ જ તમારો ગુનો બની જાય. મારે એવું નથી. કરું. ના, ના, બસ તમારે તો એટલું જ સમજવું - કે આપણે મણ્યા છીએ. તમે મને શોધતા હતા, અને મારી બંદૂકને જોરે તમારે મને કોઈ તથા બજર આપવાં પડ્યાં. તમને મારી યોજનાની કશી જ જાણ નથી. એટલે તમે નિર્દોષ છો. બાકી મારી પાસે તો પૂરતો દારગોળો છે. આજે જ મેં એક સાખરનો શિકાર કરીને આ ગિયુસેઝી ગોવાળને આપી દીધો. એ રીતે મને આજની રાત આશારો દેનારને હું દામ ચુકાવું છું. કાલે એ ફોજને કહેશે કે આજ રાતે હું અહીં હતો. પણ એ કહેતો હશે એ ટાંકો તો હું અહીંથી ક્યાંયે દૂર નીકળી ગયો હોઈશા.."

એ જ ટાંકો બહારથી એક ધીરી સીટી સંભળાઈ. બહારવટિયો જબકીને ખડો થયો. જોરથી એકો અમારા હાથ દાખ્યા. કહ્યું, "તમે આ ગિયુસેઝી ગોવાળની સાથે અહીં જ રહેજો. એ તમારા વતીની ખાતરી આપશો. મારા તકદીરમાં તો હવે આરામ નથી રહ્યો. સલામ !"

ફરી કદી મેં મેરિયોને દીકો નથી. બીજે દિવસે સવારે અમે ગમડામાં પહોંચી ગયા. ત્યાં વાતો સંભળી કે પરોઢિયામાં બહારવટિયાને અને ફોજને ધિંગાળું થઈ ગયું. તેમાં બહારવટિયાએ બે સિપાઈઓના ટોપીમાં બાકોરાં પાડ્યાં હતાં. કોઈના જાનને એકો જફા નહોતી કરી. તે દિવસે તો ફોજે પણ વધુ પીછો લેવાનું બંધ રાખ્યું હતું.

વાહ ! સિપાઈઓની ટોપીઓ વીધી - જાન ન લીધા. બહારવટિયાએ પોતાની ઓરતના સંદેશાને કેવો પવિત્ર કરી માન્યો ! એનું નામ નેકી.

અમને લાગ્યું કે ઠટલીમાં અમારા વધારે રહેવાથી બિચારી બેટીના પર આસ્ત આવશે. અમે ગમગીન હૈયે ચાલ્યા ગયા. ઠટલી છોડી દીધું.

બહારવટિયો પકડાયાના ખબર વિનાના ઘણા દિવસો ગુજર્યા. અમને આશા હતી કે એ બચી છૂટશે. ઠટલીનો સીમાડો વળોટી જશે.

પછી તો પુરોપના આકાશમાં તુમુલ તોણના ગડેડાર ગાજુ ઉઠયા. મહાયુદ્ધ જાહેર થયું. બહારવટિયો જલાવો એ અશક્ય વાત બની.

માનવીનું ભાગ્યનિર્મિશી કેવું અકળ છે ! જગન્ના જાદવાસ્થણી બરાબર જાડો એના બચાવની ઘડીએ જ આવી પહોંચી. એનો એના પ્રિયજનોની સાથે મેળાપ થયો કે નહિ તેની મને ખબર નથી. મેં તો રૂક્ત અફ્વાઓ જ સંભળી હતી, કેમ કે હું પણ બીજાં લાખોની માફક, શોકિતરંગી પુદ્દેવતાની સન્મુખ કૂચકદમ કરતો, એ મહાકાળને સલામ ભરતો ચાલ્યો જતો હતો - સમરના મેદાન પર.

રોમાનેતી

ઈ. સ. 1926ના એપ્રિલ મહિનાના એક પ્રભાતે દેશદેશનાં છાપાંઓએ પોતાના વાંચનારાઓને ખબર દીધા કે બહારવટિયાનો રાજાવિરાજ રોમાનેતી, જેણે કોર્સિકા બેટની સરકારને પૂરં અંદર વણો સુધી હાથતાળી દઈદઈ પહડોનું એકલહથ્યુ રાજ કર્યું, જેણે કઈ કઈ જપાજીપીઓમાં સરકારી પોલીસને શિકસ્તો દીધી, તે બહારવટિયાને આખરે પોલીસોએ બેટબેટાં કરી હાથોહાથના વિંગાણામાં ઠાર કર્યો છે.

આ ખબર છાપાયા પછી તરતના જ અરસામાં કોર્સિકા બેટનાં તેમ જ ફાન્સ ટેશનાં છાપાં કાગારોળ કરી ઊઠાં કે ખોટી વાત : બહારવટિયાને પોલીસે નથી માર્યો. એનું મોત તો દગ્ગાબાજીથી નીપજેલું છે. બહાદુરી નહિ પણ ખુટામણ ખેલાયેલી છે. બહારવટિયાના મંડળ માંદ્યલા જ એક ભરોસાદાર આદમીએ ઓચિંતો એને પીઠ પાછળથી ગોળીએ હીધો છે; પોલીસે તો પછી એ મરેલા મર્દનાં હથિયાર-પડિયાર ઉતારી વઈ, એ શબને માથે ભડકા કરી, વીરતાનું એક નાટક ભજવ્યું છે, અને કોર્સિકા બેટનાં વીરપ્રેમી વતનીઓની અંખોમાં એવું ઠસાવવાની કોશિશ કરી છે કે તમારા વીરને અમે હાથોહાથના વિંગાણામાં મર્દાઈની રીતે મારી પાડચો છે.

બેટની બજારે વાતો થાય છે : ‘આ મોતની અંદર નક્કી કાંઈક બેદ રહ્યો છે ; દાક્તરે મદહું ચીર્યું, પણ એ દાક્તરી તપાસનું પરિણામ કેમ બહાર ન પડજ્યું ? ‘ગોટાળો હશે, ગોટાળો. બહારવટિયો રોમાનેતી સામી છાતીને વિંગાણે એમ એકલો કાંઈ મરે ? પાંચેક વડિયાને લીધા પછી જ પડે.’

સુધરેલી દુનિયાનાં માનવી આવું આવું સાંભળીને ખડકદ હસે છે. ભલા માણસો ! રોમાનેતીને કોણે માર્યો અને કેવી રીતે માર્યો એની શી તથ્યા છે તમારે ? હતો તો બહારવટિયો ને ? રાજનો, કાયદાનો, સમાજની સુલેહશાંતિનો શત્રુ તો હતો જ ને ? બે-પાંચ ખૂનો પણ એણે કર્યા હતાં ને ? એના માથા સારુ ઠિનામ નીકળ્યું હતું ને ? બસ ત્યારે પછી ! હરકોઈ ઠિલાજે પણ એ ફેસલ થઈ ગયો. રાજા-પ્રાજા સર્વે ઠરીને ઠામ બેઠા.

કોર્સિકા બેટનો વતનદાર પોતાનું માયું ધૂણાવીને ઉત્તર આપે છે કે ના, ના, ના ! તમે અમારો મુલકની રીતરસમ જાણતા નથી, અમે જીવીએ છીએ હજુ જુનવાણી જમાનામાં. હન્સાફની અટપટી જાળમાં અમારો પત્તો ન લાગે. અમે તો અમારો હિસાબ ઘરમેળે પતાવી લઈએ. દગ્ગલબાજી, વિશ્વાસઘાત, ખુટામણ - એની વસૂલાત અમે લોહી રેડીને જ કરીએ અને તેથી જ ખાનદાનીની રીતે પતાવટ કરનારો આદમી અમારે મન વીર છે. ‘વેન્ટેટા’ (વેન્ટી વસૂલાત) એ અમારો નેકપાક કાયદો છે. રોમાનેતી અમારો આત્મારામ હતો, નેડીનો

પણ બેસે તસુવી વાતરેલ નહોલો. નહોલો એની હત્યા થઈ રહે કાંગોલાને કિંમતો ન હુંદો
હોતું તો અમારો ક્રેઝમાં હશો ઓરણો ન થાત.

“લા વેન્કેટા!” - કેવો કારમો એ રજુ, છે! રિસોર્ટના પારે પારની જાહેરાન
થઈ રહે છે તેના ફેલો, લા વેન્કેટા એ શાલોચ્ચાર સાથે, હિન્દુલા “લા જાહેરાન” નાનાની
આધોસાથ કોર્સિશાના મહિની ઘૂરી હગલબાજના ક્રેઝમાં આવી જાત છે.

સંસ્કારી આલમથી અદ્ભુતો પડેલો આ ટાપુ પાયાયુગના આખરી (કિંમત નામ) રૂપાન
છે. અને પોતાનાં બરચાને એતરે આવા રીદ સંસ્કાર રોપનાર તો ખુદ ન્યાની કુદરત જ
છે. એનાં પછાડો અને ખીલો પ્રકૃતિની શક્કિતાઓના કોઈ દારૂલા રસાંગુમાનની જાગ્રત્ત કૂરી
રહેલાં છે. પરતીનાં પેટાળ ફાડીને કોઈ જીવાળામુખીએ પાતાળી ખાઈએ કરી મૂરી છે. એને
છેદપેલા સૈનિકો જેવા કુંગરાઓને જાણો કે કોઈ ભૂકુપોના દાનવોએ એકાદ વિગ્રહ કરુંનું
કુકેદુકડા કરીને સર્જાવેલ છે. સેદાર અને પાઈનનાં ઉંચાં જાડવાં પણ એ પછાડોનાં ડેવાં
વિદ્યારી-વિદ્યારીને જ બહાર નીકળેલાં છે. માનવીનાં હળ-સાંતી જેવાં લોખાંડી ધ્વિષાંગને ચાંદ
તેટલાં મધે છતાં ન ચિરાતી કઠોર ધરતી પણ જાણો કે અન્નપૂર્ણા નથી પણ એથી ઉંબડી
કોઈ નિષ્ઠુર સાવડી માતા છે.

આમ એ ટાપુના ઘડતરમાં જ તોઝનનાં, સંહારલીલાનાં, કુદરત આથેના નિર્નિર ચાલુ
વિગ્રહનાં જ તત્ત્વો પડ્યાં છે. એ તત્ત્વોની સોબતે ટાપુનાં બરચાને માના પેટમાંથી જ પોતાને
તાલીમ પિવાડી છે. ટાપુના ચહેરા ઉપર જ્યાં જુઓ ત્યાં ઉગ્રતા ગરુદી, વેદના અને રમત્રીની
જ અંકિત થઈ છે. એ જ ચાર ગુણો લખાયા છે પ્રત્યેક કોર્સિકાવસીના વદન ઉપર કેનાં
નામ પણ જુઓ તો સ્પાદા (સમશેર), અથવા તો સાએતા (વીજળી) - એ નામો જ
બહારવટાંની આગાહી કરે છે. નાનાં બરચાં લખતાં-વાંચતાં-ભણતાં નથી, પણ જોડનો
શિકાર શીખે છે; કુદરતનાં તૂષનો સામે - વાવાડોડાં, ભૂંકુપો, જળપ્રલય અને સળગતા
દુકણો સામે - ટક્કર જીલતાં શીખે છે.

[2]

આમ છતાંથે રોમાનેતી તો હંમેશાંનો સુલેહપ્રેમી અને કાયદાપાલક પ્રજાજન હતો.
અને ખૂનખરાબા અને જાડીજંગલને માર્ગ જબરદસ્તીથી હડસેલનાર તો હતા દિશાસંધાત
અને ગેરઠનાાફ. જગતના કૂડા રાહથી એ ગુંગળાઈ ગયો ત્યારે જ રણી, બીજા અનેકની
પેઠ એ પણ માણિયામાં - અટવીમાં દુપાયો, ને ત્યાં રહ્યે રહ્યે પણ પોતાને ઘડીભર જંપવા
ન ઢેનારી, દિવસગાન કોઈ શિકારને શોધી રહેલી શિકારી સરખી એ રાજસત્તાને હંશવતો
બેઠો. પણ બીજા આવા ભાગેદુઓ કરતાં પોતે સાતગણી ટક્કર જીલી શક્યો. તેમ કે
રોમાનેતીની આમોશી અદ્ભુત હતી; એનો બંદૂકપિસ્તોલ પરનો કાબુ અફર હતો; એટલે
જ એણે રાજની ફિઝોને દોડ દાયકા સુધી માત રાખી. એટલે જ એ બહારવહિયાનો રાજ
બોલાયો. રાજ-પોશાકધારીઓનો એ જમદૂત હતો, બેટવાસીઓનો એ હિલોજાન હતો.

ધંધે તો હતો એ દિંગો માલધારી, કોર કાપતો પણ ખરો. પોતાના જામના
માંડવીચોકમાં એ મેળાને દિવસે કે મોરી ગુજરી ભરાવાને દિવસે કોર કાપીને માંસ દેશતો.
એવા એક પ્રસંગે એવું બન્યુ કે જે ધરાડી ફાડી નીકળી ને બીજા એક બેલને કાપવાની
જરૂર પડી. એણે તાબડતોબ પોતાનો એક ધંધા-ભાઈની પાસે માસસ ઢોડાવ્યો, પૂરી
રોમાનેતી

પરવાનગીથી અને પૂરેપૂરા મૂલે એજો એ ભાઈબંધના જેતરમાંથી પણ વીધુ, ને ને જ ગને
પાછાની અંદર ભાઈબંધને નાણાં પણ બરી દીધા. રોડ પૈસાનો સોઢો, બાઈબંધારની વાળ
નહોતો, એટલે નાણાની પહોંચપાવતી લેવાહેવાનો સવાલ જ નહોતો.
ઘોડા દિવસ થયા, ને એક વાર મોટે ભળકડે એને એની ઓરતે હેડોયો : ..

જાગો."

"કાં?"

"અંગરો કુલેસ ઉભા છે."

કુલેસ? રોમાનેતીને ફાળ પડી, આપણે ધેર અત્યારમાં કુલેસ? શા કારણો?
ત્યાં તો પોલીસની પાર્ટીએ ધમાચકડી બોલાવી દીધી : "ચલો સાલે! પારકાનો બેલ

ચોરવો મીઠો લાગે છે કેમ? ચાલો શહેરમાં. નીકળ જલહી ઘરની બહાર, ચોઢા!"
બોળિયો ધંધાદારી! ડરતો ડરતો સુલેહશાંતિથી પેટગુજારો કરનાર આ ગામડિયો
'કુલેસ'ના બોલવા પરથી પામી ગયો કે પેલા ભાઈબંધે સરકારમાં જઈને ફરિયાદ નોંધાવી
છે કે રોમાનેતી અમારો બેલ ચોરી ગયો છે - ને નાણાં આપતો નથી.

'કુલેસ!' - એ શબ્દ જ્યારે ગામડિયાને કાને પડે છે ત્યારે એ ઘોળે દિવસે તારા
ભાગે છે, એની નસોમાં લોહી થીજુ જાય છે. કુલેસ : સપાઈ : ફોજદાર : ગામડિયાને
મન આથી વધારે અમંગળ બીજા શબ્દો નથી.

બેબાકળો બનીને રોમાનેતી પથારીએથી પરભારો નાઠો, પાછલી બારીએથી રહુચક
થઈ ગયો, ને જાડીમાં છુપાયો. ત્યાં બેઠે બેઠે એજો પેલા ફરિયાદ નોંધાવનાર ભાઈબંધની
સાથે વાયાધાટના સંદેશા ચલાવ્યા : એ ભાઈ! તારી ગૌ! હું હાથ જોડું છું : હું તને ફરી
વાર આખી કિંમત ચુકાવું. ને વળી એક સો ફાંક ઉપરિયામણ આવું. કોઈ વાતે તું ફરિયાદ
પાછી જેંચી લે, મારો છૂટકો કર. મારે કોરટને બારણો ચડવાનો મોખ નથી.

રોમાનેતીની નજર સામે 'કુલેસ'ની ઘક્કામુક્કી, વડીલોના લુંટણવેડા, કાચી જેલમાં
અચોક્કસ મુદ્દત સુધી સબડાટ અને પછી છેવટે પાડી તુરંગના છ-બાર મહિના તરવરતા
હતા. પહોંચપાવતી વિના પોતાનું સાચ કોરટમાં ટકશે નહિ એવી ફાળ એને પડી ગઈ હતી.

ફરિયાદીએ આ કહેણ કબૂલ રાખ્યું. કહેવરાયું કે આવતી કાલે આપણે અમુક ટેકણો
મળીએ. નાણાની પત્તાવટ કરીએ ને પછી અદાવતને દારુની અક્કેક કટોરીમાં દુબાવી દઈએ.
પણ ગામડિયો રોમાનેતી શકમંદ સ્વભાવનો હતો. એને ભરોસો બેઠો નહિ. એજો
એક ભાઈબંધને નાણાં લઈને મોકલ્યો. પોતે શું થાય છે તે જોતો એક શિલાની ઓથે બેઠો
ઝીંગી આંખોએ નિહાળી રહ્યો; દગ્દો હતો! બાર પોલીસો એ મળવાની જગ્યાએ
છુપાઈને બેઠા હતા.

"બેટમજીને કહી આવો જઈને," એજો એ દગ્દલબાજને બીજો સંદેશો મોકલ્યો :
"- કે ખબરદાર રે'જે : આ વખતે તો તુંને બંદૂકની ગોળીનો ભડકો સાંભળવા જેટલોયે
સમો નહિ રહે."

- ને રોમાનેતી પોતાનું બોલ્યું બરાબર પણ્યો. બીજે જ દિવસે સવારે ભાઈબંધ ગામની
બજારે નીકળે છે ત્યાં પછવાડે એક જાડની ઓથેથી ગોળી છૂટી, બરાબર છાતીએ ચોંટી,
ને એના રામ ત્યાં ને ત્યાં રમી ગયા.

તે દિવસથી રોમાનેતી 'બેન્દીતો' (બહારવટિયો) જાહેર થયો, એના માથા માટે ઠનામ

નીકળ્યું. પોતાની ઓરતને ધંધાના વહીવટની ભલામણ કરી, છેલ્લી વારનું આદિગન આપી રોમાનેતી તે જ દણ્ણે પહાડોની ગોદમાં જઈ સમાપો. ત્યાં એણે પગ્ગરવટિયે કાઠિયારાઓનું અને શિકારીઓનું પહાડી સૈન્ય ઉન્નું કર્યું. એણે પોતાની નીતિથી સૌને વાકેફ કર્યા કે -

“જુબો ભાઈ, મારે કોઈને લુંટવા કરવા નથી : ન કોઈ રાહદારીને કે ન તો રાજને : ન એક પૈસા સાડુ કે ન હીરા-માણેકની કોથળી સાડુ. તેમ મારે કોઈને વગર વંડે મારવા-પીટવાયે નથી. હું તો ખાવંદ ધણીની રહેમથી ઘરનો સુખી આદમી છું. ને મારી મતલબ આંદ્ધી બેઠે બેઠે પણ ઘરનો ધંધો ચાલુ રાખવાની છે. આ બધો બંદોબસ્ત મારી આત્મરક્ષા પૂરતો જ છે. મારી હારે સાહુ નેકપાક રેંજો. ઠમાનથી કદી ડગશો નહિએ.”

એ રીતે વંકા પહાડને ખોળે બેઠાંબેઠાં રોમાનેતીને પોતાનાં માલથાલ (ઢોરઢાંખર)ના સોદા માંડચા, અને પોતાની વાડીને માંડવેથી ઉત્તરતી અંગૂરનાં વેચાણ ચાલુ રાખ્યાં.

એની પાછળ તો ફેઝો ભમવા લાગી હતી, પણ પહાડોનો પાદશાહ રોમાનેતી આત્મરક્ષાની અક્કલમાં કોઈથી ઉત્તરે તેવો નથી. સરકારી જાસૂસોની સામે બહારવટિયાનું પણ પાંડુ જાસૂસખાતું ગોઠવાઈ ગયેલું છે. એના મોટામાં મોટા જાસૂસ કુતાઓ હતા, જીનેતા અને કાળિયો નામના બે કુતા બહારવટિયાના માનીતા અંગરક્ષકો છે, બને જણા દિવસરાત એક પલ પણ અણગા થયા વગર પોતાના એ માનવમિત્રની બેઉ બાજુએ બેઠા રહે છે. એને અપાયેલી તાલીમ તાજુબ કરે તેવી હતી. બનેના મૌંમાં જાણે અવાજ જ નહોતા, મૂંગા અવધૂતની માફક બને જીકી જગાર કરતી આંખો અધમીંચી રાખીને બેઠા રહેતા. અને તેઓનો એક લગાર જેટલો જ ધૂરકાટ દુશ્મનોનાં દૂરદૂર ચાલતાં પગલાંની ખબર દેવા માટે ગનીમત થઈ પડતો.

તે પછી થોડે દૂર, એથી જરી વધારે દૂર, ઔર થોડે છેટે - એમ કેટલાક માઈલો સુધીના ગોળ ધેરાવામાં સંત્રીઓની અને કુતાઓની ચોકી દિવસરાત વીંટળાયેલી જ રહેતી. પરિણામે ‘કુલેસ’ની જિસ્ત લગોલગ આવી પહોંચે તે પહેલાં તો બહારવટિયો બાતમી પામીને પચીસ કોસ દૂર નીકળી જતો હતો. બહારવટિયાના ભોમિયા મરણિયા અને બુદ્ધિવંત હતા.

[3]

પહાડના પોલાણમાં એક રાતે બહારવટિયો બેઠોબેઠો કંઈક ગીત ગુજે છે :

પાનીસેં મછલી કિતની દૂર !

બે કિતની દૂર !

બે કિતની દૂર !

બાદલસેં બીજલી કિતની દૂર !

બે કિતની દૂર !

બે કિતની દૂર !

એ વારંવાર ધૂંટાતાં ચરણોમાંથી આખરે ફક્ત આટલો જ સૂર કોઈ ચગેલા પતંગની માફક, ઊંઘ લઈ ગયેલા ભમરડાની માફક વાળું રહ્યો કે -

કિતની દૂર !

બે કિતની દૂર !

બે કિતની દૂર !

બખોલની શિલાઓ બંજરી બજાવતી બહારવટિયાની ગુરગવળને નાવ આપે છે.
આમરે બે હોઠ વચ્ચેની સિસોડી કોઈ પણફળની પેઢ જાપ છે કે -

કિતની દૂર!
બે કિતની દૂર!
બે કિતની દૂર!
પાનીસે મછલી કિતની દૂર!
બાદલસે બીજલી કિતની દૂર!

જુવાન બહારવટિયાને ઘણે દિવસે ઘર સાંભર્યું છે. ઓરતને મળવા દિલ તડપે છે,
રંગાલો રોમાનેતી ધેરે સંદેશો પણ મોકલી ચૂક્યો કે ‘આજ સાંજનું વાળું તારું હથનું
કરવું છે’.

રાત પડી. ગામના પોતાના ઘરની પછીતથી માંડી છેક પહાડના ગુપ્તસ્થાન લગ્ની
એક પછી એક જાસૂસ સંગીની આલબેલ-અંધાડી અપાતી ગઈ; જરીકે જોખમ નથી એવાં
સંકેતચિહ્નો મળતાં બહારવટિયો બખોલેથી ઘેર જવા નીકળ્યો. અધરાતનો ગજર થયે એષો
હેમખેમ ઘરમાં પગ દીધો. ઘણા કાળના ગાળા પછી માંડમાંડ જીવતાં મિલાપ થવા પામ્યો
છે, એટલે ગળતી રાતની ગાઢી ગળબથ્યો લીધા પછી, હૈયાં એકમેકની અંદર ઠાલવી દઈને
પછી, ઓરતે કોડેકોડે રંધીલું વાનીવાનીનું વાળું માણવા માટે રંગાલો રોમાનેતી દરવાજા
સન્મુખ મોં કરીને જમવા બેઠો. બાજુમાં એક બંદૂક મૂકેલી છે, ને ગજવામાં પાંચ-છ નાની
પિસ્તોલો અકબંધ ભરેલી ઠાંસી છે.

હજુ તો જ્યાં બહારવટિયો પહેલો કોળિયો ભરે છે, ત્યાં ઘ ૨ ૨ ૨ ! બાજુમાં બેઠેલા
બન્ને કુતાએ ધીરો ધીરો ધૂરકાટ કાઢ્યો. અમસ્તા કાપી નાખો તોયે ન ઉચ્ચાર કરે તેવા
એ જીનેતા અને કાળિયાની આ સનસ કદી જ ખોટી ન હોય. પણ આ એકાએક શું થયું ?
- એમ વિચારે છે ત્યાં તો પલમાં જ એક જાસૂસે હંસ્તાં હંસ્તાં આવીને જાળ કરી કે
“કુલેસ ! કુલેસની આખી ટુકડી : ઘર ઉપર ધસતી આવે છે.”

અન્નનો કોળિયો નીચે મૂકી દઈને રોમાનેતી ખડો થયો. ઓરતને એક ચૂમી કરી,
અને જાસૂસને કહ્યું : “જીવ, આડા રહીને ફેર કરો.”

પોતે પાછલા ઓરડામાં ગયો, અને બહારવટિયાના આદેશનું યંત્રવત્ પાલન કરનાર
સાથીએ ઉઘાડા મોયલા દરવાજાની અંદર પ્રવેશતી રોશની સામે ધર્યો. એને જોતાંની વારે
જ પોલીસની બંદૂકો છૂટી. એ ભોયે પર ઢળી પડ્યો, પણ પડ્યાં પડ્યાં એષો અર્ધચંદ્રાકારે
સબસબાટ પિસ્તોલ ચલાવી, ધર્યી આવતાં ‘કુલેસ’માંથી કેટલાકને જખમી કર્યા.
બહારવટિયાના બીજા સાથીએ પણ શિલાઓ અને જાડવાંની વચ્ચે સંતાઈને ગોળીબાર
કરવા લાગ્યા. દરમિયાન રોમાનેતી પાછલી બારીએથી કૂદીને બહાર પડ્યો. એના પગનું
કાંકું ખડી ગયું.

આખો જ હત્થો મકાનના આગલા ભાગમાં મચેલો છે એમ સમજુને પોતાના સાથીએ
તથા પોલીસો વચ્ચેની ઠારમઠોર સાંભળતો બહારવટિયો પાછલી જગ્યાએ ભાંખોડિયાંભર
ચાલવા લાગ્યો ત્યાં તો કુતો ધૂરક્યો; અને એક તીણો અવાજ આવ્યો : “ખબરદાર ! રૂક
જીવ ! નહિ તો ઠાર કરું છું.”

જવાબમાં બહારવટિયાએ એ અવાજની સામે ફેર કરીને, ભાંગેલા પગની વેદનાને

ગ્રામીય વગર બડાઓલિયા ખાવા માટ્યા, અદ્દ પરણી અદ્દ પર પડતું મુકનો, જોઈનીની શુદ્ધિમાંથી ચમલતારી રીતે ભૂગરી જીડને એ ફરિયાકાંડે ખાલખાયો, ત્યાં કેદ બેનુંબેનું માછીમારની હોડી રાહ જોતી ભૂલી હતી તેમાં ગરીને હલેસાં ચલાવ્યાં, ગંગાનું જીબાં હોડી ચુપચાપ ચાલી, ત્યાં તો દીકું કે કનારેકનારે પોલીસની બીજી ટુકડી આવી ગઈ છે.

એકાએક લાલ પડી : “નિશાન લ્યો : તાંશીરો ચલાવો હોડી પર.”

“અને ઓ હોડીવાલા ! જલહી પાછી વાળ, કનારે પહોંચ.”

“એ ભાઈસાબ ! આવીએ છીએ, પાછા કનારે આવીએ છીએ ! કેર કરણો મા !”

એવાએવા એ માછીમારના ચસકાની અંદર એક બીજો અવાજ ઝૂણી ગયો - ને તે હતો. બહારવટિયાનો પાણીમાં ખાલકી પડ્યાનો અવાજ.

હોડી કંઠે આવી ત્યારે ખાલી હતી. રોમાનેતી ઢબતો ઢબતો, પાછી કાપણો પછી જડકોમાં પહોંચી ગયો હતો.

[4]

“આ દગલબાજુ કોણે કરી ? આપણી વર્ષે તે રાત્રિએ કોણ વિશ્વાસધારી આવ્યો ?”

એ એક જ સમસ્યા બહારવટિયાને તે પછીના દિવસોમાં સત્તાવી રહી હતી. નહીં વાત છે કે કોઈક પોલીસને બાતમી આપી દીધેલી કુતાઓને પણ છેક પોલીસ લગોવગ આવી પહોંચી ત્યાં સુધી કોઈક કોઈક જાણીતા આસામીએ મુંગા રાખ્યા હોવા જોઈએ કોઈક જાણબેદુ કૂટી ગયો છે.

“ઓ રોમાનેતી !” સાથીઓએ સંદેહ ઉઘાડો કર્યો : “કાસ્ટીએલીઓની તો નહિ હોય ?”

“કોણ, સીનાર્કી ગામવાળો જુવાન કાસ્ટીએલીઓની ?”

“હા, એ લાગે છે.”

“શા પરથી ?”

“મોખરેના કુતા પર એની દેખરેખ હતી તેથી.”

“પણ મને ફસાવવામાં એને મતલબ શી ?”

એ સવાલ કરવાની સાથે જ બહારવટિયાને કંઈક યાદ આવ્યું. એના મનમાં ગણતરી ગણાવા લાગી, એનાથી બોલી જવાયું : “હાં ! સાચેસાચ એ જુવાન કાસ્ટીએલીઓનીનાં કામાં તપાસ કરો, એ ક્યાં છે.”

રોમાનેતીની પરણોતર જ્યારે કુવારી હતી ત્યારે આ જુવાન એના પ્યારનો ઉમેદવાર હતો. પોતાની દિલદારને કેમ જાણે રોમાનેતી હરણ કરી ઉપાડી ગયો હોય એવી એના દિલમાં અગોચર દાડ હતી. રોમાનેતીના ગુણશીલ ઉપર મુંઘ બનીને એ સુંદરી ગઈ હતી. તે વાત આ પ્રેમઈધાર્ના અભિનમાં સણગતો આદમી સમજી નહોતો શક્યો. એસે જ પોલીસને બાતમી આપી હતી. તપાસ કરીને માણસો આવી ગયા : જાહેર કર્યું કે કાસ્ટીએલીઓની અને બહારવટિયાનો એક જાતવંત ધોડો બેઉ અલોપ થયા છે.

“એને લઈ આવો,” બહારવટિયાએ ટૂંકોટ્ય આદેશ દીધો; પછી તુરત જ ઉમેદું

“પણ જીવતો - ખબરદાર, એને જીવતો પકડી લાવજો.”



ને હિંદુ જીવ વાતની કાર્યોને નો માટે બાળ જીવ વાતની કાર્યોને
માટે જીવની પુરુષ વાતની કાર્યો વાતની વાતની

હોતે હતે હું જીવ વાતની કાર્યો જીવ વાતની પુરુષ વાતની કાર્યો વાતની
કાર્યો વાતની વાતની વાતની

હું જે હું જીવ વાતની કાર્યો જીવ વાતની કાર્યો હું જીવ વાતની કાર્યો
જીવ વાતની વાતની જીવ વાતની

જીવ તરે તી જીવ વાતની જીવ કું ને જી વાત વાતની કાર્યો હું
હું જે જીવ જીવ તો જેવે તે માડણો હશે જીવ જીવ જીવ

હું જો જીવ વાતની તે પુરુષ વાતની કાર્યો હું જીવ જીવ હું જીવ
જીવ જીવ વાતની જીવ વાતની જીવ વાતની

હું જીવ જીવ જીવ વાતની વિસ્તૃત હું.

રોમાનેતીના જીવ વાતની હશું લખિયાર નથી, એ તી પ્રથમની હું જીવ જીવ હું જીવ
બેચો રણો પણો પણ એલે બહલાવી નથી, દગ્ધલાજુને જોંસે કંઈ કંઈયાની જીવ હું જીવ
હું.

એકાએક અસ્તીઝીઓની ખડક પરથી નીચે ઉત્તરી પડ્યો, એની વિસ્તૃતમાંથી હું
ખડક ઘડક રજ - ચાર ગોળીઓ હુંટી.

રોમાનેતી પણ એની વાંસોવાંસ નીચે ખાબકી પડ્યો, એક જ પણ - એને દગ્ધલાજુને
થોડે પછાણીને નાસી હુટ્ટત, પણ એનો એક પગ હજુ પેગડામાં હતો ત્યાં જ બહારવટિયાને
નીચે જબડીને ઊપાડી લીધેલી બંદૂકમાંથી એક ભડકો થયો, વિશ્વાસધાતી જુવાનનું કંઈ
સૌસરવી ગોળી નહ્યાઈધોઈને ધોપટ નીકળી ગઈ.

સાથીઓ મારતે ઘોડે આવી પહોંચ્યા.

જુવાનની લાશ સામે ઠીરિગાર આંગળી રીધાડીને બહારવટિયાએ કહું : "આને એનું
કુંભીઓ પાસે લઈ જઈને સોંપી આવો, કહેજો કે એ વિશ્વાસધાતી તો હતો, પણ તે ઊપરનું
નામદ હતો, હજુ તો મારા હથ ખાલી હતા ને હું એની સાથે વાત કરી રહેલો હતો ત્યાં
જ એજો મારા ઊપર ગોળીઓ છોડી હતી."

આ જનાવે બહારવટિયાના બાકીના સાથીઓનાં હૈંયાં પર એનું જાદુ છાંટી દ્વિદુંડ
પણીનાં વધોમાં એક પણ ખૂટામણનો પ્રસંગ નહોતો બનવા પામ્યો, એ છાપ માઝસાઈની
છો.

[5]

"હું શરૂ કરું છું, હું એકલો બહારવટિયાને પૂરો પડીશ."

એજોસિયો જામની મુલાકાતે આવેલી એક ફરાન્સી ડોજના ડોતાને એડ હિસ એ
ગીત પોતાની મુશ્ક મરડી, એલો અમાજ પાડી કે "તમે દુકડીઓની દુકડીઓ મોડલો જો એલો
બંદબેંદ થાય નથી, મારો કારી જાવતી નથી, જુઓ હું એકલે આવે પૂરો પડુ છુ."

આ બડના દીકરાને બહારવટિયા સાથે મુલાકાતની માગણી મોડલી, પોતાને મળવા
માગનારા એનેકને રોમાનેતી આનદાનીની રીતે મુલાકાતો આપતો હતો, બેચા એ વીરલાનો

પણ સમજતો. આ કપ્તાન સાહેબને પણ લક્ષ્યરી ઠુમાનવાળા આદમી તોની મૂલાકાતની લા પાડી. કપ્તાને ખૂબ પોતે જીવાને બદલે પોતાને નામે એક દોસ્તને પડકેલાં ને પોતે પદમાં એક બેઝ્ટના વેશમાં પેસી ગયો. જે ઝૂપડામાં બહારવટિયાની મૂલાકાત જવાની હતી તની બદાર કપ્તાન છૂપાઈ રહ્યો. ભાગડાની વેળા થઈ ત્યારે એણે પોતાના દોસ્તને એણે ઝૂપડામાંની કેટલાક ભોમિયા બેણો નીકળીને જતો જોયો. રામજ લીધું કે મૂલાકાત થઈ નઈ. માણું કે અત્યારે બહારવટિયાનો સામનો કરીને કાટ ચાંપી ઢેવાનો લાગ છે. જેવા પેલા ભોમિયા ઘોઉં ચડી પોતાના ભાઈબંધની સાથે ચાલી નીકળ્યા, તેવો જ આ કપ્તાન ઝૂપડાના દરમાં પડો. એકાએક દ્વાર ખોલીને એણે રાઈફલ તાડી, અંદર બેઠેલાઓને પડકાર દીધ્યો કે “તોંબા હાથ - જલહી હાથ ઊંચા લ્યો.”

બેઠેલાઓમાંથી કોઈ હલ્યુચલ્યું નહિ.

એકાએક કપ્તાને પોતાની પછીવાતેથી ‘હા - હા - હા’ એવું હાસ્ય સાંભળ્યું એક અવાજ આવ્યો : “સાહેબ બહાદુર. જો તમે રોમાનેતીને શોધતા હો તો આ રંગો આપનો નામ સેવક. પણ હું આપને શાંતિથી ચાલ્યા જવાની સલાહ આપું છું. હું ધારું છું કે હિંદની તો તમને ય્યારી છે. માટે કહું છું કે ડાખા હો તો પધારી જાઓ.”

કપ્તાને ચક્કર ફરીને પાછું જોયું. જે માણસને પોતે ટેકાજે પાડવા આવ્યો હતો. તે તો બેધડક ને બેપરવા. ખીસામાં બેઉ હાથ નાખીને રસ્તા વચ્ચે સામી છાતીએ ઊભેલો હતો.

હજુ ભળભાંખળું હતું. બહારવટિયાનું કલેવર દેખાતું હતું. ચોખ્યું નહિ, પણ જાંયું જાંયું.

“સાહેબ બહાદુર, આપ સિધાવી જાઓ.” ફરીને અવાજ આવ્યો.

કપ્તાન સાહેબે એક પલની પણ વાટ જોયા વગર ઉપરાઉપરી ગોળીબાર કર્યા પરોડિયાના ધુમમસમાં બહારવટિયાનું બાંડિયું પાતળું કલેવર અસ્યાસ રહ્યું. એકેદિય ગોળી ન અંટાઈ.

ફરી વાર અવાજ. “હવે તો બસ, પાછા ફરી જાઓ અને જગતને જઈ કહો કે મેં અંગત જેઓનું કંઈ બગાડ્યું નથી તેઓ પણ મારા પર હલ્લો કરે છે ત્યારેય મને ઈન્સાનનો જાન લેવો ગમતો નથી. હું રોમાનેતી લોહીનો ઘાસો નથી. સિધાવો સાહેબ બહાદુર. હવે ભડકો મ કરજો.”

બહારવટિયાની આ મહાનુભાવતાએ તો કપ્તાન બહાદુરને ઊભેલાના અધિક ગંડા બનાવ્યા. એનું અભિયાન ટુકડેટુકડા થઈ ગયું. એણે ફરી વાર ગોળી છોડી.

ગોળીનો જવાબ સામેથી ગોળીએ જ દીધો. એક જ જોળાટ થયો. ને કપ્તાન ખૂબ ચાટતા પડ્યા.

રોમાનેતી પાસે આવ્યો. કપ્તાનની લાશને એણે ગમગીન હદ્યે ઊથલાવીને ચાતી કરી.

“શા માટે” - પોતાની આસપાસ વીટળાઈ વળેલા સાથીઓને એણે કણું : ‘શા માટે આ લોકો મારી પાછળ લાગ્યા છે ! શા સારુ મને એ પછાડોમાં એકલો પડ્યો રહેવા હેતા નથી ! હું કાંચ એને ગોતવા જાઉ છું ! મારી આ કડવી તેર બની ચૂકેલી હિંદગાની પણ

જો મને તેણો આવી જ ક્રોચવમાં શુપણા વેળી કાણા આવે તો ફુલ તેણોને નાખાડું, એટા હિંજ પહોંચાડવા નથી આવતો. નીકર આવી નાદુંની નાની ગાંધી એ ફું, કામ નાખાડું, છે? મેં ધાર્યું હોત તો હું બેચા સોને ફુલી મારત, પણ રીતની ફુલાંની નાખાડું, એટા મને હવે છેડો ના. મને પડજો રહેવા હો!"

[6]

હિવસો હિવસ એવી ઈંડિક પરાકમની વાતો આ બલાદુરને નામે ચઢતી હતી. એટાનું દુલ્હ વાપે છે કે 'ભલાદુર' એવું બિસુદું આ બહારવટિયાને માટે હું બગાલર. જ વાંચી રહ્યું, કારણ કે એનું બહારવહું વાજબી હો વા જેરવાજબી, છુતાં રોમાનેતી એક મદ્દ હતી. હદ્દથીય જ્યાદે રહમહિલ અને સાગરપેટે હતો. શાનું કે મિત્ર હરકોઈની સાચેના વાંદ્યારાનું નીડર તેમ જ નેકોઢાર હતો. અરે, સાચને ખાતર એણે પોતાના સગા ભાઈ નમા પણ રીતી ભાઈબંધ સ્યાદાને, જુઓને, ફાંસીને લાકડે મોકલવાની છાતી બતાવી હતી.

હીકુત આમ બની ગઈ. એક હિવસ ધોળે દહાડે છટેચોક એક જામમાં દ્યાખત થઈને બહારવટિયો સીધો મેયર સા'બના મકાન પર આવ્યો, સાહેબના ચાકરને એક બંધ કરેલો કાગળ દીધો. કહ્યું : "સા'બને પોગાડજે."

"કોણો છે?"

"અંદર સહી કરી છે."

પોતે અલોપ થઈ ગયો, અને પછી મેયર સા'બે કાગળ ફોડતાં અંદર રોમાનેતીના હથની સહી દીઠી ઘડકતે કલેજે એણે કાગળ ઉકેલ્યો.

લઘું હતું કે, 'મેયર સા'બ! તમારા ફલાકા ગામડામાં ફલાકી છોકરીના જે આંશિક ખારવાનું ખૂન થયું છે, તેનો સાચો ખૂની તમે જેને પકડેલો છે તે ફેરારી નથી. ખૂનનો સાચો કરવાવાળો તો સ્યાદ નામનો આસામી છે. આ સ્યાદ મારો ભાઈબંધ છે ને અત્યારે મારા કન્બળમાં છે. વાસ્તે તમે નિર્દોષ ફેરારીને જો મોકળો કરો તો હું પંડે આવીને મારા સગા ભાઈ જેવા આ દોસ્ત સ્યાદાને - ખરા તહોમતદારને સુપરદ કરવા તૈયાર હું. લજિતંગ બા'રવટિયો રોમાનેતી.'

બહારવટિયાના કાગળની વાત બહાર પડી. પીઠાંમાં અને હોટેલોમાં ચર્ચા થવા લાગી :

"ભાઈ, હું પંડે જાણું હું કે હવડી ઈ છોકરીના આશકને ગોળીએ દેનારો ઈ સ્યાદો જ છે. ઈ સ્યાદો જ છોકરીના પ્યારનો ઉમેદવાર હતો."

"ધ્ય, મુનેય માલૂમ છે. ઘણુંય સમજુંએ છીએ કે બાપડો ફેરારી તો નરાતાર બેગુને ફાંસીને લાકડે લટકશે."

"ત્યારે તમે જાણબેદુઓ કોઈ જાહેર કાં નો'તા કરતા?"

"ડરથી કરીને, કે બા'રવટિયો અમારા બાર વગાડી હિયે. સ્યાદો રહ્યો એનો હિલોજાન દોલ!"

"પણ બા'રવટિયે તો કમાલ કરી. પોતે જ સ્યાદાને સૌંપવા આવે છે."

"ધ્ય, નિર્દોષનો જાન જાય છે તે સાહુ, બડો નેકપાડ છે આ રોમાનેતી. એના ઉપર આફૂં હેત વશૂટે છે."

“તો હવે હાઈ તર નથી ના ? હાલો ખર્દિને મેયર સાંજ પણ જાહી રહ્યું છે..
સાચો ખૂની ફેરારી નહિ પણ સ્પાદો છે, એવી જુલાનીઓ કરતું અનેક જાણનું ગે
મેયર કરે આવ્યા.

“અમે આજ સુધી બહારવટિયાની બાકે જીવાન બોલતા નહોના” એવો અસુધ કહ્યો.
મેયરે ડોકુ પુલાવું : “બિલકુલ નહિ, એક વાર કરેલા કાંઈયાં હવે નહિં કરી
શકે.”

“હાં ! બસ ! બચાડો નિરપરાધી કારોએ હાલ્યો જાઓ ?”
“બેશક જાશો.”

લોડો તો જોઈ રહ્યા, અને તાંકોમંતાદાર ફેરારીને પગમાં બેઠી તથા લાઘકરી નાખી,
એ બધિયારબંધ પોલીસોની પારી મહાલના એજેન્સિયો ગામ તરફ લઈ ચાલી.
એકએક જાડીમાંથી એક અડભૂષ મોટો જુવાન જંગલી પગુની જેમ નીકળી પડ્યો
ને એણે ગાડ પાડી : “એ હેઈ ! હું સ્પાદો હું, મેં જ ઈ ખારવાને કાર માર્યાં છે. ફેરારી
બાપડો કંઈ જ જાણતો નથી, એને છોડો, હાલો, હું તમારો કેદી બનીને આવું, નાખો બેરીનું
મારા પગમાં.”

પોલીસો ઉભા રહ્યા, થોડી વાર વિચારમાં પડ્યા, પછી માથાં ધુંફાવીને બોલ્યા :
“ના ભા ! અમને તો હુકમ છે કે ફેરારીને જ જેલમાં લઈ જવો, અમે તો ચિક્કીના ચાકર.”

“એને છોડવો છે કે નહિ ?” સ્પાદો જિજાઈને તાડક્યો : “કંદું છું કે ખૂની હું છું,
ઈ બચાડો નિર્દોષ છે.”

પોલીસોએ ફરી વાર માથાં હલાવ્યાં કેદીને લઈને એ ચાલતા ચપા
“ઠીક ત્યારે તકદીર તમારાં ! - ” સ્પાદાએ હાક મારી : “હું એને છોડાવે જ
રહીશ.”

એટલા શાખ્દોની સાથે સ્પાદાની પિસ્તોલમાંથી બે બાર છૂટ્યા, એક પોલીસ જ્ઞાપાઈને
એ ઊંચી પગદરી પરથી ઉડ્યો, તે દોઢસો હાથ ઊંડી ખીણમાં જઈ પડ્યો. બીજાની ખોપરી
ફારી ગઈ.

સ્પાદાએ ફેરારીને મોકળો કર્યો, પૂછિયું, “હવે ?”
“હવે તો ભાઈ, આ ફુલેસ મૂઆ એટલે મારે માથે બેવડું આળ મુકારો. ને કોરટમાં
કંસલો તો અવળો જ પડશો.” ફેરારી વિમાસલામાં પડ્યો.

“તો માંડ ભાગવા, જા ભળી જા રોમાનેતી ભેળો. આમેય મોત ને આમેય મોત..”
“ને તું ?”

“મેં પણ કામો એવો કર્યો છે કે હવે હુંય ભાઈ રોમાનેતીની ભેળો થઈ જઈશ..”
આ રીતે નીતિવંત જંગલવાસી સ્પાદો હવે બહારવટિયો બન્યો. તે રાત એ એક
ભાઈબંધના ઘરમાં રોકાવાનો હતો એવી જાણ ફેરારીએ ભાગીને રોમાનેતીના સાથીએને
કરી દીધી.

“ત્યારે તો હવે સ્પાદાને વેળાસર બચાવી લાવીએ.” એમ કહીને બહારવટિયો ઉપડ્યો
તે ભળકડે એ સ્પાદાના ભાઈબંધને ખોરડે પહોંચ્યો. પહોંચતાં જ એને ફાળ પડી : “આ
શું ! આ ખોરડું તો ફુલેસ ધેરી લીધું છે.”

અંદર સ્પાદો ઘસધસાટ ઘોરતો હતો. શી રીતે ચેતાવવો એને ?

અને આપણા જીવીને બોલે પણ કહું નહિએ કાર્ય. આજુની રાત્રિ અને તું હજુ તું નિરૂપની
નીચે આપણને પોતાના ઠીક: જીવી રેવાના બોલાવી બેઠી કિંમતી વાતો સાથે હજુ નિરૂપની
ના: નિરૂપન ખાતો કરી પણ એ અપણ બોલે પોતીના પણ ના: નિરૂપન ખાતો

અને... જીવાનેની જેવા બોઈ, નહીં બોલાનેની! પોતીના પણ ના: નિરૂપન
ના: ના: નિરૂપનેનીએ જીવી આશીર્વાદ બેઠી કે જી વાર્ષિકીયાને હતે બીજું ના: નિરૂપન
ના: નિરૂપન ખાતો કરી પણ એ અપણ બોલે પોતીના પણ ના: નિરૂપન ખાતો

અને... એવાના સ્થાનો જગ્યો હતો. ભાનમાં આવતો જ એને સમજાનું કર્યો હતું
કું જાણ આરીને એ ખડો થયો. અને જુઓ છે તો એને આસારો આપણારે આદરશની જેણ
જ રીતેને આરીમાંની રૂમાલ ફરકાવી પોતીસને બોલાવી રહ્યો છે. સ્થાનમાં આવતે જુઓ
“આવી ખૂબુલાઈ! હવે તો ઉધાડ બારણું ને દોડ તું બહાર. નીકર હમણાં કું દીકાં...
દરથરતો એ આસામી બારણું ખોલીને બહાર દીક છે. સ્થાને પણવાળી વારીનેની
હું છે. ને સ્થાને કંઠેથી અવાજ સાંભળે છે કે “સ્થાદ હેઠ, સ્થાદ! હું આપી હું આવી
થોડ આવી પોગ.”

ખૂબેવ આદમી બહાર દોડનો તેને સ્થાને સમજું પોતીસ ત્યાં જમા થાય છે. પછીનું
સ્થાને અને રોમાનેતી એકદા મળી જઈને જ્યાંખી બોલાવતા ખડકોમાં ગાયન થાય છે.

[7]

“આવાં એનાં પરાકમ પછી પરાકમ સાંભળતો હું હિટલીમાંથી પાછો વળતો હતો
ત્યારે રસ્તામાં કોર્ટિકા બેટ ઊતરવાની - બની શકે તો બહારવટિયાની સાથે એકાદ રાત
જ્ઞાનવાની-મારી ઉંઠદાને હું ન રોકી શક્યો. એક દિવસ હું નાનકડા એજેસિયો શહેરથી
ખાલ્દરામાં ઉપરી ગંધો બહારવટિયાની પાસે સહીસલામત પછોંચવા માટે ગજવામાં એક
ઘણ્ણો-પરવાનો પડવો હતો. એના ઉપર બહારવટિયા રોમાનેતીની મોરી મહોર-જાપ
થતી”

અદ્યાં કથીને જાણુંની અફસર એસ્ટન વુલ્ફ પણડોમાં એ રાત્રિના પોતાના પ્રવાસનું
કરીન કરે છે :

સંધ્યાવાસે હું એક નાને જામે પછોંચ્યો, જ્યાં બે ભોમિયા મારી વાટ જોતા હતા
ને ખજીની મારી મજલવમાં આરી - ધોર જાડી - વીધીને ખડકોનો ઊભો ચડાવ જ ચડવાનો
અનુભૂતિ. કાળા ખડકોની ચીધી બેખડોને વળાં પડેલા હોય તેવા જુંપડા સામે હું જોઈ
નહેલું. અમે એ પણ હું ઉપર એકેક જુદા જ ચાલી રાકતા હતા. રાતે સ્થામ અને ફરેલી
છતી; નિશાનું અને સુનંદિયા હતી. પાઈન અને ગોરે જડના સુસવારાથી છુફ્ફાર કરેલી
એ રાત મને એના અંધાર-પઢેદામાં જાણે લાપેટીને ગુગળાવતી હતી. મને હતું હતું કે “આવી
અગાયા!”

આખર મારી આગળના અને પાછળના બેઠું ભોમિયાએ સર્પના જેવા સિસારા હથી.
ઊભા રહેવાનો એ સંકેત હતો. બે કલાકોના ચડાવથી ઊચો બડી અથેલો આસ મેં હેઠો

મૂળથી. ઉપર આકારના જાંખા લારા જબુકાતા હતા. આસપાસ ખડકોની અને પ્રાણીની ગંગાની જાંખી રેખાઓ સિવાય બીજું કશું જ નજરે પડતું નહોતું. ગોપામનો રોકડોક દુલ્હની આજાનું કોઈ અજાણ્યા ભયનું ખંજર છુપાવીને ખડો હતો.

નીચે, કેટલેય નીચાસે કિનારા પર બજારા થોડા દીવાઓને ગંગે અજગ્યાને દર્શાવે ડેખાતો હતો.

થોડે દૂર જાડની એક ડાળીનો કચ્છુડાટ થયો. અને 'કલીક' કરતા અવાજ જાંખી વીજળીબજીની રોશનીએ અમને આખા બનાવ્યા. પણ એક જ પણ - પછી પછી રદ્દું ધારો અંધકાર અમને ભીસતો ઊભો. કોઈ ઊડા ધારા અવાજે અમારા બોમિયાને કદદ પૂછ્યું. એ પુછાણમાં કરડાડી અને સંદેહ ભર્યા હતા. પછી અવાજ આવ્યો : "દેનાન - આવો !"

બે બુલંદ કુતાઓ ટદાર ખડા હતા. પોતાના કાન દીલા કરીને તેઓએ આ નવીન ગંધવાળા અજાણ્યા આદમીને આવવાની સંમતિ આપી.

હું સમજ્યો. બહારવટિયાની પ્રાણરક્ષણની પહેલી ચોકી પર અમે આવી પહોંચ્યા છીએ.

એટલામાં તો એકએક એ ખડકોમાંથી બે બીજા આદમીઓએ નીકળીને અમારી દરચે જગ્યા લીધી. ચુપચાપ અને સચેત બની અમે ચાલ્યા. અવારનવાર કોઈ વંડી જગ્યાએ ચોકીદારોની બજીઓ ઘડીભર અમારી કેડી અજવાળીને પાછી ઓલવાઈ જતી હતી; ને એ પલકવારના જબુકાટમાં હું મારી આસપાસના એ ત્રાંબાવરણા, કાળમીઠ-શા કઠણ, પણોળા અને પડછંદ માનવ-આકારોને નિહાળી લેતો. તેઓને ખબે તૈયાર બંદૂકો હતી. તેઓના પછામાં અને ગજવાંમાંથી ડોકિયાં કરતી પિસ્તોલો ને છૂરીઓ એ પ્રકાશને પલકારે ચ૆પતી રહેતી.

હું જો એક નોતરાઈને આવેલો પરોણો ન હોત તો તો મને એમ જ લાગી જત કે અંધી મારા જાનની કિંમત એક દમડી જેટલી પણ નથી. પણ હું જાણી ચૂક્યો હતો કે કોર્સિકા બેટના મહેમાનદારીના કાયદા અવિચળ છે. મને ફડકો તો ફક્ત એક જ હતો કે આજુબાજુમાં જાસૂસી કરતો કોઈ સરકારી સિપાહી જો અમને મળી ગયો ને, તો તત્કાળ મને આ લોકો કોઈ સરકારનો મળતિયો દગ્લબાજ જ માની લેશો. ને એક જ ભડકો મારી આ મુલાકાતની સમાપ્તિ આજાશે.

બહારવટિયાના રક્ષકો કશી વાતની ચર્ચા કરવા કઈ થોડા થોબે છે ! એને તો પોતાના સરદાર તરફની વફાદારી મુખ્ય વાત છે. નિર્દોષ કોઈ માર્યો જાય તેનો બેશક એનેથે અફસોસ થાય, પણ જલાઈ જવાના જોખમમાં ઉત્તરવા કરતાં તો શક પડ્યો કે બંદૂક ચાંપવી જ ભલી !

એકએક કેડો પહોળો બન્યો ને સપાટ ભોં આવી. પછી અમે છ-સાત ઝૂંપડાંના એક નેસ સોંસરવા પસાર થયા. બીજે છેડે ઝૂંપડું હતું ત્યાં અમે થંબ્યા. એ ખુલ્લા ફૂથામાંથી હૂંફાળી સગડી જબૂકી.

એક ભરવાડનું - બહારવટિયાના ભાઈબધનું - એ ઝૂંપડું હતું. રક્ષકોના હુકમ મુજબ હું અંદર દાખલ થયો. ભરવાડે મને પથ્યરની બેઠક પર બેસાડીને કહ્યું : "ઉં હજુ આવ્યો નથી. પણ હમણાં આવી પોગશો."

બહારવટિયાને વાતચીતમાં નામ દઈને નહિ, પણ 'ઈ' કહીને ઓળખાવવામાં આવતો હતો. એકેકની પાસે ઓછામાં ઓછાં બાર-બાર હથિયાર અને એકેક ભરેલી બંદુક એવા કેટલાક કદાવર લોકો મારી ચોપાસ વીટળાઈને મને તીશી આંખે તપાસતા ઊભા. એ બધા બહારવટિયાના અંગરક્ષકો હતા; અને જ્યાં એક નાની એવી ચૂક પણ મોતનો મામલો મગયે છે એવી દુનિયાની અનુભવશાળામાં ઘડાયેલા આ લોકો હંમેશાં દગ્લભાજને પકડી પાડવામાં પાવરધા હતા.

આખરે બારણું ઊઘડયું ને હું જેની મુલાકાત વાસ્તે આટલે દૂર આવ્યો છું તે આદમી દાખલ થયો. પંદર વરસ થયાં સરકારને હાથતાળી દઈ રહેલો શું આ નોંસ રોમાનેતી! મારી પહેલી છાપ નિરાશાની પડી. મધ્યમ કદનો, ભૂરો પોશાક પહેરેલો અને સાઢી પોચી ટેપીવાળો સાવ સાધારણ એ આદમી હતો. એની બંદુક પણ સાઢી હતી. આ બહારવટિયો!

પછી એણો જ્યારે નજીક આવીને મારી સામે હાથ લંબાવ્યો, ત્યારે મને એ પુરુષના પ્રતાપની અને એની મુખમુદ્રામાંથી જલકતી લોહચુંબક જેવી જવાંમદીની આંખી થઈ.

ઘટાદાર ઝડી જેવાં ભવાં નીચે ઝગારા કરતી એ બે પાણીદાર આંખોને પંદર વરસના વનવાસે વાઘદીપડાની પેઠે અંધારે પણ દેખતી બનાવી હતી. બહારવટિયો બન્યો તે દિવસથી જ રોમાનેતી હંમેશાં રાતે જાગતો ને દિવસે ઉંઘતો. એવી રાતની કિયાઓને ટેવાયેલી બે આંખો જ એ ચહેરાની ખરી ખૂબી હતી. એની નજર તીણી, કરી અને વીંધી નાખે તેવી હતી. આંખોનાં કાળાં ઊંડાણોમાં અક્કેક ગીણી જાપોત જાણો નિરંતર ટમટમ થતી હતી. એના સખત બિડાયેલા હોઠ ઉપર નાની કાળી દાઢીમૂછ ઢંકાયેલી હતી. એ નીચેની હડપચી કોઈ ખડકની માફક ધર્સી પડતી હતી. શાતી પહોળી હતી. પગ ટૂકા ને પેશીદાર હતા.

એક પલકારે હું જોઈ શક્યો કે આ માનવીનું કલેવર કુદરતે મુસીબતો વેઠવાને માટે જ પોતાની લોખંડી એરણ ઉપર ટીપીટીપીને તૈયાર કર્યું છે. આમ રોમાનેતીને જેવો છે તેવો તો બહુ થોડાકોએ જોયો હતો. કેમ કે કેટલી વાર તો એ પોતાના કોઈ સાથીને જ રોમાનેતી બનાવીને મુલાકાત લેવા બેસાડતો. કોઈ વાર પોતે હડપચી ઉપર ચેત દાઢી પહેરી લેતો. આમ એનાં ચહેરાનિશાન વિશે સર્વત્ર ગોટાળો જ ચાલતો હતો.

અમે મેજ ઉપર બેઠા કે તુરત જ બહારવટિયા દોસ્તે એક મોહક હાસ્ય કરીને કહ્યું : “આપણો બન્નેએ જગ્યાની અંદલાબદલી કરવી પડશે. મારે હંમેશાં બારણાની સામે જોઈને બેસવું પડે છે. આદત પડી ગઈ છે ને, ભાઈ!”

વધુ એણો કશું ન કહ્યું. પરંતુ એ સાદા શબ્દોની પાછળ રહેલી કરુણતાને હું સમજ ગયો. નિરંતર એને તો શત્રુઓથી ખબરદાર રહેવાનું : પલેપલ એને કોઈ દુશ્મનનો ડર : આરામની થોડી ઘડીઓ દરમિયાન પણ એને તો વીસરવાનું જ નહિ કે પોતે એક શિક્કારનું પશુદું છે અને પોતાના માથા ઉપર મોટું લલચામણું ઠનામ લટકે છે.

વાળુની વાનીઓમાં બહારવટિયાએ ખાસ પોતાની દ્રાક્ષોના માંડવામાંથી બનાવેલા આસવોના સીસા પીરસ્યા હતા. અમે મોજથી ગુફતેગુ કરતા હતા. પાસે બેઠેલા કુતાઓ ઘડીઘડી માથાં ઊંચકીને સાંભળ્યા કરતા હતા, ને દર અરધા કલાકે બારણું ઊઘડતું, એક રક્ષક આવીને બહારવટિયાના કાનમાં કશુંક કહી ચાલ્યો જતો.

એક વાર એ શબ્દો મેં પકડયા હતા : “પહેલા ને બીજા નંબરના સંત્રી ખેરિયત જણાવે છે.”

એવા ચોકીપહેરા વરનો અમે ભોજન લેતા હતા. બહારવટિયો દોસ્ત ખાતો તો જરૂરિક જ. વિશેષ તો એ આસવની ઘાલીઓ જ ગટાવે જતો. પછી જ્યારે મેજ ઉપર ઢેરી બનાવટની જલદ શેત તાડી પીરસાઈ અને સિગારેટો ચેતાવાઈ, ત્યારે બહારવટિયાએ ડિલ હાયું.

મેં પૂછ્યું, "તમે એક બગાસું પણ ખાધા વગર એક સામના સાઠથી એંસી કલાકનો ઉજાગરો જેંચી શકો છો એ વાત સારી?"

"ભાઈના સોગંદ, સારી વાત." બહારવટિયાએ જવાબ વાય્યો, 'આજી આવરદ્ધમાં મને જોકાં તો કદી આવેલાં જ નથી. મારું દિલ હોય તો જ ઊંઘી જાઉ છું. ને તે પણ દા'ડે; કોઈ વાર ચાર કલાક કે પાંચ કલાક. પણ નીંદની જરૂર ને લીધી નહિ, કટાળાને લીધી.'

મેં કહ્યું, "પેલા અમેરિકાવાળાનું એરોપ્લેન આંહી તૂટી પડ્યું હતું તે પ્રસંગ જાણવાનું મારે મન છે."

"હા, એક દી સવારે અમે દુક્કરનો શિકાર કરીને પાછા વળીએ છીએ, ત્યાં એ વિમાનનો ઘરેરાટ સાંભળીને અમે ચોક્કા, કદાચ કુલેસવાળાઓની આ નવી તરકીબ હોય એવી બે ખાઈને અમે જાઈમાં બેસી જઈ સફેદ વિમાનને આવતું નિહાળી રહ્યા. એકાએક અમે એમાંથી એક ધુમાડાનો મોટો થાંબલો ચડતો દીઠો, ને એક પલમાં તો વિમાન ત્યાં પટકાઈને જાહોમાં ભુક્કો બની ગયું. ત્યાં અમે દોડવા ગયા. એ સળગતા ઢગલામાં અમે બે મર્દોને અને એક ઓરતને દેખ્યાં. અમે બધા તો તાત્કાલિક મલમપટામાં કાબેલ રહ્યા ને, - શું કરીએ ભાઈ! જજ મારીને કાબેલ થવું જ રહ્યું - એટલે એ બિચારાંની બનતી સારવાર તો પ્રથમ દરજે પતાવી. વિમાનનો પાછિલાટ તો તમામ થઈ ગયેલો, પણ ઓરત ને મર્દ જીવતાં હતાં. મારી ઓરત તમારા લાવા ગામ પડખેના પડાવે જ હતી ત્યાંથી મેં એને તરત તેડાવી મગાવી ને બીજી બાજુ નજીકને શહેરેથી દાક્તરને તેમ જ જોળી ઉપાડવાવાળાને તેડાવ્યા. થોડે વખતે એ બધા તો પોલીસના પહેરા સાથે આવી પહોંચ્યા. અમે બેશક ધુપાઈને બેઠા હતા, પણ મારી ઓરત તો એ બેહોશ કમનસીબોની સારવાર કરતી ત્યાં જ ઊભી હતી. એ બાપડીએ પોતાનાથી બનતું કર્યું - જુખ્મો ધોયા ને ચહેરા સાફ કર્યા. જોળીમાં નાખીને તેમને તો ઉઠાવી જવામાં આવ્યાં, ને એ લોકો પાસેનું જે રોકડ નાણું તેમ જ દાળીના અમે કબજે લીધીલાં તે તમામ મારી ઓરતે સરકારી માણસોને સુપરદ કરી દીધાં. પછી એ બેમાંથી કોઈ જીવતું તો થયું નહિ, પણ મારા ઉપર તો છેક અમેરિકાથી અહેસાનના કાગળો મારી ઓરત મારફત આવ્યા હતા. આ જુઓ! આ રહ્યા એ કાગળો. મેં હજુ સાચવી રાખેલા છે : જુઓ આ ફાંકડી ગજવાપોથી.' એમ કહી બહારવટિયાએ એક ચામડાની, સુંદર પોથી કાઢી. તેના ઉપર સોને તેમ જ હીરે મફેલો N અક્ષર હતો. એટલે બહારવટિયાના નામ 'નોન્સ રોમાનેતી'નો પહેલો અક્ષર. હું હસ્યો - 'એન' - એ તો બીજા પણ એક દેશાપાર થયેલા કોર્સિકાવાસીના નામનો પહેલો અક્ષર, ખરું ને?"

"હા, નેપોલિયન : એ પણ આખરે એક જાતનો બહારવટિયો જ હતો ને, ભાઈ! અલબાટ, મારા કરતાં કૃપાંદે મોટો - વળી એનો સિતારો બુલંદ નીકળ્યો અને મારા મુકદરમાં - " બહારવટિયાએ નિઃશાસ નાખ્યો. પછી એકદમ જાણો કલેજા પરથી કશુંક ખંખેરી નાખતો હોય તે રીતે એ છલંગ મારીને ખડો થયો, બોલી ઉઠાવો કે, "પરવા નહિ.

જુદો હોસ્ત, તમને બતાવી હઈએ કે અમે કઈ હરકદમ જમગીનીમાં જ જિંદગી નથી કાઢાયા.
ઓ હોસ્તો, ચાલો, ગાના-બજાનાં ચલાવો."

એક આખું મંડળ રચાયું, એક જણ જિંદગી બજાવતો હતો, અને આખું મંડળ કાર્યક્રમ
બેટના મશાદ્વર વિલાપગીતો ગાવા માંડયું, એ વેધક શોકસૂરમાં એક પછી એક લોકગીતની
પહેલી લાટીઓ ઠલવાતી ગઈ.

પછી બહારવટિયો પણ ઉઠીને એ રસમાં શામિલ બન્યો, અને પોતાના સુંદર ધેર
ગળામાંથી 'વોસેરી' નામના લોકગીતની અકેક કરીને વાર્ષિક ઉલટાવી ઉલટાવી રૂક્ખના
લાગ્યો, એ ગીત મહેમાનના માનમાં ગવાય છે, ને એની મુખ્ય પંક્તિ તરીકે 'લાખેશો મરદ
આપણા ધેરે આધો રે!' એનું કંઈક જોડકણું જોડાય છે, પછી કેટલાંક ઈટાલિયન ગીતોનો
લલકારાયાં, પણ ફરી બહારવટિયા એ સુધરેલા ઈટાલિયન સંગીત પરથી પોતાના બચ્ચાનું
દેશી કણો પર આવી પડ્યા, અને જરી વારમાં તો એ દેશી સંગીતના મસ્ત જંકારે હવા
ઘબકી ઉઠી.

વેરાનની રાત આ રીતે ગાન, નાચ અને ગુલતાનમાં ગળવા લાગી.

જિંદગીમાં જાણે રજમાત ચિંતા ન હોય એવા મસ્ત ઉલ્લાસથી ગાતો, નાચતો અને
મદની ખાલીઓ પીતો આ રસીલો અણથાક માનવી વિકરાલ બહારવટિયો હશે, પલેપલ
એનું માથું ડગમગતું હશે, એના નામોચ્ચારથી છોકરું છાનું રહેતું હશે ને ભલભલા
જંગબધાદુરોનાં કલેજાં કાંપી ઉઠતાં હશે એનું કોણ કલ્યી શકે!

પણ એ કઠોર સત્ય મારી સંમુખ જ આવી ઉભું રહ્યું, એ બુલંદ રાસલીલાની વચ્ચે
એકએક બહારથી એક લાંબો ઉંડો અવાજ આવ્યો, કુત્તા ભસ્યા, અને એક પલમાં
નિઃશબ્દતા છવાઈ ગઈ.

એક પલ પહેલાં જ રોમાનેતીનાં પગલાં એ નાચમાં લથડિયાં લેતાં હતાં, અઢી રતલ
કાચી બાન્ડીએ બહારવટિયાના લોખંડી મનોબળ ઉપર પણ માદકતાની અસર આણી દીધી
હતી. આંખો ધેરાતી હતી.

પણ પછી! - નશાબાજીનાં તમામ ચેનો એક પદ્ધીના પડછાયાની પેઠે ચાલ્યાં ગયાં,
ધેનદેરી ચકચૂર આંખો ફરી વાર ચોખ્યી ને ચણકતી બની ગઈ; મને એણો બાજુએ જેસવીએ
પોતાની બંદૂક પંજામાં જુકડી લીધી.

એક આદમી દાખલ થયો ને કંઈક ગજાગજ્યો, રોમાનેતીએ મારી સામે મસ્તક ઝુકાવી,
મોં મલકાવી આ રંગભંગ માટે માઝી માગી, ચપોચપ બંદૂકો તપાસાઈ ગઈ, કમરપણ તંગ
કરી લેવામાં આવ્યા, અને આખી ટુકડી, હારબંધ, ગંભીર ખામોશી સાથે કૂચકદમ કરી
નીકળી ગઈ.

થોડી ધડી પછી મેં ધોડાના ડાખલા પડતા સાંભળ્યા; ને તે પછી આધેઆધેથી એક
ગોળીબાર સાંભળ્યો, બારાજાની બહાર ગયો ત્યાં તો સર્વ સૂનકાર અને સન્નાટ હતો.
બહારવટિયાનો રાજા રોમાનેતી ગાયેબ બન્યો હતો!

મારે કમનસીબે વળતે પ્રભાતે મને ત્યાં જોઈ લેવામાં આવ્યો હતો, એટલે પાછા
વળતાં મને બે પોલીસોએ પરહેજ કર્યો. મારે કંડે લોખંડી સંકળ જડવામાં આવ્યો. મને
શહેરમાં લઈ જઈ, બહારવટિયાને ચીજવસ્તુ પહોંચાડનાર તરીકે રજૂ કરવામાં આવ્યો. હું
કોણ છું તેની ખાતરી કરાવતાં સદ્ગ્રામ્યે મને છોડવામાં આવ્યો હતો.

વાત ચાલે છે કે ભાઈ, એક દિવસ રાતે એક અદરગાળાના ગામડાના હોટેલમાં બહારવટિયાના આવા રંગરાગ અને નાચગાનનો જલસો જાગ્રી પડ્યો હતો. અંદર એ મહેલિની ઝૂક મરેલી હતી અને બહાર કુતા તેમ જ માનવ-સેવાઓ બાબે જાહી ફરતા ચોકી રાખી રહેલા. એ ગુલતાનની વર્ચ્યે ગામનો ધમગુરુ આવીને ઉલ્લો રહ્યો. બહારવટિયાની પાસે જઈને કાનમાં કંઈક કહ્યું.

શબ્દ સરખો પણ બોલ્યા વગર બહારવટિયો ચૂપચાપ ઉલ્લો થયો અને પાદરીસાહેબની પછ્યાડે પછ્યાડે ચાલ્યો. બન્ને જાજા એક ઝૂપડામાં ગવા.

ઝૂપડામાં એક ગંધાતું બિછાનું હતું, તે ઉપર એક ખેડૂતની ઓરતના છેલ્લા શાસ્ત્ર જેંચાઈ રહ્યા હતા. મરતી ઓરતનો ધણી એ પથારીની સામે ધૂટાલાભર બેસીને છેલ્લાં આંનું સારતો હતો.

બહારવટિયાએ ટોપી ઉતારીને ધીરેધીરે અંગૂઠા પર પગલાં ભરી પથારી પાસે આસન લીધું. મરતી ધરનારીને અને રડતા ખેડૂતને એણે કેટલીક વાર સુધી શાંતિનાં વચ્ચે સંભળાવ્યાં. મીઠું આશ્વાસન આપ્યું. પછી એ ત્યાંથી નીકળી ગવો. બહાર ઉલ્લા રહીને એણે પાદરીના હાથમાં દોથો ભરીને બેન્ક-નોટો મૂકી. કહ્યું : “આ એની દફુનકિયા માટે, એનાં રજણી પડનારાં બચ્યાં માટે, અને એની પાછળ મારા વતી દેવળમાં બંદગી મંડાવવા માટે.”

હોટેલમાં જઈને એણે સાથીઓને ચૂપ કર્યા અને આખી મંડળી ઘોડે ચડી જંગલમાં ચાલી ગઈ.

પોલીસ-અધિકારી વુલ્ફ કહે છે કે “હું એને મળ્યો તે પછી એક વરસે, બરાબર ભળકડા બાદ બહારવટિયો લાવાગાળીવાળે ધેર જતો હતો ત્યારે ખડકોની પછ્યાડે છુપાયેલી એક પોલીસપાર્ટીએ એને પડકાંધો, શરણો થવા કહ્યું, જવાબમાં બહારવટિયાએ પિસ્ટોલ ચલાવી અને અર્ધચંદ્રકારે ફરતા ભડકા કર્યા પણ પોલીસની ગોળીઓની ‘વોલી’ થઈ, તેમાં બહારવટિયો ઘોડેથી પટકાઈને રામશરણ થયો.”

એ થયું સરકારી નિવેદન.

બહારવટિયાના દોસ્તો બોલે છે કે કેટલાક દિવસોથી રાત ને દહ્ઢાડો શિકાર જેલીને થાકેલો બહારવટિયો પડાયેના. એક ગામે પોતાના માંડવાની દાક્ષો તથા આસવોના વેચાણ સારુ વાટાધારો કરવા જતો હતો. એક ભાઈબંધી એની સંગાથે ચોકી કરવા જવાની ખુશી બતાવી. સાથીઓ બધા થાકી લોથ થયેલા, એથી બહારવટિયાએ આ ભાઈબંધને એકને જ લઈ મુસાફરી માંડી. પોતે ઘોડા પર હતો. ભાઈબંધ પાળો હતો. બે માનીતા કુતા માર્ગમાં બહારવટિયાના ઘોડા ફરતા આંટા મારી રહેલા હતા.

બરાબર ભળકડા પહેલાં આ ભાઈબંધ જરીકું પછ્યાડે રહી ગવા અને રોમાનેતીની પિઠ ઉપર ગોળી ચોકી. બહારવટિયાનું કલેજું ફાડી નાખ્યું.

રોમાનેતી એ રીતે મૂઽાં.

એનો દીકરો હજુ બાળક છે. બેટવાસીઓ કહે છે કે છોકરો જુવાન થશે એટલે ‘વેન્ટેટા’ પરંપરા ચાતુ કરશે. અને ‘ભાઈબંધ’ને શોધી લેશે.

કામડનો વ્યાર.

પ્રેલીસ અધિકારી બીજુ કથા કહે છે :

બુલંદ કંડા કાર્પોરિયન પણાડની મૂછોને એક છોડ, વિનગા નામના નાનકડ નામનાનું
ખાડીને લોથ ધરેલા મારા શરીરે એક દિવસનો વિસામો માર્ગ્યો, એ હંગેરી દર્શાના નાજુક
મુસાફરખાનામાં મેં મારો ઘોડો બાંધ્યો. મને આપવામાં આવેલા એ નૂચાના ઓર્ડરનાનું
પોપટિયા રંગના પડદાથી અને લંબગોળ આકારની નાનીનાની બારીઓથી મારા કંન કરલાને
વાબશ વળી ગઈ. સોનલ ધાન્યથી લચકતાં ખેતરો ઉપર સંદ્યા રમતી હતી. લીણ ગૈયાનું
ઉપર આથમતો સૂરજ કંકુ ઢોળતો હતો. તેની પછિવાડે, પરીઓના દેશની આડે પડેવી છેય
તેવી પાઈન જડોની ઊંચોઊંચી કાળી અટવી જાણે કે એ ભૂરા કાર્પોરિયનના આખુગુલોકમાં
કોઈ મારીનું માનવી ન પેસી જાય તે સારુ રસ્તા ઝંધીને ઊંચી હતી.

ઠંડા-આકારની મારી બારીમાંથી હું નીરખી રહ્યો હતો : ત્યાં - ત્યાં, એ અનેથી
પણડોના અંતરમાં પુરાતન જીંગારી જાતનાં કામડુ લોકો વસતાં હશે. જીંગારીઓની ચંદ્રી
એક નામીચી બહારવટિયણ હતી, અને વિશેની કંઈ કંઈ ચમત્કારધેરી વાતો મારે કાને આવી
હતી. મારો પ્રાણ એ જીંગારીઓને મળવા પણડો પર ફાળ ભરી રહ્યો હતો.

મુસાફરખાનાની એ મધુરમૂર્તિ માલિકણને મેં પૂછ્યું : "કાલે તો રવિવાર છે એટલે
અંહી લોકોના રંગરાગ અને નાચગાન જામણે, ખરું?"

"ખરું, ખરું." એણે પોતાની જૂઈના ફૂલ જેવી દંતાવળ ચણકાવતો મીઠો મહકાટ
કરતાં કહ્યું : "તમે ટીક વખતસર આવ્યા છો. કાલ તો અહીં અમારા એક સંતના માનમાં
ત્રણ દિવસનો મેળો ભરાશે. તમને અમારી મેળયર જાતના રીતરિવાજ, લેબાસ - પોશાક
અને માણસતૂલ્યાં જોવાનું મળશે."

"કોઈ જીંગારી આવશે?" કામડુ લોકોને મળવાની આશાએ મેં પૂછ્યું.

એ બાઈએ અભા હલાવ્યા : "જિસીઓ? કામડુ લોકો? - હા, રોયાં એ પણ બેળાં
થશે. હજુ ઘણાં ખાડી રહ્યાં છે. એ રોયાંના સંતાપ હજુ ટણ્યા નહિ, ઓલ્યો મદારી. જોસફ
બાબો એનું રીછું કરીને આવવાનો. જોસફ મદારી તો પેલાની જોડે - " એકાએક બાઈ
ચૂય જની.

"કામડુ બહારવટિયા માઈકલની ટોળી માયલો જોસફ ને?" મારાથી બોલાઈ ગયું.

બાઈના મોં પરથી લાસ્ય ઊડી ગયું. કરડાઈ છવાઈ : "શું! તમે વળી માઈકલ અને
નઈઓની બાબત શું જાણો છો? હું! સરકારના જાસૂસ લાગો છો."

“ના રે બહેન, હું તો અંગ્રેજ નથી, આંહીનો નથી. પણ એ કામડુ વર - એ માઈકલ-નાઈજરીની વાતો તો ક્યાંની ક્યાં જાતી પછોંચી છે, ને હું તો કળાકાર ગણો નેથી મને એમાં રસ પડ્યો છે.”

“તમે કળાકાર છો ?” ચકોર નજરે એણે મને નખરિખ નિષ્પાણો. “તમે ચિત્રર કાઢના તો લાગતા નથી !”

“ચિત્રર નથી કાઢતો. પણ બહેન ! કળાકાર તો જાતજાતના હોય છે ને ! મારે તો એ કામડુ બહારવટિયાની વાત જાણવાની ભારી તલપ છે.”

“તો કાલ જોસફ મદારીને પૂછજો. એક સોનામહોર એના હાથમાં સરકાવી દેંઝો. માઈકલ - નાઈજરીની વાતોના ઢગલે ઢગલા કરી દેશો. અરેરે ! શી એ જોડલી હતી ! પરી જેવાં રૂપ : શૂરવીર પણ એવાં : નાચવે ગાવે ગાંધર્વ જેવાં : ને લોહીનાંય એવાં જ તરસ્યાં ! પણ ગરીબને ન લૂંટતાં હો !”

“તો શું એ મૂખેલાં છે ?”

“મૂખેલાં !” બાઈના માંં ઉપર ગેબી ભાવ પથરાયો : “કોને ખબર, ભાઈ ! મૂખેલાં હોય તોયે હજુ ધરતી માથે હૃદ છે. અમને દેખા દિયે છે.” એટલું બોલીને એણે છાતી પર હાથનો સાથિયો કર્યો : “જોસફ ભાભાને પૂછજો. મારા હોઠ તો સિવાઈ ગયેલા છે. ને જો અંગ્રેજ ભાઈ ! તું આંહીં કોઈની પાસે માઈકલનું નામ પણ ન લેતો, હો ! નીકર છાતીમાં છૂરી હુલાવી દેશો કોક !”

મેં એ ચેતવણી સમજી લીધી. કદાચ બહારવટિયા-બેલડી આંહીં ક્યાંક આસપાસ છુપાઈ હો.

રાતે વાળું કરી, હંગેરી દેશની હેમવરકી મહિરાનો કટોરો ગટવીને હું સૂતો. રાતે જાણે કે એ નિર્જનતાની અંદર કોઈ બટકતાં કામડુ લોકોનાં દર્દભરપૂર ગીતોના હિલ્લોલ હું સાંભળતો હતો : અજબ જાતની જૂજવી ખુશબો વહેતો પવન મારા નાના ઓરડાની આસપાસ સિસોટી ઝૂકતો હતો. દૂરદૂર કુતાં ભસે છે અને ઘોડલાં હણહણો છે જાણે, કોઈ વડુ જાણો વિલાપ કરતું હતું. મારી નસો ત્રમ-ત્રમ થતી હતી. કામડુ લોકોની જે જે ગેબી કથાઓ મારે કાને આવી હતી, તેને માટે કેવું યોગ્ય રમ્ય-ભયાનક વાતાવરણ આ પહાડી નિર્જનતામાં વ્યાપી રહ્યું છે ! આવાઆવા વિચારોથી ભરપૂર હૈયે હું સૂતો, આખી રાત એ ભણકાર ચાલુ રહ્યા, સવારે મોડી મોડી મારી નીંદ ઉડી.

[2]

હરિયાળા મેદાન ઉપર હારબંધ રાવટીઓ ખેંચાઈ ગઈ છે. મેળો મંડાઈ ગવો છે. ભમતો ભમતો હું જોસફ મદારીને શોધતો હતો. ખેડૂતોના એક કિલ્લોલતા ગાંડાતૂર ટોળાની વચ્ચે એ પોતાના તોતિંગ રીંછને રમાડી રહ્યો હતો. હાથમાં સાંકળ હતી. રંગે કાળો, પડછંદ, કુસ્તીબાજ અને લાંબા કેશવાળો એ મદારી ત્રીસ વરસનો હશે કે સાઠનો તે કહેવું કઠિન હતું. એના ચહેરા ઉપર ઊંડી કરચલીઓ હતી, માનવલોકની બહારની કોઈ મુખમુદ્રા હતી, પશુતા હતી, કંગાલિયત હતી; એવું એવું હતું કે મળતાં દિલ પાછું હેઠે.

કામડુનો ઘાર

રમત ખતમ થઈ રોજી મધુને સત્તામ કરતો હુદાને હરવા લાગે એવી રૂપ
અવેલા ડાખામાં પાઈઓલો પડવા લાગ્યા. લોકો બીજા તમારા જોવા ચાહેયા જાણ સંદર્ભ
પડેલા એ મદદરીની પાસે જાઈ મેં એના લાઘમાં એક સોનામણોર મુદ્દી હિંદુ "હું એક
અંગેજ છું. મારે માઈકલ-નાઈજીની કથા સાંભળવી છે, જોસેફ બાળા!"

બડોર નજરે બોમેર જોઈને એઝે મને કહ્યું : "આચારે આર્ટિસ્ટ નહિં, ગારે બાળદાન
મારી રાવટીએ. એ રહી, લેવાડાની તે મારી, પણ મને હજુ એક માર્ગ નાથ જી કનું
છે મારે!"

રાત પડી. તમામ લોકો નાચગાનમાં ગુલતાન છે. છુદ્દી ચાવી ઉપર એકલવાયાં
જોસેફ મદદરી હુક્કો તાણી રહેલો છે. બાજુમાં તોંટિંગ શિયકુ માં પરની શાફતી પગના
પંજામાં દબાવીને ઘરર ઘરર અવાજ દેંતું પડ્યું છે.

"આવો ભાઈ!" મીઠી ઠટ્ટાલિયન જીબાનમાં એઝે મને આદર દીધ્યો.

"તમે ઠટ્ટાલિયન ભાષા ક્યાંથી જાણો, ભાલા!" મેં સહર્ષ પૂછ્યું.

"હું મારા ધણી માઈકલ બેણો ખૂબ ભાટક્યો છું, ભાઈ! મારે ધણીએ મને આંજરે
પરવાનગી દીધી છે તમામ વાત તને કહેવાની. તેણે એમ પણ કહેવરાવેલું છે કે તું પદ્ધતના
લોબધાટની પડખે હાટેંગના સાધ્યીમઠમાં પણ જઈ આવજે. ત્યાં સાધ્યીજ એન્જેલીન
મા છે ને, એને નાઈજીની સાથે બેનપણાં હતાં. તુંને ધણી વાતો કહેશે. મારું નામ દેજે.
એન્જેલીન મૈયા કોઈ પુરુષને મળતી નથી, પણ માઈકલની મરજ છે તેથી તુંને મુલાકાત
દેશે. મારા ખાંબિંદની આવી મહેર તો પહેલવહેલી આજ તારા ઉપર જ ઉતરી છે, હે
ભાઈ!"

"પણ માઈકલ આંદ્ધી હોય તો એ પોતે જ મને ન મળે?"

"અરે ભાઈ! મારો ધણી માઈકલ તો ચાર સાલ ઉપર ગુજરી ગયો છે. બરાબર
આ જ હિને એ કામ આવેલો."

"પણ તમે કહ્યું કે - "

"હા, હા, મેં કહ્યું કે એનો રૂહ - એનું પ્રેત મારી સાથે વાતો કરી ગયું. એનો
રૂહ હજુ આંદ્ધી પહાડોમાં જ ધૂમે છે, ને પોતાના કરેલા દરેક અપરાધની તોબાહ પોકારે
છે. એ એકોએક અપરાધની દરગુજર મળ્યા વગર એ જંપશે નહિં. આ બધું તો તને
પાછળથી સમજાશે. તને આ તમામ નાદાની લાગતી હશે. ખેર, તમે ઓતરાખંડના લોકો
માનવીની ઠચાશક્તિને શી રીતે પિછાનો? પણ ભાઈ રે! માઈકલ-નાઈજી જેવાં પ્રેમીઓને
છૂટાં પાડવાની તકાત તો મોતની પણ નથી."

"ત્યારે નાઈજી શું હયાત છે?"

"પણી ખબર પડશે. લે, હવે જલાવ તારી બીડી ને સાંભળ."

[3]

મદદરીએ વાત માંડી :

મારા બચપણમાં જ હું મારા કામરુ લોકોના ટોળામાંથી વિખૂટો પડી જંગલમાં ગુમ

ધ્યેલો. ત્યાંથી શિકારે નાકળના એક અમારે મને ઉદાહરી જઈને આપણે દ્વારા, વિજાળ બરચાંઓની લેણો મને પણ ભાગાવવા માંડ્યો. પણ એમે જિહાંની લોક, માર્ગ નાણો નાણે અમને વિદ્યા ન ચેડે. એમે કામકાજની આપણું : ચોરીમાં, નાચગાનમાં ને શિકારમાં પ્રવિષ્ટ : ખુલ્લિમાં કોઈથી ઉત્તરતો નહિં. પણ કામ? મહેના? એને ને અમારે આડવેર.

પણ હું ચતુર, અક્કલમંડ જીવાન બન્યો, એટલે માલિક મને એના કરણ્ણદ માઠકલનો ખાસ પાસવાન બનાવ્યો. બ્યુડાપેસ્ટ નગરમાં માઠકલ ભણ્યો તે તમામ વરસો હું એની જોડે જ હતો. ને માઠકલ પણ કેવો માલિક! બારી બાલો : અસલ જાતવંત મેર્યાર : કામડુર. એને જોશીલા જિગરનો જીવાન : સાથેસાથે કેવો રહ્માદિલ ને વિચારવંતો! ઓછોંબો, કંટલી કંટલી અમીરજાહીઓ એનો ઘાર જીતવા તલખતીાતી! પણ માઠકલનું દિલાંખીનું એ મહેલાતોમાં, અમીરી રૂપનાં ગુલાબોમાં એને ભાપકામાં માળો ન નાખી શક્યું, મુક્કદરમાં ભયંકર વાત માંડી હશો ને!

એનો બાપ ગુજરી ગયો, એના જેડૂતોએ એને છેતરીને કંગાલ કરી મુક્યાં. મીજ જેવો જીવાન કડક ન બની શક્યો. મને એને એક ધોડાને નભાવવા જેટલી તાકાત માંડમાં બાકી હતી. એવે ટાણે એક વાર એમે બેઠું એના બાપના ભાઈબંધ એક ઉમરગવને જાડે ગયા. ત્યાં જીવાન માઠકલના ઉપર કેવું વશીકરણ થઈ ગયું!

પહોળા ચોગાનમાં ગામના ઉમરગવો એને અમલધરોની મેદની વચ્ચે એક ફૂડળાની અંદર મારી જ જીગાની જાતનાં નટલોક કોઈ બારી જલદ નાયારંભ ખેતી રહેલાં છે, એને એ તાળીઓ પાડતાં મદ્દો-ઓરતોની વચ્ચોવચ્ચે એક જોખનવંતી કામડુર કન્યા ઘેલીનૂર ચકચૂર બનીને પોતાના બદનનું સર્પાકાર નૃત્ય, વાંજિગોના સૂરતાલ સાથે એકતાર બની જઈને બતાવી રહી છે.

મેં જોયું કે માઠકલ કોઈ કારમી ચોટ ખાઈને આ કામડુર સુંદરી સામે તાકી રહ્યો છે. એના ચહેરા ઉપર મોતના ફિકાશ ચડી આવે છે.

"ઓ જોસફ!" એણે મને કહ્યું, "આ પોતે જ મારા સ્વભની સુંદરી હું એને જ પરસીશ, ઉદાહરી જઈશ."

સાંભળીને મને કોઈ અપશુકનનો આંગંકો લાગ્યો, કેમ કે આ જીગાની લોકો - આ કામડુર લોકો - પોતાની જાતની બહાર શાદી કરતા જ નથી. ને એની કન્યાને ઉદાહરી જવી એ તો મોત સંગાથે રમવા જેવું હશે. હું તો એ પણ જોઈ રહ્યો હતો કે આ છોકરી વૈભવવિલાસની લાકસામાં ચકચૂર હતી.

સાંજ પડી, એ છોકરી - એનું નામ નાઈજરી - એક મોટા ખંડના ખૂલ્લામાં બેદી બેદી સૌના લાયની રેખાઓ જોતી હતી, અવિષ્ય ભાગતી હતી.

માઠકલ એની પાસે પહોંચ્યો, કહ્યું, "ઓ કામડુર! મારુંય કિસ્મત કહે."

પ્રથમ તો કામડુર લોકો ધંધાદરી રીતે જે ઢોંગધનૂર કરે છે તે ચાલ્યું, પણ પણી એકાંએક છોકરીએ ઉચ્ચું જોયું. એની જે કાળી મોટી આંખો તાજુઝી સાથે - ધરથરાટ સાથે માઠકલનાં મોં તરફ તાકી રહી.

"તારી હસ્તરેખામાં કાળ છે - મોત છે - મોત સિવાય કઈ જ નથી," એ પુકારી ઉદી : "તારું મોત - એને તારી સંગાથેના અનેકનું! તને દેખીને, ઓ જીવાન, મને કઈનું કાશકણો ઘાર

કોઈ થઈ જાય છે. હવે હું સમજું કે આજે તને પઢેલાં પ્રથમ ભાગનાં જ મને આ નારૂ તારા મોં પર જૂની ઓળખાસ લાગેલી. એ કોઈ ત્યાંથી મારો જોળો લાવજો નો!..

એમ કહી એલે કુકમની તાળીઓ પાડી. એની ટોળીનો એક વૃદ્ધ ચિકાળદળી હતું; કંડેલો એક કાચનો ગોળો લાવ્યો. ગોળ મેજ પર ગોળો મુકાવ્યો. કામરું સુંદરી દીવાલે હતું. એના ઉપર સાત વાર જાય ફેરવીને એ વૃદ્ધ એને સમાધિમાં સુવાડી. પછી પૂછ્યું : "નેરિયા! તને શું દેખાય છે આ ગોળામાં?"

ઘણી વાર સુધી જવાબ ન મળ્યો. પછી એક ચીસ નાખી ને ગોળાને મેજ પરથી ઉરાડી મૂકી એ ઓરડામાંથી ભાગી. હું ને માઈકલ એની પછવાડે ગયા. ચોગાનમાં જ્યાં બજવૈયાઓ વાજિત્રો બજાવી રહ્યા હતા ત્યાં એ પાગલ બનીને નાચવા લાગી. માઈકલ એને પૂછવા જાય ત્યાં તો પોતાનું માણું પાછું નાખી દઈ, ઠણ્ણ ઉડાવતી એ બોલી ઉઠી : "ગોળો કહે છે કે તારું ને મારું મુકદર સાથે દોડી રહેલ છે. પણ હું તકદીરનેવ ફરેબ દેવાની. કોઈ મહને કબજે હું નથી થવાની."

એ નાઈજી! શયતાન હતી એ. ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી એકો મારા ખાવિંદને દીવાનો બનાવ્યો. કેવી ઠગારી! ઘડી વાર મીણ જેવી મુલાયમ બનીને ખાર કરવા દિયે, અને જાણો ચૂમી સારુ તલસતી હોય તેમ હોઠ સામા ધરે; એ જ પણ પાછી સરી જઈ દૂર ખડીખડી અહુહાસ્ય કરે. આખરે મેં માઈકલને કહ્યું : "આજું છોડો - સત્તા ચલાવો, ખાવંદ! હું ગ્રીગાનીઓને જાણું છું. એ એક જ રાહ છે."

માઈકલે રુઅબ ચલાવ્યો - અને જવાબમાં એના ચહેરા પર એક ચાબુક ચોંટી ગયો. ચણોઠી જેવું લાલ લોહી ઉપડી આવ્યું, દેખીને મને ખૂબ દુઃખ થયું. શી હાલત આણો કરી છે મારા ધણીની! ફિકર નહીં. ઉડે ઉડે એને ખાર જ છે.

ત્રીજા દિવસની સાંજે કામરું લોકો ચાલ્યાં ગયાં અને માઈકલ દોડતો મારી પાસે આવ્યો : "એ જોસફ, જલદી ઘોડા પલાશો. નાઈજીએ મને પરણવાનો કોલ દીધો છે - જો હું એક વરસની અંદર બે લાખ સિક્કા લઈને એની પાસે આવું તો."

"એ લાખ સિક્કા!" મેં ચમકીને પૂછ્યું.

"ફિકર નહીં. મારી પાસે આખી બાળ છે. ચાલો જલદી."

મારો ગાંડોતૂર ધણી પાટનગરમાં ગયો. ત્યાં એણે પોતાનાં જરજરીર મૂકીને એક રકમ ઉપાડી. ને પછી અમે પહોંચ્યા ભૂમદ્ધ સાગરને કિનારે - સાં રેમોના જુગારખાનામાં.

હાર્યો, હાર્યો, મારો ધણી તમામ દોલતને ગુમાવી બેઠો. એ જાહુગરી નાઈજીના નામ પર મેં કેટલા શાપ વરસાવ્યા! ત્યાંથી અમે મોંટે કાલોના ધૂતાગારમાં દાખલ થયા.

સંધ્યા હતી. દરિયો, આકાશ અને એ બુલંદ જુગારખાનું જાણે લોહીમાં ભીજાયેલાં હતાં. મારા માલિકનાં હાથ અને મોં ઉપર પણ આથમતો સૂરજ લોહી જ રેડતો હતો.

"શુકન! સારાં શુકન!" કહેતો મારો માલિક જુગટે ચડ્યો, જત્યો, જત્યો, અપરંપાર સોનું જત્યો. ગાંસડી બાંધીને અમે પાછા બ્યુડાપેસ્ટમાં આવ્યા. ધણી મહિના થયા હતા. જાણો નાઈજી રાહ જોતી હશે. એણે કહેલું કે મારી જાતના કામરું લોકોને મારો પત્તો પૂછજો.

અમે એ સૌને પૂછવા લાગ્યા : "નાઈજી ક્યાં?"

કોઈ જવાબ ન આપે. આપણે અમે એક કામડુને પકડી મોતનો ડર ભાગવી પૂર્ણ :
“બોલ જલદી, નાઈજી ક્યાં છે ?”

“પેલા ગઢવાળા અમીર ભેગી.”

દોટમદોટ ધોડાં દોડાવીને અમે એ અમીરને ગઢે પહોંચ્યા. પણ અગાઉથી વાક મળી ગયા હશે. ગઢની દેવકી બિડાઈ ગયેલી. અમે દ્વાર પર હથોડા જીક્યા. આપણે એક ડેસા પરોળિયાએ બારી ઉધાડી. અમને દેખતાં જ એણે ફરી ભોગળ ભીડવા માંડી. પણ અમે સમય ન રહેવા દીધો. અંદર ધસ્યા. મકાનની અંદર ચડવા જઈએ છીએ ત્યાં તો રાત્રિના કોઈ પ્રેતસમું એક સફેદ કુલેવર છાયાની અંદરથી નીકળીને અમારી સામે આડા હાથ દેંતું ઊભું રહ્યું.

“આવી પહોંચ્યો - મારો કાળ આવી પહોંચ્યો,” એવા બોલ અમારે કાને પડવા. અને એક પાગલ, કરડું - ઠણાભર્યું હાસ્ય ગાજુ ઊઠંયું. એ હાસ્ય બીજા કોનું હોય? - એ નાઈજી જ હતી.

“નાઈજી! ઓ નાઈજી!” માઈકલ પુકારી ઊઠંયો : “અંહીં શું કરે છે? આમ જો, તારો હુકમ મુજબ હું પૈસા રળી લાયો. તારો કોલ સંભાર.”

“બહુ મોકું થઈ ગયું, માઈકલ !” કામડુ કુમારી બોલી ઊઠી : છહવે તો હું શ્રીમતી ટાર્નફીલ્ડ સાહિબા છું. મારો વર આવી પહોંચે તે પહેલાં તું ચાલ્યો જા, માઈકલ !”

એને ભુજપુરાશમાં લેવા માટે માઈકલ દોડંયો. ત્યાં તો એ છોકરીની પછવાદેથી કટાકના શબ્દો સંભળાયા : “હા, મારા વહાલા માઈકલ ! જે ગેરહાજર રહે તે હંમેશાં ગમાર જ છે. આપની હવે જરૂર નથી રહી. પધારી જાઓ..”

એ બોલનાર વૃદ્ધ, કરપીણ, કાળમુખો ગઢપતિ ટાર્નફીલ્ડ જ હતો.

માઈકલ પાણાણ બનીને ઊભો થઈ ગયો. પછી એણે અંતરની દર્દભરી આહ ઉચ્ચારી : “ઓ નાઈજી ! તું તો મને વચન આપી ચૂકેલી ને? હું મારાં ઘરબાર વેરી કરીને પણ તે માગી તેટલી દોલત લઈ આવેલો છું.”

“અહાહાહા !” ગઢપતિ હસ્યો. “એને દોલત કહો છો જુ તમે? એથી જ્યાદે તો શ્રીમતીએ ક્યારનીયે પોતાના પોશાક અને પગની મોજડીઓ પાછળ ખરચી નાખેલી છે.”

“પીટ્યા, જૂદુ બોલછ !” નાઈજી તાડૂકી ઊઠી.

ઉમરાવે કાળા નાગની માફક પાછા ફરીને સ્ત્રીના મોં પર જગ્બર તમાચો લગાવી દીધો. માઈકલથી આ દીકું ન ગયું. એ કૂદ્યો. ઉમરાવે ગોળી છોડી. ગોળીબાર ખાલી ગયો. માઈકલે પિસ્તોલ પડાવી લીધી, કહ્યું : “તારી એ પરણેતર છે, ખરું ને? પણ હમણાં જ એ તારી વિધવા બનશે..”

“મારે પણ એ જ જોઈએ છે, જુવાન ! કાલે સવારે દિવસ ઊ઱્યા પહેલાં આપજે બેઉ એકલા જંગલમાં મળશું : તું ઊગમણેથી આવજે હું આથમણેથી દાખલ થઈશ. બેમાંથી જે જીવતો બહાર નીકળે એ નાઈજીના હાથનો માલિક ઠરશે..”

એક કામડુ છોકરીને માટે એમ એકલહથો જંગ લડવાનું નક્કી થયું, પણ મને ઠતબાર નહોટો. મને દગ્લબ્બાજુની ગંધ હતી. એટલે પરોઢીયે હું એ અમીરના ગઢની દીવાલે જ કાન માંડી આંદ્રા દેતો હતો. મારો ડર સાચો પડવો. ઉપરની એક બારીમાં કશીક જપાણપી કામડુનો પ્યાર

મચી છે. જાણે નાઈજી ગુરુસાના બડકા કાઢી રહી છે. તામે રાહોબોળ જવાબ આપાય છો. જવાબ હેનાર ઉમરાવ ટાનફીલની જ જલાન ! મારો માત્રિક ક્ષમાનો જંગલમાં પણાય છે. ને આ વિશાસધાતી હજુ આપીએ !

દગ્યો છે ! માઈકલ, દગ્યો છે ! એવી ! ચીસો પાડતો હું જંગલમાં દોડ્યા. પણ બોકાનીદાર ખૂનીઓ અને માઈકલની વચ્ચે રમણાસ મચ્યું હતું. હું પણ તૂરી પડ્યો. અમે બન્નેએ મળીને આમરે કેટલી મહેનતે પાંચેય જલ્લાદોને પૂરા કર્યા ! ચલેએ ખોતાનું જ પરખાયા : પાંચેય એ ઉમરાવના જ નોકરો.

મેં માઈકલને દગ્યો સમજાવ્યો. અમે બેઉ ગઢમાં દોડ્યા. સીડી પર ધર્યા. એ જ ઓરડાનું દ્વાર ધક્કો દઈ ખોલ્યું. અમીરની બંદૂકના ભડકાએ આવકાર દીધ્યો.

એક ખૂશામાં નાઈજી ઉત્તી છે. એના કણા લાંબા કેશ એને એઠણીની માફક હંતું. રહેલ છે. એનાં કપડાં શરીર પરથી ચિરાઈ ગયાં છે. એના કપાળ પરના જખમાંથી લોહી વહે છે. એના હથમાં છૂરી છે. ધણીની દગ્લબાજુ ઉપર આ લોહીલોહાજ કર્યાયો. જામેલો હતો.

અમીરની પહેલી ગોળી બારણામાંથી સૂસવતી ગઈ તે પછી માઈકલ ઓરડામાં પેઢો. અમીર બીજો બાર કરે તે પહેલાં તો નાઈજીની છૂરી એના ગળામાં ઉત્તરી ગઈ હતી.

“નાઈજી ! ઓ નાઈજી !” માઈકલ ભુજાઓ પાથરીને કરગયો, “ચાલો, પોલીસ આવે તે પહેલાં નાસી છૂટીએ. આપણે પાંચ ને એક છ ખૂનો કર્યા છે. આપણે બહારવટિયા ઠયા. એ જ રસ્તા છે આપણે માટે : કાં ફાંસીનો, ને કાં પહાડોનો.”

પણ નાઈજીએ એને ડેલો દઈને તીણું હાસ્ય કરી કહ્યું : “દેખ માઈકલ, મેં તકદીર સાચું જોયેલું. દેખ ! લોહી ! હવે તો એની નીકો ચાલુ થઈ ગઈ. એ જ મારા મુક્કદરનો માર્ગ છે, પણ એ માર્ગ હું તને નહિ ઘરસરી જાઉં. એકલી હું જ જઈશ.”

એટલું બોલીને એ ભાગવા લાગી. પણ માઈકલ કહે, “મારે તારા વિનાનું જીવતર નથી જોતું. તારે જ રસ્તે મારી મુસાફરી છે. લોહી તો લોહી..”

નાઈજી નથી થોભતી. એ જાય છે. દોડીને માઈકલે એના માથા પર પોતાનો જલ્લબો નાખી દીધો. એને ઉઠાવી, જકડી, અમારા ઘોડા પર નાખી, અમે ઉપડ્યા. પોતાના ઘોડા પર નાઈજીને નાખીને માઈકલે મને કહ્યું : “જોસફ, દોડ જલદી કામતુંઓના ગામડામાં. નાઈજીના કકાને લઈને પહાડોમાં આવજો. જની ઘાટ પાસે અમે વાટ જોશું. કુહેજે એને, કે ઝીંગારીઓ અમારા વિવાહમાં ભેણ થાય. જલદી, જોસફ.”

હું ગામડે ગયો ત્યાં તો બુદ્ધાં ઝીંગાની ગાડાં, ગદીડાં ને ઘોડાં લાઈને તૈયાર ઊભો હતો. એણે કહ્યું કે, “ભાઈ, ગેલી ગોળાએ મને તમામ ખબર દીધા છે. જેવાં તકદીર ! ચાલો..”

[4]

અમે સૌએ કાર્યાધિકારીની અભેદ્ય કુલ્લેબંદીમાં વાસ લીધો. ચોપાસ અખંડ શિખરમાળા હતી, તેનેય ફરતી અખંડ પાતળી ખાઈ હતી. એક જ ઠેકાણે સાંકડો રસ્તો

હતો. ખાઈ ઉપર લાકડાનો એક નાનો પુલ હતો. પુલ ઉદ્ઘાટનાને જોગે ગાવુને પેંગવાળી તસ્વીર જગ્યા ન રહે. અદરના આજા વારામાં કંઈ કુદરતે કોરેવી જાન બીજું પુરાણ કાળના કોઈ હેત્ય-શો જબજર માનવીઓને કફરેવી ગુફાઓ હતી.

મારા ધ્યાને સજાવટ મારી દારુગોળા, લથિયાર, લુગડા, અનાજ વગેરે લાલ સાધભી લાવવા સારુ ગાડોને ઘોડા મોટો શહેરોમાં રવાના કંઈ. બાહુંન લાદં સાધભી એક તોપ પણ મેળવીને વંકી ટેકરી પર મારી દીધી, એક ઊંચી બતી લરડાવી. અંગેઓ બેસાયો.

આમ રીતસર સરકાર સામે મોરચા મારુંચા. અમારાં માથા સારે મોટાં ઠનામો તો જીદેર થઈ ચૂક્યાં હતાં. પણ પહાડોનાં જાણનેદુ જિસી લોકોમાંથી કોઈ એ લાલચમાં ન લપટાયું. કારણ? કારણ કે જિસીઓને ઊંડી દા ભરી હતી. આંદ્રિયાના ગવનર્નર રીંડ. જિસીઓને રિબાવી રિબાવી, ખોટેખોટાં કદી ન કરેલાં ખૂનો કબૂલ કરવેલાં અને ખૂનોની લાશો ન જડી તે પરથી આ અભાગી કામરુઓને માનવભક્તી અધોરીઓ ઠગવી જાંસીએ લટકાવ્યા હતા. તેઓને આજ એ વેર વાળવાનું ટાણું મળ્યું હતું.

પણ આ બધી સજાવટ અને સાધભીમાં શી મજા હતી મારુ માલિકને? જેને જારુ આ મોત નોતર્યું ને નાઈજી તો એકની બે થતી નથી. પોતાની અલાયદી ગુફામાં એ રહે છે. એનો એકેય કોડ અણપૂરેલો રહેતો નથી. છતાં એનું ટિલ નિષ્કર જ રહ્યું.

એવી જિંદગીથી કંટાળીને માઈકલે જીદેર કર્યું કે આ બધી દોલત નાઈજીને સોંપી દઈ હું જાઉં છું જગતમાં પાછો. ત્યાં સરકારની તોપે બંધાઈને ખતમ થઈ જઈશ.

કામરુઓએ ખૂબ કલ્યાંત કર્યા. પણ માઈકલ ઘોડે ચડી નીકળી ગયો. હું પણ એની જોડે મરવા ચાલ્યો, ટેકરી પરની તોપમાંથી છેલ્લી સલવામ હડૂડી ઊંડી. પણ અમે ખીજમાંથી નીકળતા હતા ત્યાં તો પછવાડે ઘોડાના દાબડા ગુંજ્યા. મારતે ઘોડે, પોતાના માથા પરનો સફેદ વાદળી સરખો ધૂંઘટ ફર્કાવતી નાઈજી આવે છે.

માઈકલે ઘોડો થોભાવ્યો. એ નીચે ઉત્તર્યો. પહેલી ભુજાઓ પાથરતી નાઈજી દોડીને એના પગમાં પડી ગઈ. બાજી પડી.

“ઓ ઘારા માઈકલ! હું નિષ્કર હતી, કેમ કે હું તને પ્રાણથી વધારે ચાહું છું. મારા તકદીરમાં લોહી છે. તારા ને મારા મિલાપમાં કાળ બેઠો છે. પણ હવે તો ભલે આવે કાળ! હું ન છટકી શકી. હવે થોડું સુખસોશલું જોઈ લઈને હું તારે હાથે ખતમ થઈ જઈશ. તું પણ મારી પછવાડે જ મરવાનો છે, તો આવ ઘારા! હા-હા-હા-હા!”

એ પાગલ હાસ્યના પડવા પહાડના પ્રત્યેક શિખરમાંથી ગુંજુ ઉઠ્યા. કાર્યાધિયન જાણે કે સાક્ષી પૂરતો હતો.

બીજે દિવસે બેઉ પરછ્યાં. ઓ ભાઈ! એ વખતની એ કામરુ ખૂલસૂરતી અને માઈકલના મોં પરનું એ સુખ - એનો જોટો મેં ક્યાંય જોયો નથી.

પછી તો ઓરતો અમારી જાસૂસો, અને સરકારી તિજોરીઓ ઉપર તૂટી પડવું એ અમારો ધંધો. અનેક જવાનો અમારી ઝોજમાં ભાગ્યા. નેકી અને મૂંગી તાબેદારી એ અમારો કાયદો. ખૂટલને માઈકલ તોપે ઉડાવતો. અને અમારી એ તમામ રાજ્યાની રાસી હતી નાઈજી.

પણ એક વરસમાં તો નાઈજીને થાક આવ્યો. બહારવટાની જિંદગી એને કડવી તેર

એઈ પડી. એનું હિત હોડી રહ્યું હતું અઠેરોમાં, અઠેરી મોજુમજુમાં અને મહોલા મળજતું નેન-ક્રાણોમાં.

એડ વાર એ મોજલી નાર તોરમાં નાર તોરમાં, નવી પોરિ જાગુરીનું નામ કર્દું, પાટનયર ચાલી ગઈ ત્યાં એને હિવસો એઈ ગયા. એની બેલજાઈની વાતો માઈક્રોફોન કરે આવવા લાગી. અમને ચારને લઈ માઈક્રોફોન વેશે જોનવા નીકળ્યા.

રાજ્યાનીના એક મુખ્યાફરાણાનામાં અમે નણ હિવસ રહ્યા, મેળામાં ખૂબ અદ્ભુત પણ નાઈજી ન જડી. રીજા હિવસની રાતે ઓચિંતી આતીને બાગ્યામાં ઊભી રહી. જોયો ઉપર બેઉ ધાર ટેક્વી, ઠડાંગાર નથને અમને નીરાણી લીધ્યા. પછી બોલી : “વાલવા, મારુ ખાવંદ ! ઓરતની જાસૂસી કરવા નીકળ્યા છો કે ! શાબાશ !”

ચુસ્સાદાર જવાબ દઈને માઈક્રોફોન એને જાલવા છલાંગ્યો એટલે નાઈજીએ ધારમાંની ચમકતી ખૂલ્લી તીણી છૂરી ધણીના ગળા પર તાકી. એ જ પલકે બારણું ઊઘડવું અને પોલીસની ટુકડી સાથે એક અફસર દાખલ થયો.

પોતાના ધણીને બચાવવા માટે નાઈજી ભુજાઓ પસારી માઈક્રોફોની આડે ઊભી રહે છે, બેખાન માઈક્રોફોની બંદૂકમાંથી ગોળી છૂટે છે. નાઈજી લોહીનો કોગળો નાખતી ઢાંલો થઈ જાય છે, ને પડતીપડતી બોલે છે કે, “ઓ મારા ધણી ! તમે નાસી છૂટો. તમારો જાન બચાવો. મને છોડી દો.”

પણ અતિ મોહું થઈ ગયું હતું. ઝાપાંપી જામી પડી. માઈક્રો વીંધાઈ ગયો. છેલ્લા દમ ખેંચતાં એનો ઉચ્ચાર એક જ હતો કે, “જોસ્ક, નાઈજીને બચાવ !”

રાતના એ અંધારામાં હું નાઈજીના શરીરને ઉપાડી બારીમાંથી કૂદી પડ્યો. ઘોડો બાંધ્યો હતો ત્યાં પહોંચ્યો ગયો. બીજા સાથીઓને બીજી લાશો હાથ કરવાનું બોલતો હું નાઈજીને લઈ પહોડોમાં પેસી ગયો. નાઈજીને ફેફસાંમાં જ જખ્મ હતો. એનો જાન નહિ બચે તેમ લાગી ગયું. થોડી વારે પાંચ-છ જખ્મી સાથીઓ એક ફક્ત માઈક્રોફોની લાશ લઈને આવી પહોંચ્યા.

એ શબને અમે એની ગુજાની બહાર જ દર્ઢનાંબું. નાઈજીએ પોતાની પથારી બહાર લેવરાવીને પિયુની આ પાયદસ્ત ધૂસકે ધૂસકે રોતાં દીઠી. મામલો ખતમ થઈ ગયો.

અજ્જબ વાત ! નાઈજીને આરામ આવ્યો. એક રાતે એ મારી પાસે ભયથી થરથરતી છતાં ચહેરા પર શાંતિ અને સુખની જલક મારતી આવી.

“મારા પ્યારાએ મને દેખા દીધીલ છે.” એણે કહ્યું, “એણે મને મારી દીધી છે. એનો રૂહ ગમગીન હતો. એણે તને વીનવીને કહેવરાવેલું છે કે આ સૌ જિંસીઓને છોડી દઈ બાકીની જિંદગી, જે તમામને આપણે ઈજા પહોંચાડી છે તેને મદદગાર થવામાં વિતાવજે. જોસ્ક ! આટલાં બધાં પાપોની તોબાહ કર્યા વગર એનો રૂહ નહિ જંપી શકે. હું પણ એ જ કામ કરવા નીકળી પડું છું.”

આ પછી તુરત જ અમે એ અજ્જબ પ્યારના સ્થાનકમાંથી ચાલી નીકળ્યાં. હું આ રીછડો રમાડી પેસા રળ્યું છું. ને જ્યાંજ્યાં દુઃખ દેખ્યું છું ત્યાં ખેરાત કરીને જીવતર વિતાવું છું, બાઈ ! અને ત્યારથી ધણી વાર માઈક્રોફોનો રૂહ મને દેખાયો છે, ને આ કામ ચાલુ ગયવા કહી ગયો છે એટલી મારી વાત થઈ. વધુ સાંભળવા સારુ તારે લોહદારની ગાળીમાં જવું પડ્યે.

એ વાખતે રીછડો ચમકીને પૂરકલો ઊભો થઈ ગયો. ને જોસફ એ અંધકારમાં નિયમ
૧૪રે જોયું. એકાએક એણે મને હતું : "જા બાઈ ! મારે તને છોટવો પડશો."
એ ચાલ્યો ગયો. પાછળ રીછડો ગયો.

[5]

હું જાણે સ્વખું જોતો હોઉ તેવો મુસાફરખાને પાછો પડ્યોચ્યો. કેવી ગેલી કથા ! હજુ
તો કેટલાય ભયાનક બનાવો એણે દબાવી રાખ્યા હશે.

સાચે જ શું એ કામરુ ડોસો આ પ્રેત સાથેના મિલાપની વાત માનતો હશે ! મારુંકલના
આત્માને પ્રાયશ્ચિત્ત વગર શાંતિ નથી એ વાત તો સાચી જ હશે ! આ જુંગલ અને આદ્ય
દુનિયાને પ્રેતલોક આટલો દૂકડો હશે એમાં નવાઈ નથી.

મેં મુસાફરખાનાની માલિકણને કહ્યું કે, "કાલે હું લોગાદારની ગાળીમાં હાટઝેગ ગામે
જાઉ છું."

"ઓહો !" એ બોલી ઉઠી : "ત્યારે તો તને તમામ વાત કરી લાગે છે જોસફએ;
જ બાઈ ! તું જસૂસ તો નથી જણાતો. માફ કરજે. બાઈ ! અમે બધાંય એ બે જષ્ણાંના
આત્માની સદ્ગતિ સારુ બંદગી કરી રહ્યાં છીએ. અરેરે ! બેઉની માથે કોઈ કાળ - ગ્રહ
ગૃહ્યો હતો."

હું મારાં માણસોને ત્યાં છોડી દઈ, એકલો, જોસફ મોકલેલા એક ભોમિયા આથે
નવી મુસાફરીએ નીકળ્યો. દિલમાં થતું હતું કે ત્યાં લોગાદારના સાધ્યી - મઠમાં શું હશે !
કદાચ એન્જેલીન મૈયા અને નાઈજીના મરતૂકની કથા કહેશે. પણ કદાચ નાઈજી મઠમાં
છૂપીછૂપી જીવતી ન હોય !

મુસાફરીમાં મને યાદ આવતો હતો જોસફ મદારી સાથેની વિદાયનો છેલ્લો પ્રસંગ
એ એકાએક કેમ ઊંઠ્યો ? એનો રીછડો ભડકેલો કેમ ?

આખરે અમે હાટઝેગ ગામે આવી પહોંચ્યા. કોશિયા અને સ્લોવક જેડૂતોથી વસેલું
એ ગામ હતું : બેડોળ અને ભૂખરું.

ભોમિયો ઘોડાં લઈને બહાર ઊભો રહ્યો. હું એકલો ગામમાં દાખલ થયો. બેઠાબેઠા
પાતળી હોકલી પીતા એક ગામવાસીને મેં મૈયા એન્જેલીનના મઠનો રસ્તો પૂછ્યો.

મુંગાંમુંગાં એણે આંગળી ચીંધી. પોતાની છાતી પર એણે હાથનો સાથિયો રચ્યો.
જાણે એ ભય પામતો હતો.

લાંબું, બેઠી બાંધણીનું, અને ગોળ બારીઓવાળું એ મકાન હતું. એના વિશાળ
બગીચાને ફરતી ઊંચી દીવાલ હતી. એના સાંકડા દરવાજા સૌંસરી નજર કરતાં મેં કાળા
ધૂંઘરવાળી સ્ત્રીઓને ટોળાબંધ પસાર થતી દેખી. જેરાત લેવા સારુ જેડૂતોનું ટોળું દરવાજે
ઉભું હતું, તેઓને ઓરાક ને કપડાં અપાઈ રહેલાં હતાં.

એક બુદ્ધાંડો આવીને એક સફેદ, સાદા, ખાલી ઓરડામાં મને લઈ ગયો. ત્યાં બે
જ ખુરશીઓ હતી.

હું બેસું છું ત્યાં તો બારણું ઊંઘડું ને એક સફેદ વસ્ત્રધારી પડછંદ માનવીએ પ્રવેશ
કર્યો. એ સ્ત્રી હતી. પણ મોં પર ઘાટો ધૂંઘર હતો. ઉઠીને મેં નમન કર્યું. મારી મુલાકાતનો
ઉદ્દેશ જણાવ્યો : "મને જોસફ -"

“જુદ્યે જ જાણી પૂર્વે છું”, કોઈ પણ હંગની વાત નેત્રો અનાજ આપીની માનવીનું
હુમાં જાણું લેનોંની મેળે પૂર્વે કહી શકાયું નથીત.

એસે રસ્તે - “તમારા આવવાની વાત મને પર્વતાદ્વારાની આવી છે, અને તમે
માઈકલના ખારની તથા મૃત્યુની ઝાંખી વાકેદ એ ગુરૂપા મોટ વાત કુણી નથી, તો
તમારે કુણી જાણું છે?”

“ખાંખી મરી ગઈ છે...” મેં પૂછ્યું.

“ના, મરી ગઈ હોતો બહેતર હતું, પણ એના શિર પર જગ્ઝ છે - ઓકલા ઓકલા
એ તમામ રમૃતિઓની જાંસડી હેવા પર ઉઠાવીને જીવવાની, એ વેગાની એ હસ્તી-રમ્ભની
પૂતળીને માટે આહે તો સરજાયેવાં છે મઠની ઓરડીનો અધ્યક્ષ અને પરાવાનાની
પ્રાર્થનાઓ.”

હું એ જેત માનવીની નજીક ગયો, ધીરે સ્વરે પૂછ્યું : “તમે પોતે જ નાનાની છો?

જીવાલમાં ધૂઘટ ઊંચો થયો. કદી નહિ ભૂલું એવું સૌંદર્ય મેળેયું, એ અધરના ઓકલ
ચુંબનને માટે માઈકલ પોતાના આત્માને વેચે, એમાં શી નવાઈ હતી! મોટી, કાજગકાજી
અને જલદ એ બે આંખો જેમજેમ મારી સામે જોતી ગઈ તેમતેમ કોઈ ઊડા હોજમાં જૂલની
પ્રતિમા જોવા એના મનોભાવ પલટાતા ગયા. જૂના હાથીદાંતને મળતો ચહેરાનો રેઝ! જાંબ
પર તદ્દન આછી સુરખી : આસપાસ આસમાની વાળ - જાંબો અટલસના ચોકલામાં મહેલી
તસવીર! અને કોઈ સુગંધી અર્ક-શા નીતરતા એના મુખભાવ : આવા સંપૂર્ણ સ્ફીન્ડને
માનવી જીવનમાં વારંવાર નથી જોવા પામતો. પહેલાં પ્રથમ જ્યારે માઈકલે આને દીવાઓની
વચ્ચે નાચતી દેખી હશે, ત્યારે એ જીવાનની આંખોમાં શાં શાં કામણ અંજાયાં હશે એ.
હું કલ્પી શક્યો.

“હુદે કદાચ તમે સમજી શક્શો -” એણો સંગીતમય સ્વરે કહ્યું, “કે મને તમામ
પુરુષો ઉપર મારી મોહિની પાથરવાના કોડ કેમ થયા હશે. હું નિજ રૂપની ઘેલડી હતી;
ને મેં એનાં મૂલ્ય બરાબર ચૂકવ્યાં છે! મારા મનની ચંચળતાને પરિણામે મારું ખ્યાર
માઈકલના પ્રાજ્ઞ ગયા. ત્યારથી હું આંહીં અંધકારમાં ગરીબોને સહય દેતી, બીમારોની
આરવાર કરતી જતું છું - મૃત્યુની, અને મૃત્યુ પછીના પિયુ-મિલાપની વાટ જોઉં છું. હુદે
તમે જાવ, ભાઈ! અને તમારા દેશમાં જઈને જો માઈકલ-નાઈઝીની કથા કહો તો દ્વારથી
ને સમજપૂર્વક કહેજો.”

ફરીને એ ઘાટો બુરખો ઢંકાઈ ગયો, અને એના હાથની આંગળીઓને ટેરવે ચુંબન
ભરીને હું ચાલી નીકળ્યો.

